



અલ્બર્ટામાં કરા પડ્યા, અનેક વાહનો વચ્ચે ટક્કર

PAGE NO. 17

પરદેશમાં દેશની મહેક એટલે



સ્વદેશ

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dir: 647-995-5640
amit4tathomes@gmail.com

KOMAL SHAH
Sales Representative
Dir: 647-624-5640
koma4tathomes@gmail.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 05 AUGUST, 2022 Vol. 19, No. 31 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

તાઈવાન પર ચીને 11 મિસાઈલ ફેંકી, 5 જાપાનમાં પડી

નેન્સી પેલોસીની મુલાકાત બાદ ચીને કરેલી કાર્યવાહીની તાઈવાને નિંદા કરી, આંતરરાષ્ટ્રીય પરિવહનને અસર

શંઘાઈ
નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદ ચીને તાઈવાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે ચીને તરફથી 11 મિસાઈલો છોડવામાં આવી હતી. તાઈવાન સરકારે આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. આ મિસાઈલો તટીય વિસ્તારોની

આસપાસના છોડવામાં આવી છે. જોકે અમુક રિપોર્ટ અનુસાર આ મિસાઈલોનું લેન્ડિંગ જાપાનમાં થયું હતું. જાપાનના રક્ષા મંત્રી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીને દ્વારા છોડવામાં આવેલી પાંચ મિસાઈલો જાપાનના ક્ષેત્રમાં પડી છે. આ એક ગંભીર મામલો છે કારણ કે તેનો સીધો



ચીનની આ અવળચંડાઈને કારણે તાઈવાને તેની મિસાઈલ સિસ્ટમ પણ સક્રિય કરી દીધી હતી. તાઈવાને કહ્યું કે હાલ તાઈવાનની સુરક્ષાને ખતરો પેદા થઈ ગયો, પ્રાદેશિક તણાવ વધી ગયો અને નિયમિત આંતરરાષ્ટ્રીય અવરજવર તથા વ્યાપાર પ્રભાવિત થયો છે.

નાલાસોપારામાં મુંબઈ પોલીસનો દરોડો 1400 કરોડનું ડ્રગ્સ પકડાયું



મુંબઈ

મહારાષ્ટ્રની કાઈમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલ, વરલી યુનિટના સભ્યો દ્વારા પાલઘર જિલ્લાના નાલાસોપારામાં એક દવા બનાવતી કંપનીના યુનિટમાં દરોડા પાડીને રૂ. 1400 કરોડની કિંમતનું મેફેડ્રોન નામનું 700 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી

છે જેમાં 4 આરોપી મુંબઈનાં અને 1 વ્યક્તિ નાલાસોપારાની છે. પકડવામાં આવેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ યુનિટ દ્વારા પ્રતિબંધિત દવાનો ઉપયોગ કરાતો હોવાની માહિતી મળી હતી જ્યાં પ્રતિબંધિત દવા મેફેડ્રોનનું ઉત્પાદન કરાતું હોવાનું જણાયું હતું. મેફેડ્રોનને 'મ્યાઉ મ્યાઉ' અથવા તો 'એમડી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More Info on PAGE 2
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

AIR CANADA
Airline Tickets - Whole Sale Price
Travel Insurance With Discount
Free Oath Commissioner Services
All Inclusive Vacation Tour Packages

KLM **AIR FRANCE**
QATAR **SWISS**
LUFTHANSA **BRITISH AIRWAYS**

Fast + Best Services
VISA, PASSPORT, OCI
INTERSKY TRAVEL
514-389-7070 **20 YEARS**

✓ Residential ✓ New Condos ✓ Investments ✓ Commercial

દુરમાં યાદ રાખશો
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office: 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: patelzakir82@gmail.com

SUPER VISA INSURANCE
Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

Need mortgage financing?
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada
bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel
Cell: 647-502-8069
Serving Greater Toronto Region Fax: 416-253-9461

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સક્ષમતા માટે યશભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. ફ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

ROMULUS IMMIGRATION **RCIC**
GLOBAL REACH CANADIAN CORE...

STUDY PERMITS, VISITOR VISA, PR & CITIZENSHIP APPLICATION

- Refugee Case and Appeal
- P.R. Applications
- Citizen Applications
- Work Permit applications
- Family Sponsorships
- Super visa
- Student Visa
- Humanitarian & Compassionate
- Grounds Applications (H&C)
- Immigration Appeals
- Express Entry
- Business visitor
- Post Graduate
- Work Permit (P.G.W.P)
- Canadian Experience Class
- Oath commissioner Services
- Provincial Nominee Application (PNP)

RCIC MOHIT AHUJA **RCIC ANKITA AHUJA**
info@romulusimmigration.com, 438-795-4690, 438-836-7400

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002



પીયર્સન એરપોર્ટ ટર્મિનલ-1 ઉપર નવા ઈગેટ્સ લોન્ચ

એક વર્ષમાં એરપોર્ટના ટર્મિનલ 3 સુધી સુવિધાને વિસ્તારવા લક્ષ્યાંક

ઓન્ટેરિયો

ટોરોન્ટો પીયર્સન એરપોર્ટ સત્તાવાર રીતે ટર્મિનલ-1 ઉપર કસ્ટમ્સ અને ઈમિગ્રેશન ઘોષણા માટે તેના નવા ઈગેટ્સનો ઉપયોગ શરૂ કર્યો છે. એરપોર્ટ પર વિલંબની સમસ્યાનું નિરાકરણ કરવા માટે એરપોર્ટ જૂનમાં ઈગેટ્સ ટેકનોલોજીનું પરિક્ષણ શરૂ કર્યું હતું.

કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)એ જણાવ્યું હતું કે, eGates ટર્મિનલ-1 ઉપર આવતા

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને તેમના કસ્ટમ્સ અને ઈમિગ્રેશન માટે નવો વિકલ્પ અપાય છે. પછી ભલે તે ઘોષણા ArriveCAN માં એડવાન્સ CBSA ઘોષણા સુવિધાનો ઉપયોગ કરીને કરવામાં આવી હોય અથવા સીધા ઉપકરણ ઉપર કરવામાં આવી હોય. CBSAએ કહ્યું કે ઈગેટ્સએ ઇલેક્ટ્રોનિક કિઓસ્ક (પ્રાથમિક ઇન્સ્પેક્શન કિઓસ્ક અથવા PIKs) જેવી જ સિસ્ટમ છે. eGates અને PIK

વચ્ચે કોઈ અલગ નિયમનકારી આવશ્યકતાઓની જરૂર નથી. માત્ર એટલો જ તફાવત છે કે કિઓસ્ક મહત્તમ પાંચના પ્રવાસી જૂથો ઉપર પ્રક્રિયા કરી શકે છે, જ્યારે eGates એક સમયે એક પ્રવાસીની પ્રક્રિયા કરે છે. તમામ 12 ઈગેટ્સને સમર્પિત ઈગેટ લેન દ્વારા અલગ કરવામાં આવ્યા છે. 16 વર્ષ અને તેથી વધુ વયના લોકો તેમની ઓળખ ચકાસવા અને તેમની કસ્ટમ્સ અને ઈમિગ્રેશન ઘોષણા વિગતો સબમિટ




કરવા માટે eGates નો ઉપયોગ કરે એ જરૂરી છે. જે પ્રવાસીઓએ ArriveCAN મારફત તેમની એડવાન્સ CBSAની ઘોષણા કરી હોય તેઓ eGate પર તેની

સમીક્ષા, સંપાદન, પ્રમાણિત અને સબમિટ કરી શકશે. એરપોર્ટ જણાવ્યું હતું કે તે એક વર્ષની અંદર ઈગેટ ટેકનોલોજીને ટર્મિનલ 3 સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે.

વાર્ષિક વેતનમાં 11.7%નો વધારો કરવા એજ્યુ. વર્કર યુનિયનની માંગ

શિક્ષણ ભંડોળને મર્યાદિત કરવાથી અનેક કર્મચારીઓ ગરીબી તરફ ધકેલાયા



ઓન્ટેરિયો

ઓન્ટેરિયો એજ્યુકેશન વર્કરોનું પ્રતિનિધિત્વ કરતા યુનિયને પ્રાંતને વાર્ષિક વેતનમાં 11.7 ટકા અથવા 3.25 ડોલર પ્રતિ કલાક વધારવાની માંગણી કરી છે, કારણ કે આ મુદ્દે બંને પક્ષોએ નવો સામૂહિક કરાર કર્યો છે.

કેનેડિયન યુનિયન ઓફ પબ્લિક એમ્પ્લોઈઝ, જે શિક્ષકો, શાળા વહીવટી કર્મચારીઓ, બસ ડ્રાઇવરો અને કસ્ટોડિયન્સ સહિત 55,000 કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે મંગળવારે સબમિટ કરેલી સોદાબાજીની દરખાસ્તોનો સારાંશ શેર કર્યો હતો. કારણ કે આ મહિનાના અંતમાં સમાપ્ત થતા હાલના કરાર મુદ્દે વાટાઘાટો ચાલુ છે. યુનિયનની દલીલ છે કે, છેલ્લા એક દાયકામાં કામદારોનાં વેતન વધારા ઉપર પ્રતિબંધ રહ્યો છે. અને હજુ પણ કુગાવો વધવાની ધારણા છે.

વિવાદાસ્પદ સરકારી બિલને કારણે તાજેતરનાં વર્ષોમાં જાહેર ક્ષેત્રનાં કામદારોના વેતનમાં વાર્ષિક એક ટકા સુધીનો મર્યાદિત

વધારો થયો છે. CUPE એ જણાવ્યું હતું કે, કાયમી કર્મચારીઓનું સરેરાશ વેતન હાલમાં 27.87 ડોલર છે, અને તેના ઓન્ટેરિયો સ્કૂલ બોર્ડર્સ કોલેક્શન ઓફ યુનિયન્સના પ્રમુખે જણાવ્યું હતું કે, સરકાર અને સ્કૂલ બોર્ડ દ્વારા શિક્ષણ ભંડોળને મર્યાદિત કરવાના પગલાંએ ઘણા શિક્ષણ કાર્યકરોને ગરીબીની સ્થિતિમાં લાવી મૂક્યા છે.

પ્રાંતીય સરકાર સાથે નવા કરારની વાટાઘાટોની પ્રક્રિયામાં અન્ય શિક્ષણ યુનિયનોએ પણ કહ્યું છે કે, તેઓ જીવનનિર્વાહના આસમાને જતા બર્ચને પહોંચી વળવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ જણાવ્યું હતું કે જૂનમાં વાર્ષિક કુગાવાનો દર 8.1 ટકા હતો, જે 1983 પછીનો સૌથી મોટો વધારો છે. ઓન્ટેરિયો સેકન્ડરી સ્કૂલ ટીચર્સ ફેડરેશનના પ્રમુખે ગયા મહિને ધ કેનેડિયન પ્રેસને જણાવ્યું હતું કે, તેમનું યુનિયન વેતન વધારાની શોધમાં છે. જે કુગાવાને જાળવી રાખે અને કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય.

US પ્રમુખ જો બાઇડેન ફરી કોરોના સંક્રમિત

વોશિંગ્ટન

અમેરિકાના પ્રમુખ જો બાઇડેન ફરી એક વખત કોરોના પોઝિટીવ થયા છે. માત્ર ત્રણ દિવસ પહેલા જ કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયા પછી તેમનો આઈસોલેશન પૂર્ણ થયું હતું. આ દરમિયાન વ્હાઈટ હાઉસે જણાવ્યું છે કે એન્ટી વાયરલ દવાની સારવાર પછી બાઇડેનને ફરીથી કોરોના થવો એક અસામાન્ય કેસ છે.

વ્હાઈટ હાઉસના ફિઝિશિયન ડો. કેવિન ઓ કોનોરે એક પત્રમાં જણાવ્યું છે કે બાઇડેનમાં આ

વખતે કોઈ પણ લક્ષણ જોવા મળ્યા નથી અને તેમની તબિયત સારી છે.

સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન ગાઈડલાઈન્સ અનુસાર બાઇડેન ફરી એક વાર ઓછામાં ઓછા પાંચ દિવસ આઈસોલેશનમાં રહેશે. સંક્રમણમુક્ત થવા સુધી તે વ્હાઈટ હાઉસમાં જ રહેશે. બાઇડેન રવિવારે વિલિમિન્ગટનમાં પોતાના ઘરે જવાના હતાં. જો કે ફરીથી કોરોના સંક્રમિત થવાને કારણે તેમના આ બંને પ્રવાસ રદ કરવામાં આવ્યા છે.

નેવિગેટ કરવા માટેના સૌથી મુશ્કેલ સ્થળોની યાદીમાં ટોરોન્ટો પણ સામેલ

ઓન્ટેરિયો

નેક્સ્ટ વેકે, એક ઓનલાઈન ટ્રાવેલ સર્ચ સિસ્ટમ છે, જેણે પ્રવાસીઓને નવા સ્થળો વિશે જાણવા અને આગળની યોજના બનાવવા માટે મદદરૂપ થવા “નેવિગેટ કરવા માટેનાં સૌથી ગૂંચવણભર્યાં શહેરો” શોધ્યાં છે.

વિશ્વમાં નેવિગેટ કરવા માટેના સૌથી મુશ્કેલ સ્થળોની યાદીમાં ટોચનું શહેર ટોરોન્ટો છે, જે ન્યૂયોર્ક કરતાં પણ ખરાબ છે અને એ સાચું છે. આ યાદીમાં બીજા સ્થાને લંડન છે,

ત્યારબાદ અનુક્રમે મેક્સિકો સિટી, ન્યુયોર્ક, પેરિસ, સાઓ પાઉલો, મેડ્રિડ અને હોંગકોંગનો સમાવેશ થાય છે. આ અભ્યાસ Google નક્શા માટે Google શોધ પર આધારિત હતો. તેઓએ લોકો સૌથી વધુ ક્યાં ખોવાઈ જાય છે અને તેઓ કેવી રીતે ખોવાઈ જાય છે તે શોધવા માટે સરેરાશ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ, ચાલવાની ક્ષમતા, સરેરાશ ટેક્સી ભાડા અને પરિવહન વિકલ્પો ઉપર પણ ધ્યાન આપ્યું હતું.

THINKING OF BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ્સની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો. મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX #SellWithABOWATH your Local REALTOR

કેનેડામાં રોજગારીની સ્થિતિ સુધરી, 1 મિલિયનથી વધુ તક

સ્ટેસ્ટીક્સ કેનેડાના અહેવાલમાં ચિતાર રજૂ : પ્રોફેશનલ્સ, સાયન્ટીફિક એન્ડ ટેકનીકલ સર્વિસ સેક્ટરમાં રોજગારીનું પ્રમાણ વધ્યું

ટોરોન્ટો

સ્ટેસ્ટીક્સ કેનેડાએ તાજેતરમાં બહાર પાડેલા માસિક અહેવાલમાં રોજગારી, કમ્પ્લીના કલાકો અને રોજગારીની તકો વિશેનો મે માસની સ્થિતિની જાણકારી આપી હતી. એ મુજબ મે ૨૦૨૧ બાદ પહેલીવાર કર્મચારીઓ જે પગાર મેળવી રહ્યા હતા એમની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. આ અહેવાલ માટે નોકરી, પગારપત્રકો અને કામના કલાકોના આંકડાઓ ઉપર આધારીત છે. જેમાં ઉલ્લેખ છે કે, ગયા મે માસમાં ૨૬ હજાર નોકરીઓ જતી રહી

હતી. જેમાં સૌથી વધુ ઓન્ટેરિયો અને મોનીટોબામાં અસર થઈ હતી. જ્યાં ૬૭૫ ૩૦ હજાર અને અઢી હજાર નોકરીની તકો છે.

એ રીતે જ બ્રિટીશકોલંબિયા એવો પ્રાંત છે જ્યાં પગારદાર કર્મચારીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. સર્વિસીઝ પ્રોડ્યુસીંગ સેક્ટરમાં અંદાજે ૧૭ હજાર નોકરીઓ જતી રહી છે. જેમાં શૈક્ષણિક સેવાઓ, હેલ્થકેર અને સામાજિક સેવા જેવા ક્ષેત્રનો સમાવેશ છે. એ રીતે જ બાંધકામ સેક્ટરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ૧૭૫૦૦ નોકરીઓ

મે માસમાં ઓછી થઈ ગઈ હતી. ઓન્ટેરિયોમાં બાંધકામ સેક્ટરમાં ઘણી નોકરીઓ ઓછી થઈ છે. જે લગભગ ત્રીજા ભાગની છે. જેનું મુખ્ય કારણ કેટલાક પ્રોજેક્ટ્સમાં થયેલો વિલંબ છે. ઓન્ટેરિયોના રીટેલ વ્યાપાર ક્ષેત્રમાં પણ રોજગારીની તકો ઓછી થઈ ગઈ છે. જે સતત બીજા મહિને જોવા મળતા ઘટાડાનું કારણ પણ બને છે. જો કે, મે-૨૦૨૧ની સરખામણીમાં આ સેક્ટરના રોજગારીના દરમાં સરેરાશ ૬ ટકાનો વધારો છે. જેની સામે ન્યુ બ્રુન્સ્વીક, બ્રિટીશ કોલંબિયા

અને ન્યુ ફાઉન્ડલેન્ડ તથા લેબ્રાડોરમાં રીટેલ ટ્રેડ સેક્ટરમાં રોજગારીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. મોટાભાગના પ્રાંતોમાં પ્રોફેશનલ્સ, સાયન્ટીફિક એન્ડ ટેકનીકલ સર્વિસ સેક્ટરમાં રોજગારીનું પ્રમાણ વધતું જોવા મળે છે. દસ હજારથી વધુ નોકરીઓ કમ્પ્યુટર સિસ્ટમ ડિઝાઇન સાથે સંકળાયેલા સેવા ક્ષેત્રમાં ઉભી થઈ શકી છે. જો કે, નોકરીઓ ઓછી થવા છતાં સામાજિક કમ્પ્લીમાં મે માસમાં વધારો જોવા મળ્યો હતો. રીટેલ ટ્રેડમાં ૮.૩ ટકાનો વધારો મે ૨૦૨૧ની સરખામણીમાં જોવા મળ્યો હતો.

ટોરોન્ટોનો ઓલ નાઈટ આર્ટ ફેસ્ટિવલ ઓક્ટોબરથી નવા રંગરૂપમાં શરૂ થશે



ટોરોન્ટો ઉપરાંત ડાઉનટાઉન, સ્કારબોરો, નોર્થ યોર્ક અને એટોબિકોક સુધીના વિસ્તારમાં આયોજન

આ વર્ષમાં પાનખરથી ટોરોન્ટોનો ઓલ નાઈટ આર્ટ ફેસ્ટિવલ ત્રણ વર્ષના અંતરાલ બાદ ફરીથી શરૂ થશે. કોવિડ-૧૯ને કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ ફેસ્ટિવલનું આયોજન થઈ શક્યું નહોતું. કેમકે આ આયોજન આખા શહેરમાં થતું હોય છે. શહેરના સત્તાવાળાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, ન્યુટ બ્લાન્ચનો આરંભ પહેલી ઓક્ટોબરના રોજ સૂર્યાસ્ત સમયે થશે અને બીજી ઓક્ટોબરના રોજ સૂર્યોદય સુધી એ ચાલશે. આ આર્ટ ફેસ્ટિવલ વિનામૂલ્યે હશે અને જેમાં ૧૫૦થી વધુ કલાકારો પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરશે. આ વખતે પ્રદર્શનનો વિસ્તાર ટોરોન્ટો ઉપરાંત ડાઉનટાઉન, સ્કારબોરો, નોર્થ યોર્ક અને એટોબિકોક સુધીનો રહેશે. આ અંગેની અખબારી યાદીમાં ન્યુટ બ્લાન્ચના આર્ટિસ્ટિક ડાયરેક્ટર ડી.

જુલી નાગમે જણાવ્યું હતું કે, અમે પહેલીવાર શહેરભરમાં ન્યુટ બ્લાન્ચ લાવવા ઉત્સુક છીએ. જેનો લાભ લઈને કલાકારો પોતાની કલાકૃતિઓને ટોરોન્ટોના લોકો સુધી પહોંચાડી શકશે. જેમાં અમે વધુમાં વધુ કલાકારોને તક આપીશું. જેમાં ૧૨ કલાકમાં પોતાની કલાકૃતિઓ રજૂ કરીને એને યાદગાર બનાવશે. આ પ્રદર્શનમાં લાઈટ ઈન્સ્ટોલેશન, શિલ્પકૃતિઓ, જાતજાતના ફુગ્ગાઓ, એ.આર. પ્રોજેક્ટ્સ, સ્કેટબોર્ડ્સ, ફેશન પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ટોરોન્ટોની ૨૦ મોટી સંસ્થાઓ આ વિનામૂલ્યે પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ ઉપરાંત અન્ય ૫૦ સીટી પણ આ સમારંભમાં જોડાશે. મેયર જોન ટોરીએ કહ્યું હતું કે, 'અમને ગર્વ છે કે અમે આ ઈવન્ટને આયોજિત કરીને આસપાસના શહેરોને પણ એમાં જોડાવા આમંત્રી રહ્યા છીએ.

એક વર્ષમાં ઘરના વેચાણમાં 43 ટકાનો ઘટાડો નોંધાયો: ગ્રેટર વાનકુવર રિયલ એસ્ટેટ બોર્ડ

વ્યાજદરમાં વધારો અને ફુગાવાની ચિંતાને કારણે ખરીદારો સાવચેત થયાનું તારણ

વાનકુવર

રિયલ એસ્ટેટ બોર્ડ ઓફ ગ્રેટર વાનકુવરના જણાવ્યા અનુસાર ગયા મહિને ઘરનું જે વેચાણ થયું તે જુલાઈ 2021ની સરખામણીમાં 43 ટકા અને આ પાછલા જૂનથી 23 ટકા ઓછું રહ્યું છે. આ પ્રદેશમાં ઘરોનું કુલ વેચાણ 1,887 હતું, જે 10-વર્ષના જુલાઈનાં વેચાણની સરેરાશ કરતાં 35.2 ટકા ઓછું છે. બોર્ડ કહે છે કે આ આંકડા નવા બજાર સાયકલ દર્શાવે છે. કેગ મુન, REBGVના વાર્ષિક પ્રેસિડેન્ટ ઓફ કોમ્યુનિકેશને જણાવ્યું હતું કે, "મને લાગે છે કે ઘર ખરીદનારાઓ અને વિકેતાઓ બે વર્ષના ઉચા સમયગાળા પછી આરામ કરવાના મૂડમાં છે. વ્યાજદરમાં વધારો અને ફુગાવાની ચિંતાને કારણે ખરીદારો સાવચેતી રાખી રહ્યા છે. ઘર ખરીદનારાઓ તેમના

પોતાના અંગત સંજોગો માટે આ ફેરફારોનો અર્થ શું છે તેનું મૂલ્યાંકન કરવા સમય માંગે છે. બોર્ડનું કહેવું છે કે નવી બજાર સાયકલના ભાગરૂપે વેચાણ માટેનાં ઘરોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. જો કે, ગયા મહિને કુલ 3,960 ઘરોની યાદી હતી, જે જુલાઈ 2021ની સરખામણીમાં લગભગ 10 ટકા અને જૂન 2022થી 25 ટકા ઘટી હતી.

દરમિયાન, પ્રદેશ માટે સંયુક્ત બેન્ચમાર્ક કિંમત ગયા મહિને 1.2 મિલિયન ડોલર કરતાં વધુ હતી, જેમાં જુલાઈ 2021થી આશરે 10 ટકાનો વધારો અને જૂન 2022થી બે ટકાનો ઘટાડો હતો. મુને જણાવ્યું હતું કે દર મહિને લગભગ બે ટકાની ધીમે ધીમે ગતિથી છેલ્લા ત્રણ મહિનામાં કિંમતો નીચે આવવાની શરૂઆત થઈ છે.

PMના ખાલી મકાનની વાડ સાથે બસ અથડાઈ

ઓટાવા

એક પ્રવાસ બસ બુધવારે સવારે 24 સસેક્સ ડ્રાઈવ ખાતેના વડાપ્રધાનના સત્તાવાર ખાલી નિવાસસ્થાનની વાડ સાથે અથડાઈ હતી. જો કે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહતી. ઓટાવામાં લેડી ડાઈવ ટૂર્સના એટીન કેમેરોને જણાવ્યું હતું કે, કંપની તેના એક વાહનના અકસ્માતની તપાસ કરી રહી છે. જેમાં તરત જેની ઓળખ થઈ શકી ન હતી, તે ડ્રાઈવર જ બોર્ડમાં હતો.

ડ્રાઈવરે અકસ્માતના સ્થળે તેનું નામ ન આપ્યું પરંતુ કહ્યું કે તે સંપૂર્ણપણે ઠીક

છે અને બસને પણ બહુ નુકસાન થયું નથી. 24 સસેક્સ ડ્રાઈવની આસપાસની વાડને પણ ખાસ નુકસાન થયું નથી. એક લાલ "એક્સિબસ" સસેક્સ ડ્રાઈવની પૂર્વ તરફથી ફૂટપાથ પર આવીને બહાર નીકળીને રહેઠાણની બહાર કાળી ધાતુ અને પથ્થરની વાડ સાથે અથડાઈ હતી. વાડનો એક ભાગ તૂટી પડ્યો હતો અને જમીન પર એનો કાટમાળ ફેલાઈ ગયો હતો. બપોર પછી, એક ટો ટ્રક દ્વારા બસને દૂર લઈ જવામાં આવી હતી. નેશનલ કેપિટલ કમિશનના સ્ટાફ જે રાજધાની વિસ્તારનું રક્ષણ કરવા

માટે જવાબદાર કાઉન કોર્પોરેશન છે, તે સ્થળ પર આવી ગયા હતા. તેમણે તૂટેલી વાડની જગ્યાએ કામચલાઉ વાડ ઊભી કરી દીધી હતી. એનસીસીના પ્રવક્તા ડોમિનિક હુરાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એનસીસી આ બાબતે પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યું છે. આ દરમિયાન અમે એ સ્થળનું રક્ષણ કરીશું." ઘટનાસ્થળે રહેલા લેડી ડાઈવ ટૂર્સના ઓપરેશન મેનેજર લિયોન હેરિસે જણાવ્યું હતું કે અકસ્માત કેવી રીતે થયો તે હજુ જાણી શકાયું નથી. "કંઈક થયું અને બસે કાબૂ ગુમાવ્યો હતો,"

ટોરોન્ટો હોસ્પિટલમાં સંસાધનોની સમસ્યા

ટોરોન્ટો

ટોરોન્ટોની હોસ્પિટલના સંચાલકોના મતે તે "ક્રિટિકલ કેર બેડ એલર્ટ" હેઠળ છે. તેના ત્રણ ઈન્ટેન્સિવ કેર યુનિટ સ્ટાફની અછતને કારણે છલકાઈ રહ્યાં છે. જનરલ હોસ્પિટલે મંગળવારે એક ઈ-મેઈલમાં જણાવ્યું હતું કે, તેનું કાર્ડિયોવેસ્ક્યુલર ઈન્ટેન્સિવ કેર યુનિટ, કાર્ડિયાક ઈન્ટેન્સિવ કેર યુનિટ અને મોડિકલ સર્જિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. અથવા તેમના તમામ ક્રિટિકલ કિટિકલ કેર બેડને સુરક્ષિત રાખવા માટે મર્યાદિત માનવ સંસાધનો છે.

ટોરોન્ટો જનરલ હોસ્પિટલનો જેમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ યુનિવર્સિટી હેલ્થ નેટવર્કના પ્રવક્તા ગિલિયન હોવર્ડ ઈ-મેલમાં જણાવ્યું હતું કે, "હાલમાં રોગચાળા દ્વારા પ્રેરિત મુદ્દાઓ સહિતના

અનેક પરિબળોને લીધે, અમે સ્ટાફની અછત અનુભવી રહ્યા છીએ. "હોવર્ડ જણાવ્યું હતું કે, જ્યારે હોસ્પિટલ ક્રિટિકલ કેર બેડ એલર્ટ હેઠળ હોય છે, ત્યારે તે એવા દર્દીઓને સારવાર આપે છે કે જેમને વિશેષ ઈન્ટેન્સિવ કેર યુનિટની જરૂર હોય છે અને દર્દીઓને જરૂરી વિશેષ કાળજી મળે તેની ખાતરી કરવા તે જરૂરી કાર્ય કરે છે. ઓન્ટેરિયો નર્સિસ એસો.ના જણાવ્યા અનુસાર ઓન્ટેરિયોની લગભગ 25 હોસ્પિટલોને સ્ટાફની અછતને કારણે લાંબા સમયાંતે તેમની સુવિધાઓને ફરી તપાસવાની ફરજ પડી હતી અને તે પછી આ ચેતવણી આપવામાં આવી છે. સોમવારે ONA પ્રમુખ કેથરીન હોયેએ જણાવ્યું હતું કે, સમાહાંતે, હોસ્પિટલોએ યુનિટ બંધ કરવા, પથારીની સંખ્યા ઘટાડવી અથવા દર્દીઓને અન્ય સ્થળોએ સ્થળાંતરિત કરવા પડ્યા હતા.

SUPER VISA MEDICAL INSURANCE Up to 45% DISCOUNT with deductible

VISITOR TO CANADA INSURANCE

LIFE INSURANCE

MORTGAGE /LINE OF CREDIT INSURANCE

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 8.00	\$ 12.00	\$ 11.00	\$ 18.00	\$ 20.00	\$ 27.00
40 Yrs	\$ 11.00	\$ 15.00	\$ 14.00	\$ 21.00	\$ 25.00	\$ 36.00
50 Yrs	\$ 25.00	\$ 35.00	\$ 32.00	\$ 45.00	\$ 60.00	\$ 85.00
60 Yrs	\$ 60.00	\$ 80.00	\$ 107.00	\$ 150.00	\$ 190.00	\$ 236.00

Rates Quotes are Preferred Plus Non Smoker Term 10 With Medical Test & Rates are Subject to Change.

- NO MEDICAL TEST LIFE INSURANCE (up to age) **85**
- LIFE INSURANCE FOR REFUGEES, STUDENTS, KIDS, ON WORK PERMIT
- GUARANTEED MONEY BACK (Life, Critical Illness & Disability Insurance)
- Corporate owned Life and Critical Insurance
- Key Person Insurance • RRSP • RESP • TFSA

Davinder Singh Chawla
TOLL : 1866.623.0865

Call For HONEST ADVICE 416.320.4614

www.financialhutltd.co Email : - Davindersinghfh@gmail.com



તંત્રી સ્થાનેથી

નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત, ચીન ફરી રઘવાયું

અમેરિકાની પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસીએ આખરે ચીનની કે કોઈ વિવાદની પરવા કર્યા વિના તાઈવાનની મુલાકાત કરી. હવે ચીન આ બાબતથી અકળાયુ છે અને ગુરુવારે તેણે તાઈવાન ઉપર 11 જેટલી બેલેસ્ટિક મિસાઈલ દાગી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ અમેરિકા અને ચીન વચ્ચે ફરી મોટી તકરાર થવાની સંભાવના છે.



તંત્રી - પ્રકાશક સ્વદેશ

આમ તો ચીન અને જગતજમાદાર અમેરિકા વચ્ચે લાંબા સમયથી મતભેદો હોવાને કારણે ખટપટ ચાલ્યા કરે છે. અમેરિકાની કોઈ વાતને ચીન માનતુ નથી. તેથી અમેરિકા પણ ચીનને કોઈને કોઈ રીતે ભેરવવા પેંતરા કરતું રહે છે. ચીન નજીક આવેલા તાઈવાનને ચીન તેવો વિસ્તાર માને છે. તેથી દુનિયાના અનેક દેશોને તેણે આ મુદ્દે દબલગીરી ન કરવા ચેતવણી આપી છે. આમ છતાં અમેરિકાના નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાતની યોજના ઘડી. નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત પહેલાના ૨૫ વર્ષમાં અમેરિકાના કોઈ ટોચના રાજકારણીએ તાઈવાનની મુલાકાત લીધી નથી. તેથી અમેરિકાનું આ પગલું ચોક્કસ ગણતરી હેઠળ હોવાનું મનાય છે. આ પહેલાં ચીને દુનિયા સમક્ષ જાહેર કર્યું હતું કે, ચીન તાઈવાન મુદ્દે કોઈ ગુસ્તાખી સહન કરી લેશે નહીં.

તાઈવાન દક્ષિણ ચીનની સમુદ્રમાં ચીનથી માત્ર ૧૦૦ કિલોમીટર દૂર આવેલો ટાપુ છે. ૧૯૪૯ સુધી તાઈવાન ચીનનો એક ભાગ હતું, જે રિપબ્લિક ઓફ ચાઈના તરીકે ઓળખાતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી મુખ્ય ચીનમાં નેશનાલિસ્ટ ગવર્નમેન્ટ સૈન્ય અને સામ્યવાદી પક્ષના સૈન્ય વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, જેમાં માઓ ઝેદાંગની આગેવાની હેઠળના પિપલ્સ લિબરેશન આર્મીનો વિજય થયો. કુઓમિન્ટાંગ નામની નેશનાલિસ્ટ પાર્ટીના નેતા ચિયાન્ગ કાઈ શેક ભાગીને તાઈવાન પહોંચી ગયા. ત્યાં રહીને તેમણે પોતાનું શાસન ચાલુ રાખ્યું.

મુખ્ય ચીનમાં સામ્યવાદી પક્ષનું શાસન ચાલુ રહ્યું, જ્યારે તાઈવાનમાં કેએમટી પક્ષે લાંબો સમય રાજ કર્યું. મુખ્ય ચીન પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના તરીકે ઓળખાયું, જ્યારે તાઈવાને રિપબ્લિક ઓફ ચાઈનાનું નામ ચાલુ રાખ્યું. તાઈવાનમાં ૧૯૪૯થી લઈને ૧૯૮૭ સુધી લશ્કરી રાજ હતું, જેની ધુરા કેએમટી પાર્ટીના નેતાઓના હાથમાં જ હતી. આ દરમિયાન તાઈવાનમાં કોઈ પણ રાજકીય વિરોધને કચડી નાખવામાં આવતો હતો. તાઈવાનના સ્થાનિક લોકોને કચડવામાં આવતા હતા. ૧૯૮૨માં તાઈવાનનું પહેલું બંધારણ બન્યું.

જે મુજબ ૧૯૮૨માં પહેલી વખત સંસદની ચૂંટણી થઈ અને ૧૯૯૬માં પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી. ત્યારબાદ દરેક ચૂંટણીમાં શાંત સત્તાપરિવર્તન થતું આવ્યું છે. ૧૯૯૨માં ચીનના સામ્યવાદી પક્ષ અને તાઈવાનના તત્કાલીન શાસક પક્ષ કેએમટી વચ્ચે એક કરાર થયો હતો, જે મુજબ એક ચીનના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ચીન તેના નકશામાં મુખ્ય ચીન ઉપરાંત મોંગોલિયા, તાઈવાન અને તિબેટને પણ

દર્શાવતુ આવ્યું છે. જેને વન ચાઈના પોલિસી કહેવામાં આવે છે. ૨૦૧૬માં તાઈવાનમાં ત્સાઈ ઈંગ વેનની સરકાર આવી તે પછી તેણે વન ચાઈના નીતિ સ્વીકારવાનો ઈનકાર કરી દેતા મોંકાણ મંડાવવાની શરૂઆત થઈ હતી. તેમણે અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદી પોતાના લશ્કરને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવા માંડ્યું હતું.

બીજી તરફ ચીન વારંવાર કહે છે કે ચીન એક છે, એક હતું અને એક રહેશે. તેણે પિપલ્સ લિબરેશન આર્મીને ચીનને એક કરવાનું કામ સોંપ્યું છે. તાઈવાન વગેરે દેશો પોતાને રિપબ્લિક ઓફ ચાઈનાનો ભાગ ગણે છે, પણ તેઓ પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના ગુલામ બનવા માગતા નથી. ચીનની જે લશ્કરી તાકાત છે, તેની સામે તાઈવાનની લશ્કરી તાકાતને નહિવત ગણી શકાય. જો ચીન તાઈવાન પર હુમલો કરે તો અમેરિકાની મદદ વગર તે પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી શકે તેમ નથી.

આ તરફ અમેરિકાનો દાવો છે કે, તેઓ એક ચીનની નીતિનો સ્વીકાર કરે છે, પણ સામ્યવાદી ચીનની સરકાર તેની એકમાત્ર સરકાર છે, તે અમેરિકાને માન્ય નથી. આ કારણે અમેરિકા તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો પણ રાખે છે. અમેરિકા કહે છે કે, નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત તેમની ખાનગી મુલાકાત હતી અને અમેરિકન સરકારને તેની સાથે કોઈ નિસબત નહોતી. તેમ છતાં તાઈવાન ઉપર ચીન હુમલો કરે તો તેને રક્ષણ આપવા અમેરિકા દ્વારા ફિલિપાઈન્સના સમુદ્રમાં રોનાલ્ડ રેગન નામનું વિમાનવાહક જહાજ અત્યારથી જ મોકલી દેવાયું છે. ચીન હાલના તબક્કે અમેરિકા સાથે યુદ્ધ ઈચ્છતું ન હોવાથી તેણે નેન્સી પેલોસીની મુલાકાતને પરાણે સ્વીકારી લીધી છે. ૧૯૭૯ સુધી અમેરિકા રિપબ્લિક ઓફ ચાઈનાને એક દેશ ગણતું હતું અને તેની સાથે રાજદ્વારી સંબંધો પણ ધરાવતું હતું. ૧૯૭૯માં તેણે પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના સાથે રાજદ્વારી સંબંધો જોડ્યા તે સાથે તેના રિપબ્લિક ઓફ ચાઈના સાથેના સંબંધોનો પણ અંત આવ્યો હતો, જેમાં તાઈવાનનો પણ સમાવેશ થતો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ તાઈવાનને ચીનનો એક ભાગ ગણતું હોવાથી તેણે તાઈવાનને પોતાના સભ્ય તરીકે પ્રવેશ આપ્યો નથી. તાઈવાનને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનાવવાનો કોઈ પણ પ્રસ્તાવ આવે તો ચીન વિટો વાપરીને તેને ઉડાવી દેતું હોય છે. જો કે, અમેરિકા તાઈવાન સાથે વેપારી સંબંધો રાખે છે અને તેને શસ્ત્રો વેચાણનો કારભાર પણ યથાવત રાખે છે. તાઈવાન માટેની અમેરિકી નીતિ પહેલાંથી જ ગૂંચવાડાથી ભરેલી છે. અમેરિકા એક બાજુ કહે છે કે તે તાઈવાનની સ્વતંત્રતાની ચળવળને ટેકો આપતું નથી. તો બીજી બાજુ તે કહે છે કે, જો ચીન તાઈવાન ઉપર હુમલો કરશે તો અમેરિકા તાઈવાનની મદદ કરશે. ટ્રમ્પના સત્તાકાળમાં તાઈવાનની રાજધાની તાઈપેઈમાં ૨૫ કરોડ ડોલરના ખર્ચે અમેરિકી સંકુલ તૈયાર કરવામાં આવ્યું હતું, જે બિનસત્તાવાર રીતે અમેરિકાની એલચી કચેરીનું કામ કરે છે. હવે અમેરિકાની આક્રમક નીતિને કારણે તાઈવાનના મુદ્દે ગમે ત્યારે ચીન-અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળી શકે તેમ છે.

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca



ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach

✓ Bedbug

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator



DIVINE YOGA



By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor
416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta



અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારી, ભક્તોને ખાસ સુવિધા મળશે

શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી મેળામાં મંદિર દર્શનનો સમય વધારાયો

અંબાજી

કોરોનાના બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે હવે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આનંદ અને ઉત્સાહથી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મંગળવારે અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં બે વર્ષના વિરામ બાદ તારીખ 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર અંબાજી ભાદરવી પૂનમના મેળા અંગેનું પ્લાનિંગ કરાયું હતું. આ વિશે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો મહામારી કોરોનાના



લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તારીખ 5 થી 10 સપ્ટેમ્બર 2022 ના છ દિવસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે. આ વર્ષે શ્રદ્ધાળુઓની ભક્તિને ધ્યાનમાં રાખીને મેળા દરમિયાન મંદિર દર્શનનો સમય વધારી દેવાશે.

ધાનેરા પાલિકાના પ્રમુખ સામે કરાયેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો

ધાનેરા

ધાનેરા નગરપાલિકાના પ્રમુખ કમળાબેન તુવર વિરૂદ્ધ પોતાના જ પક્ષના ૧૨ નગરસેવકો ભારતીય જનતા પાર્ટીના ચાર નગરસેવકોનો સાથ લઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે મામલે શનિવારે ધાનેરા નગર પાલિકા ખાતે સામાન્ય સભા બોલાવી અવિશ્વાસ દરખાસ્ત મામલે મતદાન કરાવતા કોગ્રેસના તમામ હાજર ૧૫ નગર સેવકોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાના વિરૂદ્ધમાં મતદાન કરી પોતાના પક્ષના નગર પાલિકા પ્રમુખ કમળા બેનને પ્રમુખના પદ પર કાયમ રાખ્યા

છે. શનિવારે અવિશ્વાસ મામલે મતદાન થાય એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવક હીરાભાઈ ઠક્કરે કોગ્રેસ પક્ષના પ્રમુખ ઉપપ્રમુખ અને નગરસેવકોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની બૂમો પાડી હતી. પરંતુ કમળાબેને વિશ્વાસનો મત જીતી જશે તેવા અંધાણના પગલે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો સભામાંથી વોક આઉટ કર્યું હતું. જે સભ્યો પ્રમુખની કામગીરીથી નારાજ હતા એ તમામ સભ્યોએ પ્રમુખનો સાથ આપ્યો હતો. જેના કારણે સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકી ન હતી.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services **2 Fogging Services** **3 Sanitation Services**

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets

First Time Customer gets
10% Off
on your first home service
*Mention this offer while booking

Free Estimates & Written Guarantee
Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા કચોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)
\$9.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)
\$7.50 +Tax



CATERING SPECIAL

\$ 14.99 10 items
+Tax
Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2



નવસારીમાં મંદિરનું રિમોલિશન કરતા ભાજપના 1100 કાર્યકરોના રાજીનામા

નવસારી

નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં ગત દિવસોમાં ગેરકાયદેસર રીતે બનાવેલ રાધાકૃષ્ણ મંદિરના દબાણને દૂર કરતી વખતે પોલીસે મહિલાઓને પણ માર મારવાની ઘટનાને પગલે સ્થાનિકો સહિત શહેરમાં આકોશ છે. ત્યારે આજે સર્વોદય સોસાયટીમાં રહેતા ભાજપ આગેવાનો સહિત કાર્યકર્તાઓ મળી 1100 લોકોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સામુહિક રાજીનામા જિલ્લા ભાજપ પ્રમુખને ધરી દીધા હતા. જેને લઈને ભાજપમાં સોપો



પડી ગયો છે.

નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીની પાછળની જમીનના માલિક અને સોસાયટી વચ્ચે રસ્તાને લઈને વિવાદ હતો. જેમાં સોસાયટીએ ગેરકાયદેસર રીતે મંદિર બનાવી રાધાકૃષ્ણની મૂર્તિઓ મુકીને

પુજા પણ શરૂ કરી દીધી હતી. જેમાં નુડામાં ફરિયાદ થયા બાદ કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલ્યા બાદ, ગેરકાયદે બનેલા મંદિરનું દબાણ દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેને ધ્યાને રાખી ગત 25 જુલાઈની સાંજે નુડાના અધિકારીઓએ પાલિકાના સ્ટાફ અને પોલીસ કાફલા સાથે સોસાયટી પર પહોંચી મંદિરનું દબાણ દૂર કરવા જતા સોસાયટીના લોકો સાથે ઘર્ષણ થયું હતું. જેમાં બે કલાક સુધી સોસાયટીની મહિલાઓ અને યુવાનો ન સમજતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.

અંકલેશ્વર યૂનિયન બેંકમાં 5 લૂંટારા દ્વારા ધોળા દહાડે લૂંટ

અંકલેશ્વર

અંકલેશ્વરમાં યૂનિયન બેંકમાં 5 લૂંટારાઓએ ધોળા દહાડે લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ બેંકમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લૂંટારાઓને પકડવા માટે પોલીસે તેમનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં પોલીસે પોતાનો જીવ જોખમમાં નાંખી 2 લૂંટારાઓને પકડ્યા હતા, જ્યારે 3 લૂંટારા ફરાર થતાં નેશનલ હાઈવે સહિતના પોઈન્ટ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. તમામ ઘટના

સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરમાં પીરામણનાકાના ભરચક વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખા પર આજે ચાર લૂંટારુઓ દેશી તમંચા સાથે એકાએક ત્રાટક્યા હતા. આ લૂંટારુઓ બાઈક પર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બેંકમાં જ્યારે લૂંટારાઓ ઘૂસ્યા બાદ તેમને લોકોને ડરાવવા માટે બંદૂક તાકી હતી. પરંતુ સમય સૂચકતાના કારણે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

સબંધીની પુત્રી પર રેપ કરનાર બિલ્ડરને ભગાડનારો કઝિન તેજસ પકડાયો

વડોદરા

સબંધીની પુત્રી પર રેપ કરનાર બિલ્ડર નવલ ઠક્કરને કારમાં ભગાડનાર સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. 20 વર્ષીય યુવતીને ફોસલાવી તેમજ વારંવાર ગિફ્ટો આપી રેપ કરનાર કાન્હા ગુપ્તમાંથી છૂટા પડેલા બિલ્ડર નવલ ઠક્કર સામે પીડિતાના પિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પીડિતાએ પણ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું કહ્યું હતું. આ ગુનામાં મોડેમોડે બળાત્કારની ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયેલો બિલ્ડર નવલ ઠક્કર ઈલોરાપાર્ક આઈનોક્સ શાક માર્કેટ પાસેથી રિક્ષામાં ઝડપાઈ ગયો હતો.

સુરત બેરેજ અને તાપી શુદ્ધિ યોજના અંગે સિંગાપોરની સમિટમાં માહિતી રજૂ

મ્યુનિ. રીફ્યુઝ, રીયુઝ, રીક્યુસ પર કચરાનો નિકાલ કરતી હોવાનું પ્રેઝન્ટેશન

સુરત

સિંગાપોર ખાતે યોજાયેલી વર્લ્ડ સીટી સમીટમાં સુરતના મેયરે સુરત શહેરમાં પાલિકા કચરાનો નિકાલ 5 આર પદ્ધતિથી કરતી હોવા ઉપરાંત તાપી શુદ્ધિકરણ અને તાપી નદીના બેરેજ પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી.

સિંગાપોર ખાતે વર્લ્ડ સમિટમાં ભારત માંથી એક માત્ર સુરતના મેયર ને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં આજે સમિટના

અંતિમ દિવસે સુરતના મેયર હેમાલી બોધાવાલાએ અર્બન રેસીલીયન્સ સીટી ફેસીંગ એક્સ્ટ્રીમ વિષય અંતર્ગત સુરત શહેરના વિવિધ પ્રોજેક્ટ વિશે પ્રેઝન્ટેશન સાથે સુરતના મહત્વના પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી. સુરતમાં કચરાના નિકાલ અંગે તેઓએ કહ્યું હતું. સુરત પાલિકા 5 ઈ- કોન્સેપ્ટ રીફ્યુઝ, રીયુઝ, રીક્યુઝ, રી પર્પઝ, રીસાયકલ પર કાર્યરત ભારત દેશનું પ્રથમ શહેર છે.

ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન

વલસાડ

ધરમપુરમાં 250 બેડની શ્રીમદ રાજચંદ્ર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ હોસ્પિટલ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કરતા જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થશે. લોકોને અન્ય શહેરમાં સારવાર માટે નહીં જવું પડે. 200 કરોડથી વધુના ખર્ચે 8 એકર જમીનમાં અદ્યતન હોસ્પિટલ તૈયાર કરાઈ છે.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

ZIVASA
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora



Rajesh Khurana
Broker

રાજકોટમાં પોલીસ-ધાડપાડુ વચ્ચે અથડામણ ફાયરિંગ થતાં પીએસઆઈ સહિત ૩ ઘાયલ

પથ્થરમારા બાદ ઝપાઝપી ઈજાગ્રસ્ત 4 ધાડપાડુને પોલીસે ઝડપી લીધા, બે નાસી ગયા

રાજકોટ

શહેરનાં પોશ અમીન માર્ગ પરની ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર 2માં આવેલા રિધ્ધિ - સિધ્ધિ નામનાં બંગલામાં મધરાત્રે દાહોદ, મધ્યપ્રદેશની બુકાનીધારી ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. જાણ થતાં એસઓજીની ટીમ સ્થળ પર ધસી જતાં બંને પક્ષો વચ્ચે લોહીયાળ અથડામણ થઈ હતી. જેમાં એસઓજીનાં એએસઆઈએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં બે ધાડપાડુઓ ઘવાયા હતાં. સામાપક્ષે એસઓજીનાં પીએસઆઈ

ઘવાયા હતાં. ઘાયલોને સિવિલમાં ખસેડાયા હતાં. એસઓજીની ટીમે બે ઘાયલો સહિત કુલ ચાર ધાડપાડુને ઝડપી લીધા હતા. જ્યારે બે ભાગી જવામાં સફળ થયા હતાં. એસઓજીની ટીમ ગઈકાલે રાત્રે નવ વાગ્યાથી નાઈટ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મધરાત્રે 2.30 વાગ્યાનાં અરસામાં ચિત્રકૂટ સોસાયટીમાંથી પસાર થતાં શેરી નંબર-2માં આવેલા બંગલામાં પાંચથી છ બુકાનીધારી શંકાસ્પદ હિલચાલ કરતાં દેખાયા હતાં. બંગલાનાં પ્રવેશતાં શખ્સો

મકાનનાં વરંડાની અંદરનાં ભાગે જોવા મળતાં તત્કાળ એસઓજીની ટીમે તે મકાનને કોર્ડન કરી લીધું હતું. ત્યારબાદ પીએસઆઈ ડી.બી. ખેરે બંગલા અંદર રહેલા શખ્સોને પોતાની ઓળખ આપી પડકાર્યા હતાં. તે સાથે જ અંદરથી ધાણીકૂટ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને પથ્થરમારાની આડમાં અમુક શખ્સો બંગલાની બહાર તરફ ભાગતા પીએસઆઈ ખેરે તેમને પકડવાનો પ્રયાસ કરતાં બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

મોરબીમાં મંત્રી મેરજા સામે મંડાતો મોરચો: કાંતિ અમૃતિયા ફરી સક્રિય

રાજકોટ

કડવા પાટીદારની નોંધપાત્ર વસ્તી ધરાવતા અને સીરામીક,પેપરમિલથી માંડીને અનેક ઉદ્યોગોમાં દેશભરમાં અગ્રેસર મોરબીમાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી પક્ષ પલ્ટો કરીને ભાજપમાં આવેલા અને સીધા મંત્રી બની ગયેલા બ્રિજેશ મેરજા સામે ફરી એક વાર અસંતોષ સપાટી પર આવ્યો છે અને હવે કાંતિ અમૃતિયાએ ખુલ્લામાં આવીને પોતે ખોટા કામો રોકવા રાજકારણમાં સક્રિય થાય છે અને આજથી શ્રી ગણેશાય નમઃ કરે છે તેમ જાહેર કર્યું હતું. મોરબી બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલા

કાર્યક્રમમાં હાજર મૂળ આર.એસ. એસ.ના અનેકને ૧૯૯૫થી ૨૦૧૨ સુધી સળંગ ધારાસભ્ય તરીકે જીતતા આવેલા કાંતિ અમૃતિયાએ કહ્યું મોરબીમાં લુખ્ખાગીરી અત્યારે ખૂબ વધી ગઈ છે, ખોટા કામો કરાય છે તે બંધ કરાવવા મારે આવવું પડે છે અને આજથી જ તેની શરુઆત કરું છું, મને શંકરસિંહ વાઘેલા મંત્રી બનાવતા હતા છતાં ભાજપ છોડ્યું નહોતું. અત્યારે ઉપર અને નીચે સારા માણસો છે પરંતુ, વચ્ચે લેભાગુ તત્વો ઘુસી ગયા છે. ભુદેવોએ પણ તેઓ ચૂનાવ રાજકારણમાં સક્રિય થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

માંગરોળ પાસે દરિયામાંથી કુલ ૩૯ શંકાસ્પદ ચરસના પેકેટ તરતાં મળી આવ્યા

જૂનાગઢ

માંગરોળ આસપાસના દરિયામાં અને કાંઠા આસપાસ ગતરાત્રે શંકાસ્પદ પેકેટ તરતા મળ્યા હતા.આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ અને એસઓજીએ તપાસ કરતા આજે બપોર સુધીમાં કુલ ૩૯ શંકાસ્પદ ચરસના પેકેટ મળ્યા હતા.જેમાંથી નમુના લઈ એફએસએલમાં મોકલ્યા હતા. આ ઉપરાંત સોમનાથ નજીકના દરિયામાંથી પણ બે શંકાસ્પદ પેકેટ મળ્યા હતા.હવે વિદેશી કોફીની બ્રાન્ડનું નામ લખેલા પેકેટ માફિયાઓ ફેંકી દીધા કે પડી ગયા એ મોટો સવાલ છે. હજુ પોલીસ એફએસએલ રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહી છે.

સોમનાથમાં 40 હજારે દર્શન કર્યા દરેક શિવાલયોમાં ભાવિકોની ભીડ

રાજકોટ

શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે સૌરાષ્ટ્રના શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. વિશ્વપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આજે રાત્રિ સુધીમાં અંદાજે 40,000 લોકોએ અને લાખો લોકોએ ઓનલાઈન દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને સોમનાથ દાદાની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. તો સૌરાષ્ટ્રના સેંકડો શિવાલયોમાં ભાવિકોની વહેલી સવારથી મોડી રાત્રિ સુધી ભીડ જોવા મળી હતી.



સૌરાષ્ટ્રમાં લાખો ભાવિકોએ એકટાણા-ઉપવાસ કર્યા હતા અને કેળા,પેટીસ સહિત ફરાળની માંગ નીકળી હતી. આજે શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટ, દ્વારકા, ભાવનગર સહિત વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા.

જળમાર્ગે કનેક્ટિવિટીને બ્રેક, રો-પેક્સ ફેરી સર્વિસના ફેરા રવિવાર સુધી બંધ કરાઈ

ભાવનગર

ભાવનગરને ટ્રિવન સિટી સુરત સાથે જળમાર્ગે જોડતી રો-પેક્સ ફેરી સર્વિસને એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવતા સુરત સાથેનું જળમાર્ગે કનેક્ટિવિટીને બ્રેક લાગી ગઈ છે. જેના કારણે મુસાફરોને ફરજિયાત રોડ માર્ગે જવાની નોબત આવી છે. પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવાને મેઈન્ટેનન્સનું ગ્રહણ લાગ્યું છે. ફેરી સર્વિસ ઓપરેટ કરતી કંપની દ્વારા ૫૦૦ મુસાફરની ક્ષમતા ધરાવતા ૧૨ વર્ષ જૂના વોયેજ સિમ્ફની જહાજમાં રિપેરીંગ કામ અર્થે ૧લી ઓગસ્ટથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસના ફેરા કેન્સલ કરી દેવાઈ છે.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

CANADA
IMMIGRATION



SPOUSAL SPONSORSHIP
SPECIALIST (98 percent success ratio)

Last minute student admission

Please contact us on

416-745-2466 or 91-9428973911

- Conestoga
- Seneca
- Humber
- Lambton
- Fanshawe
- Georgian
- Algoma
- Canadore
- Algoma polytechnic
- Mohawk

માર્ગદર્શન મેળવો

RCC ઇમિગ્રેશન લીગલ
એડવાઈઝર અમી મેહતા દ્વારા

તો આજે જ સંપર્ક કરો અને સાકાર કરો આપના



કેનેડા જવાનું સ્વપ્ન

સ્ટુડન્ટ વિઝા | જોબ ઓફર
PR | PNP પ્રોગ્રામ | બિઝનેસ વિઝા

અમી મેહતા

6th August, 2022
10:30 AM to 6:00 PM

Book Your Seats Now

145 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara

☎ 98255 56911 | 98256 79911 CANADA (H.O.) | VADODARA / A'BAD

CANADA	94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855
VADODARA	101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817
AHMEDABAD	139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

Email.: info@siis.ca / Website.: www.siis.ca

: Specialized in :

Job Offer & LMIA
Entrepreneur
Investor Business
Self Employed
Farm Investor



આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં સક્રિય સોમનાથમાં વાળા સહિત 10ને ટિકીટ

રાજ્યગુરુને રાજકોટ પશ્ચિમની બેઠક અપાય તેવા પણ નિર્દેશો : 15થી વધુની સૂચિ તૈયાર

રાજકોટ

ગુજરાત વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીને હજુ ચાર મહિના અને જાહેર થવાને પણ બે મહિનાથી વધુ સમય બાકી છે અને અન્ય પક્ષો દ્વારા હજુ સેન્સ પ્રક્રિયાનો પણ પ્રારંભ નથી થયો ત્યારે આમ આદમી પાર્ટીએ આંતરિક સર્વેક્ષણના આધારે ગુજરાતની ૧૮૨ પૈકી ૧૦ સીટો માટે ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે જેમાં તીવ્ર રસાકસીવાળી રાજકોટ શહેરની ૪ પૈકી રાજકોટ (અનામત)માં વશરામ સાગઠીયા અને રાજકોટ (દક્ષિણ)માં શિવલાલ બારસિયાને ટિકીટ અપાઈ છે. આ સાથે સૌરાષ્ટ્રમાં ૪ સહિત ૧૦ બેઠકોની સૂચિ જાહેર કરાઈ છે.

રાજકોટના બી.કોમ.એલ.એલ. બી. ભણેલા વશરામ સાગઠીયા ગત પાંચ વર્ષ મનપામાં કોંગ્રેસના વિપક્ષી નેતા પદે રહી ચૂક્યા છે, ચાર માસથી



આપમાં સક્રિય છે. ધારાસભા-૨૦૧૭ની ચૂંટણીમાં રાજકોટ (અનામત) બેઠક પર ભાજપના લાખા સાગઠીયા સામે માત્ર ૨૦૬૯ની નજીવી સરસાઈથી બેઠક ગુમાવી હતી. આ બેઠક અનામત છે પરંતુ, પાટીદારોની વસ્તી નોંધપાત્ર છે.

લેઉઆ પટેલ સમાજના વેપારી શિવલાલ બારસિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ખોડલધામ

ટ્રસ્ટમાં ૧૦ વર્ષ ટ્રસ્ટી રહી ચૂક્યા છે, આમ આદમી પાર્ટીમાં રાજકોટમાં ગુકાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત સોમનાથમાં જગમાલ વાળાએ ગઈકાલે જ વેરાવળમાં યોજાયેલ પાર્ટીની સભાને સફળ બનાવી હતી અને તેઓ આજે ઉમેદવાર તરીકે જાહેર થયા છે. જ્યારે ભાવનગર જિ.ના ગારિયાધરની બેઠક પર સુધીર વાઘાણીને ટિકીટ અપાઈ છે.

એ લોકોએ ઉદ્યોગપતિઓને, અમે જનતામાં રેવડી વેચી : કેજરીવાલ

કેજરીવાલની ગેરંટી નં. 2- ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી આપીશું : પાંચ વર્ષમાં તમામને રોજગાર આપીશું

રાજકોટ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે યોજાયેલી જાહેરસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને આગામી ચૂંટણીમાં જીતે તો 10 લાખ સરકારી નોકરી આપવા તથા પાંચ વર્ષમાં રાજ્યના તમામ બેરોજગારોને રોજગારી આપવા અને તે ન મળે ત્યાં સુધી યુવાન બેરોજગારોને દર મહિને રૂ. ૩૦૦૦નું ભથ્થુ આપવાની ખાત્રી આપી હતી. આ પહેલા સુરતમાં તેમણે ગુજરાતમાં ૩૦૦ યુનિટ સુધી (મહિને આશરે રૂ. ૨૦૦૦)ની વિજળી ફી આપવાનું કહ્યું બાદ આજે ગેરંટી નં. 2 આપીને ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે એ લોકો ઉદ્યોગપતિઓ, માનીતાઓ, મિત્રોમાં મફતમાં રેવડી વહેંચે છે અને અમે જનતાને રેવડી (મફત સુવિધા)

આપીએ છીએ. અમે મિત્રો, મંત્રીઓને સ્વિસ બેન્કમાં જમા કરાવવા મફત રેવડી નથી વહેંચતા મફત સુવિધાના વચનોનો તેમણે બચાવ કરી તે પરિપૂર્ણ કરવા ખાત્રી આપી હતી.

તેમણે બેરોજગારીના કારણે આપઘાતના માર્ગે જતા યુવાનોને ઈમોશનલી કહ્યું તમારો મોટો ભાઈ આવી ગયો છે અને હવે તમારે આત્મહત્યાની જરૂર નહીં પડે. ગુજરાતમાં પેપર લીક સામે કડક કાયદો બનાવીશું અને પૂરી પારદર્શકતાથી ભરતી થશે અને સરકારી ભરતીમાં ભ્રષ્ટાચારને ખતમ કરીશું તેવી ખાત્રી ઉચ્ચારી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમને સિંગાપોર જઈને દિલ્હીનું મોડેલ દુનિયા સમક્ષ રજૂ કરીને દેશનું નામ રોશન કરવાનો મોકો મળ્યો હતો પરંતુ, તેઓએ મને જવા નહોતો દીધો.

ભયંકર મંદીમાં સપડાયો અલંગ ઉદ્યોગ જુલાઈમાં માત્ર ૩ જહાજ બીચ થયા

2022-23માં 51 જહાજ ભંગાવવા આવ્યા, 4 વર્ષમાં જહાજની આવક તળિયે

ભાવનગર

ગ્રીન અને ઈકો ફ્રેન્ડલી અલંગ શિપ રિસાયકલીંગ ઉદ્યોગ જુલાઈ માસની ભયંકર મંદીમાંથી પસાર થયો છે. પાછલા ચાર વર્ષના જુલાઈ માસમાં આ વર્ષે જહાજની આવક સાવ તળિયે પહોંચી ગઈ હોય તેમ સમજાવા પૂરતા ત્રણ જ જહાજ ભંગાવવા માટે અલંગના દરિયે બીચ થયા છે. તેમાં પણ એક પેસેન્જર શિપ તો જૂન માસમાં અલંગ પહોંચી ગયું હતું. પરંતુ જુલાઈમાં પ્લોટ ખાતે બીચ થતા એક જહાજની સંખ્યા વધી હતી. અલંગ શિપબ્રેકીંગ યાર્ડ માટે નવું નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ કટણાઈભર્યું શરૂ રહ્યું છે. એપ્રિલ માસમાં ૨૦ શિપ અલંગ આવ્યા બાદ મંદીના મોજામાં શિપબ્રેકીંગ ઉદ્યોગ હાલક-



ડોલક થવા લાગ્યો હતો. જેના કારણે એપ્રિલ પછીના પાછલા ત્રણ માસમાં ભંગાવવા આવતા વહાણોનો ગ્રાફ સતત નીચે ઉતરતો રહ્યો છે. મે માસમાં ૧૬, જૂનમાં ૧૨ શિપ અલંગ ખાતે બીચ થયા બાદ જુલાઈમાં તો ભયંકર મંદી હોય તેમ જુલાઈ માસમાં ૨૪૧૯૮.૭૦ એલડીટીના માત્ર ૦૩ શિપ અલંગના દરિયાકાંઠે લાંગર્યા છે.

સરકારી નોકરી મળી નહીં, 'આઈ એમ સોરી' લખી ગોંડલમાં યુવાનનો આપઘાત

ગોંડલ

'સરકારી નોકરી માટે પ્રયત્નો કરીને હવે થાકી ગયો છું. ધીરજ ખૂટી ગઈ છે...' જેવા હૃદયદાવક શબ્દો સાથેની ચાર પાનાની સ્યુસાઈડ નોટ લખીને ગોંડલ તાલુકાનાં કમર કોટડા ગામનાં આશાસ્પદ યુવાને આપઘાત કરી લેતાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. ગોંડલનાં કમર કોટડા ગામે રહેતા જયેશ જીવરાજભાઈ સરવૈયા નામનાં ૨૬ વર્ષનાં યુવાને પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈને

જિંદગીનો અંત આણી લીધો હતો. જે અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને મૃતક યુવાને લખેલી ચાર પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે ઉચ્ચ સરકારી નોકરી મેળવીને પિતાને મજૂરી કામમાંથી નિવૃત્તિ અપાવવાનું સ્વપ્ન હતું, પણ અધુરું રહી ગયું છે. એવું લખીને પરિવારને 'આઈ એમ સોરી' લખી આપઘાત કરી લીધો હતો. પરિણામે મધ્યમવર્ગીય પરિવાર પર વજ્રઘાત થયો છે.



First Flight
FFCL Couriers Inc.

દુનીયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6 11 LB \$55 વધુ દર LB ના \$6 23 KG \$185, વધુ દર KG ના \$10 30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>
--	--

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

Brampton (West)	Scarborough	Mississauga
<p>519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p>WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p>WE MOVED TO 6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: SAT-SUN :----- 11.00 AM to 5.00 PM -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM ----: WEEKENDS :---- 11.00 AM TO 5.00PM</p>

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com

 <p>સ્વદેશ CANADA Registration # 869127209 Publication Mail Agreement / Email : info@swadesh.news</p>	<p>Return Undeliverable Canadian Address To :</p> <p>Shree Balaji Inc. MAILING ADDRESS 23 Lyric Road, Brampton ON L6S 0B4. 416-996-7755 Registered Address 713, Markham Road, Scarborough M1H 2A8.</p>	<p>Editor & Publisher : Manoj Gandhi Director : Nilesh Tailor Sub Editor : Chhaya Gandhi Montreal Bureau : Vijay Patel (514-826-7442)</p>	<p>Designed By Sabir Daroga Mevada Piyush Firoz Shaikh</p>
<p>GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)</p>		<p><small>Disclaimer : Swadesh is a weekly newspaper published by Shree Balaji Inc. in Gujarati Language. The opinions expressed in Swadesh may not be those of the publisher. Contents of this publication are covered by copyright and offenders will be prosecuted under the law.</small></p>	



મહેશ બાબુ રાજમૌલીની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરશે

મહેશ બાબુ હવે હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે થોડા સમય પહેલા કહ્યું હતું કે બોલિવુડ તેમને એકોર્ડ નથી કરી શકતું. આજના સમયમાં સાઉથના સ્ટાર્સની ફિલ્મો હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે. આ સાથે જ સાઉથના અનેક કલાકારો બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. તાજેતરમાં મહેશ બાબુને એક પ્રેસ કોન્ફરન્સમાં હિન્દી ફિલ્મો કરવા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, મને લાગે છે કે તેઓ એકોર્ડ કરી શકે તેમ નથી. આ કારણે હું મારો સમય વેડફવા માંગતો નથી. મને તેલુગુ સિનેમાથી સ્ટાર્ટઅપ અને પ્રેમ મળ્યો છે. તેમના આ નિવેદન બાદ હંગામો થયો હતો ત્યારે તેમણે ખુલાસો પણ કર્યો હતો.



સ્પર્દા

FRIDAY, 05 AUGUST, 2022

09

દિયા મિર્ઝાની 25 વર્ષીય ભાણેજનું અકસ્માતમાં નિધન



મુંબઈ : દિયા મિર્ઝાની 25 વર્ષીય ભાણેજ તાન્યા કાકડેનું કાર અકસ્માતમાં નિધન થઈ ગયું છે. અભિનેત્રીએ આ દુઃખદ સમાચારને પોતાની ભાણેજની તસવીર શેર કરીને ફેન્સને તેના નિધનના સમાચાર આપ્યા છે. સાથેસાથે તેણે એક પોસ્ટ પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, તાન્યા કોંગ્રેસ નેતા ફિરોઝ ખાનની પુત્રી છે. દિયાએ ઈન્સ્ટાગ્રામ પર ભાણેજની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, મારી ભાણેજ, મારી દીકરી સમાન, મારી જાન, આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. મારી ડાર્લિંગ તું જ્યાં પણ ત્યાં તમને શાંતિ અને પ્રેમ મળે. તે હંમેશા અમને ખુશી આપી છે. ઓમ શાંતિ. તાન્યાની કારનો અકસ્માત શમસાબાદ એરપોર્ટ રોડ પર થયો છે. તે પોતાના મિત્રો સાથે આઈ ૨૦ કારમાં ઘરે પાછી ફરી રહી હતી.

ફ્લોપ ફિલ્મોના સિલસિલા વચ્ચે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે પોતાની ફી ઘટાડી



એક પછી એક ફ્લોપ ફિલ્મોના કારણે બોલીવૂડ ટેન્શનમાં છે. ગયા સપ્તાહે પણ જે ફિલ્મો રિલિઝ થઈ છે તે બોક્સ ઓફિસ પર કશું ખાસ ઉકાળી શકી નથી અને આ સંજોગોમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે પોતાની ફીમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. આ બંને એક્ટર બંને મિયાં...છોટે મિયાં...માં ટેખાવાના છે અને તેમાં અક્ષય બંને મિયાં તેમજ ટાઈગર છોટે મિયાંના રોલમાં નજરે પડશે. આ ફિલ્મને વાસુ ભગવાનીન પ્રોડ્યુસ કરી રહ્યા છે. જ્યારે અલી અબ્બાસ ઝફર તેના ડાયરેક્ટર છે. એવુ કહેવાય છે કે, આ ફિલ્મ માટે પહેલા અક્ષયને 144 કરોડ અને ટાઈગરને 45 કરોડ રૂપિયા ઓફર કરાયા હતા પણ એ પછી બંનેની ફિલ્મો સુપર ફ્લોપ થતા મેક્સે બંને મિયાં, છોટે મિયાં...બનાવવાનું પડતું મુક્યું હતું પણ અક્ષય કુમાર તેમજ ટાઈગર શ્રોફે પોતાની ફી ઘટાડીને ફિલ્મનું બજેટ ઓછું કરી નાંખતા નિર્માતા ફિલ્મ બનાવવા માટે તૈયાર થયા છે.

યુકેનના રેફ્યુજી કેમ્પ પર પહોંચી ગ્લોબલ સ્ટાર પ્રિયંકા

રશિયા અને યુકેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું, આ યુદ્ધને કારણે બંને દેશોના ઘણા લોકોને જાન-માલનું નુકસાન થઈ રહ્યું છે. રશિયાથી દરેક બાબતમાં નબળો દેશ યુકેન ભલે યુદ્ધમાં ઝૂકી ન શકે, પરંતુ તેના નાગરિકોને પલાયન કરવાની ફરજ પડી રહી છે. તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા યુકેનના કેટલાક શરણાર્થીઓને મળી અને તેમની હાલત જોઈને અભિનેત્રી ભાવુક થઈ ગઈ. હાલમાં જ પ્રિયંકાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોલેન્ડમાં યુકેનિયન શરણાર્થીઓને મળી રહી છે. પ્રિયંકાનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પણ છે. રશિયન આક્રમકતા વચ્ચે યુકેનમાંથી ભાગી છૂટવા મજબૂર યુકેનિયન શરણાર્થીઓને પોલેન્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યાં પ્રિયંકા ચોપરાએ યુનિસેફ વતી યુકેનિયન બાળકો સાથે વાતચીત કરી હતી. વીડિયોમાં પ્રિયંકા મહિલાઓ અને બાળકો સાથે સમય પસાર કરતી અને સોશિયલ મીડિયા પર વિશ્વના સૌથી મોટા માનવ વિસ્થાપન સંકટ વિશે માહિતી શેર કરતી જોઈ શકાય છે. પ્રિયંકા યુકેનના નાના બાળકો સાથે રમતા જોવા મળે છે, સાથે જ ડ્રોઈંગ અને પેઈન્ટિંગ પણ કરે છે. બાળકોએ રિટર્ન ગિફ્ટમાં પ્રિયંકા ચોપરાને હાથથી બનાવેલી ટીંગલી પણ ભેટમાં આપી હતી. પ્રિયંકાએ મહિલાઓ સાથે તેમના અનુભવો વિશે પણ વાત કરી અને એક મહિલાને પોલેન્ડમાં તેના પરિવારના સભ્ય વિશે વાત કરતા સાંભળીને ભાવુક થઈ ગઈ. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા પ્રિયંકાએ લખ્યું, 'યુદ્ધના અદ્રશ્ય ઘા એવા હોય છે જે આપણે સામાન્ય રીતે સમાચારોમાં જોવા નથી મળતા. તેમ છતાં, તેઓ આજે મારા માટે એટલા સ્પષ્ટ હતા કે વોર્સોમાં મારા યુનિસેફ મિશનનો પ્રથમ દિવસ શરૂ થયો. યુકેનના બે તૃતીયાંશ બાળકો વિસ્થાપિત થયા છે. આ વિશાળ સંખ્યા એ યુદ્ધની વિનાશક વાસ્તવિકતા છે જ્યાં સરહદ પાર કરનારા 90% લોકો મહિલાઓ અને બાળકો છે.



વિશ્વના સૌથી મોટા માનવ વિસ્થાપન સંકટ વિશે માહિતી શેર કરતી જોઈ શકાય છે. પ્રિયંકા યુકેનના નાના બાળકો સાથે રમતા જોવા મળે છે, સાથે જ ડ્રોઈંગ અને પેઈન્ટિંગ પણ કરે છે. બાળકોએ રિટર્ન ગિફ્ટમાં પ્રિયંકા ચોપરાને હાથથી બનાવેલી ટીંગલી પણ ભેટમાં આપી હતી. પ્રિયંકાએ મહિલાઓ સાથે તેમના અનુભવો વિશે પણ વાત કરી અને એક મહિલાને પોલેન્ડમાં તેના પરિવારના સભ્ય વિશે વાત કરતા સાંભળીને ભાવુક થઈ ગઈ. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા પ્રિયંકાએ લખ્યું, 'યુદ્ધના અદ્રશ્ય ઘા એવા હોય છે જે આપણે સામાન્ય રીતે સમાચારોમાં જોવા નથી મળતા. તેમ છતાં, તેઓ આજે મારા માટે એટલા સ્પષ્ટ હતા કે વોર્સોમાં મારા યુનિસેફ મિશનનો પ્રથમ દિવસ શરૂ થયો. યુકેનના બે તૃતીયાંશ બાળકો વિસ્થાપિત થયા છે. આ વિશાળ સંખ્યા એ યુદ્ધની વિનાશક વાસ્તવિકતા છે જ્યાં સરહદ પાર કરનારા 90% લોકો મહિલાઓ અને બાળકો છે.



'કેટલાક લોકોને લાગે છે કે મને આ દેશથી પ્રેમ નથી' - આમિર ખાન

આમિર ખાનના ડ્રીમ પ્રોજેક્ટ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મની રીલિઝ પહેલા જ સોશિયલ મીડિયા પર તેને બોયકોટ કરવા માટે માંગણી થઈ રહી છે. ત્યારે આ ફિલ્મ અંગે જે નેગેટિવ વાતાવરણ સર્જાયું છે તે વિશે આમિર ખાને નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા ટ્રેન્ડ થઈ રહ્યું છે તેના કારણે આમિર ખાન મુશ્કેલીમાં મુકાયો છે. આમિર ખાને આ અંગે જણાવ્યું કે, એક ફિલ્મ બનાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. એક એક્ટર જ નહીં પરંતુ અનેક લોકોની લાગણીઓ જોડાયેલી હોય છે. ફિલ્મ જોયા બાદ તમારા પાસે તેને પસંદ-નાપસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ફિલ્મની રીલિઝ પહેલા આ પ્રકારની વસ્તુઓથી દુઃખ થાય છે. ખબર નહીં શા માટે લોકો આવું કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, હું સ્વીકારું છું કે, કેટલાક લોકોને લાગે છે કે, મને આ દેશથી પ્રેમ નથી. હું તે લોકોને કહેવા ઈચ્છીશ કે તેઓ જેવું વિચારી રહ્યા છે તે સત્ય નથી.



સૌથી નાનીવયના પરમવીર ચક્ર વિજેતા પર ચિત્રાંગદા ફિલ્મ બનાવશે

મુંબઈ : ચિત્રાંગદા સિંહ ફરી એક ફિલ્મનું નિર્માણ કરવાની છે. તે સૌથી નાની પરમવીર ચક્ર વિજેતા સૂબેદાય યોગેન્દ્ર યાદવ પર ફિલ્મ બનાવવાની છે આ પહેલા તેણે સૂરમા ફિલ્મનું નિર્માણ કર્યું હતું જેમાં હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સંદીપ સિંહ પર આધારિત હતી જેમાં દિલ્લિજીત દોસાંગ અને તાપની પશુ જોવા મળ્યા હતા. હવે ચિત્રાંગદાએ પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ એક વધુ ઇસ્પેશિયલ સ્ટોરી બનાવવાના હક્ક મેળવી લીધા છે. આ ફિલ્મ સૂબેદાય યોગેન્દ્ર યાદવે કારગિલ વોરની લડાઈ લડી હતી. ત્યારે તે ફક્ત ૧૯ વરસનો હતો. સૌથી ઓછી વયમાં પરમવીર ચક્ર મેળવનાર તે સહુ પ્રથમ વ્યક્તિ હતો. સૂબેદાય યોગેન્દ્ર યાદવે દેશના ઇતિહાસમાં પરમ વીર ચક્ર મેળવનારી ત્રણ જીવિત વ્યક્તિઓમાંનો એક છે.



ઉર્ફી જાવેદ અને મલાયકા અરોરા પર દેશમાં અશ્લીલતા ફેલાવાનો આરોપ

મુંબઈ : સોશયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ અને મલાયકા અરોરા મુશ્કેલીમાં ફસાઈ તેવી શક્યતા છે. આ બંને પર દેશમાં અશ્લીલતા ફેલાવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. સોશયલ એક્ટિવિસ્ટ અને બિન સરકારી સંગઠને બન્ને અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમણે પોલીસ કમિશનરને એક પત્ર આપ્યો છે અને પુરાવા તરીકે તેમની થોડી તસવીરો પણ આપી છે. મીડિયા રિપોર્ટના નુસાર, આ ફરિયાદનામાંમાં લખ્યું છે કે, ઉર્ફી જાવેદ અને મલાયકા અરોરા ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ જઈ રહી છે. જેથી યુવાઓને ખોટા મેસેજ મળી રહ્યા છે. ભારતમાં મહિલાઓ પૂજનીય ગણવામાં આવે છે. તેથી આ બન્ને અભિનેત્રીઓની આવી વર્તણૂક બદલ તાત્કાલિક અમલમાં મુકાતી એફઆરઆઈ નોંધવામાં આવે. સોશયલ મીડિયા પર ઉર્ફી જાવેદના એકથી એક અતંરંગી તસવીરો અને વીડિયો વાયરલ થતા હોય છે. થોડા જ દિવસો પહેલા તે સેમી ન્યૂડ જોવા મળી હતી. આ પછી તેની આલોચના પણ થઈ છે. તે લોકોની ટીપ્પણી અને આલોચના પ્રત્યે બદરકાર છે. જ્યારે મલાયકાઅરોરા પણ અંગ પ્રદર્શન કરતાં પોશાક પહેરતી જાહેરમાં જોવા મળતી હોય છે તેથી એનજીઓએ તેને પણ લપેટમાં લીધી છે.



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!
રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

ઓસામા બિન લાદેનની વફાદારીમાં ઝવાહિરન આખા પરિવારની કુરબાની

ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું તર્પણ

નિયાના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અને એક સમયે આખી દુનિયા જેના નામથી થથરતી હતી તે આતંકવાદી અયમાન અલ ઝવાહિરીને અમેરિકાએ આખરે પતાવી દીધો. આ સાથે જ યુએસએ દુનિયાને સંદેશ આપ્યો કે, તેની સાથે દુશ્મની રાખનારને તે ક્યારેય છોડતો નથી. અમેરિકામાં 9-11નો હુમલો થયા બાદ તેમાં સામેલ આતંકવાદીઓને શોધી શોધીને મારવા તે જ યુએસનો ટાર્ગેટ હતો. ઝવાહિરીને મારી નાંખ્યો હોવાની જાહેરાત અમેરિકાના પ્રમુખ જો બાઈડને રાષ્ટ્રને સંબોધન દરમિયાન કરી.

અમેરિકાએ ઝવાહિર સામે ભરેલા આકરા પગલા પાછળ મુખ્ય બે કારણો છે. અમેરિકાએ ઝવાહિરીને મોતને ઘાત ઉતારી દઈને નાઈન ઈલેવનના હુમલાનો બદલો તો લીધો જ છે પણ તેની સાથે સાથે પોતાની તાકાત પણ સાબિત કરી છે. 21 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અલ કાયદાના મોહમ્મદ અઝ્લા સહિતના આતંકવાદીઓએ પ્લેન હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તથા અમેરિકાના લશ્કરી હેડક્વાર્ટર પેન્ટાગોનમાં ઘૂસાડી દીધા હતા.

આ હુમલાથી ભારે તબાહી થયા સાથે આખી દુનિયામાં અમેરિકાનું નાક કપાયું હતું. તેથી અમેરિકા આ હુમલાનો બદલો ક્યારેક પણ લેશે તે નક્કી જ હતી. ઘટનાના 10 વર્ષ બાદ 9-11ના સૂત્રધાર મનાતા લાદેનને મારી નાંખી અમેરિકાએ સ્પષ્ટ કર્યું હતું કે તેની સાથે કોઈપણ રીતે દુશ્મની કરનાર કે ખોટું કરનારને તે છોડશે નહીં. લાદેનના ખાત્મા પછી ઝવાહિરીને મારી નાંખવો એ જ તેનું લક્ષ્ય હતું. આખરે ઝવાહિરનો ખાત્મો કરીને અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલામાં માર્યા ગયેલા લોકોનું તર્પણ કર્યું છે. ઝવાહિરીના મોત સાથે આતંકવાદનું એક કલંકિત પ્રકરણ પૂરું થયું છે.

વાસ્તવમાં તો અમેરિકાએ 2011માં લાદેનનો ખાત્મો કરી નાંખ્યો એટલે અલ કાયદા ઢીલું પડી ગયું. જે બાદ અલ કાયદાની કમાન અયમાન અલ ઝવાહિરીએ સંભાળી, પણ અમેરિકાને ખબર જ હતી કે, લાદેનને સહયોગ આપવામાં ઝવાહિર પહેલાથી જ સક્રિય હતો. તેથી



અમેરિકાએ સતત તેના પર નજર રાખી. ઓગસ્ટ 2011માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવી ત્યારથી ઝવાહિરી કાબુલમાં રહેતો હતો. અમેરિકા તેના ઉપર નજર રાખીને બેઠું હતું. અને રવિવારે તક મળતાં જ ડ્રોનની મદદથી મિસાઈલ છોડીને ઝવાહિરીને પતાવી દીધો.

અબોટાબાદમાં અમેરિકી હુમલામાં ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ ઝવાહિરીએ અલ કાયદાની કમાન સંભાળી હતી. પરંતુ આતંકવાદ સાથેનો તેનો નાતો જૂનો હતો. 2011માં અલ કાયદાનો ચીફ બન્યો, તેનાં વરસો પહેલાં તે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાયો હતો. દુનિયામાં

પ્રાસંગિક
ધવલ શુક્લ



કેરો યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાંથી સ્નાતક થયો પણ તેના બહુ પહેલાં એ આતંકવાદી બની ચૂક્યો હતો.

ઝવાહિરી બુદ્ધિશાળી હતો. તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ આતંકવાદને ગતિ આપવામાં કર્યો. હજારો યુવાનોને પણ તેણે આતંકવાદી ગતિવિધિઓમાં જોડી દીધા અને હજારો નિર્દોષોના મોત માટે તે જવાબદાર હતો. ઘણા મોટા મોટા આતંકવાદી હુમલા પાછળ તેનો હાથ રહ્યો છે.

કેન્યા અને તંઝાનિયામાં 1998માં અમેરિકાના દૂતાવાસમાં થયેલા આતંકવાદી હુમલાનું ધડયંત્ર રચનારમાં ઝવાહિરી મુખ્ય હતો.

અમેરિકાએ આતંકી હુમલાનો 21 વર્ષ પછા બદલો લઈને અનેકને સંદેશ આપી દીધો કે તેની સાથે દુશ્મની કરનાર કે ખોટું કરનારને તે ક્યારેય છોડશે નહીં

અનેક દેશોમાં આતંકવાદી હુમલા કરવામાં તેનો હાથ હતો. મૂળ ઈજિપ્તનો રહેવાસી ઝવાહિરી આંખોનો ડોક્ટર હતો અને માત્ર 14 વર્ષની ઉંમરે આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયો હતો. પ્રથમ વખત ધરપકડ કરાઈ ત્યારે તેની ઉંમર 14 વર્ષની જ હતી. ઝવાહિરના પિતા કેરો યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ઝવાહિરી પણ

આ હુમલામાં 224 લોકોનાં મોત થયાં હતાં. 2004માં લંડનમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ પણ ઝવાહિરીનું જ ભેજુ હતું. આ સમયે પદ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પાંચ દાયકામાં ઝવાહિરી ઘણા આતંકવાદી હુમલામાં સામેલ રહ્યો અને દુનિયામાં અરાજકતા ફેલાવતો રહ્યો. લાદેન સાથેની તેની દોસ્તી વફાદારીની

હદે હતી. આ વફાદારીની કિંમત તેણે પોતાના પરિવારની કુરબાની ચઢાવીને આપી છે. કાબુલના હુમલામાં તેની પત્ની, પુત્રી અને પૌત્રના પણ મોત થયા છે. આ પહેલાં તેની દિકરી મરિયમ પણ અમેરિકાએ કરેલા હુમલાને કારણે મોતને ભેટી હતી. મરિયમ ઓસામા બિન લાદેનની પૂત્રવધૂ હતી. લાદેનના દિકરા હમજા સાથે તેના નિકાહ થયા હતા. હમજાનું પણ 2011માં અમેરિકાના કાઉન્ટર ઓપરેશનમાં મોત થયું હતું.

અલ ઝવાહિરીએ અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી) નામે આતંકવાદી સંગઠન બનાવ્યું હતું. ભારતમાં જન્મેલા આતંકી આસિમ ઉમરને ઝવાહિરીએ અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)નો વડો બનાવ્યો હતો. આ સંગઠનનો ઉદ્દેશ પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને મ્યાંમાર તેમજ બાંગ્લાદેશમાં હુમલા કરવાનો હતો. એક્યુએપીએ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને મુસ્લિમોની હત્યાઓ થાય છે.

અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ પણ કર્યો હતો. આ કાયદા દ્વારા ભારતમાં મુસ્લિમોને પતાવી દેવાશે તેથી મુસ્લિમોએ જિહાદ કરવી જ પડે એવું અલ કાયદાનું કહેવું હતું. અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં કર્ણાટકમાં હિંદુઓનો મુદ્દો ચર્ચા ત્યારે ઝવાહિરીએ ફરી વીડિયો મારફતે દેખા દઈને અલ્લાહુ અકબરના નારા લગાવનારી છોકરીનાં વખાણ કર્યાં હતાં. ઝવાહિરિ આ રીતે અવારનવાર ભારત વિરોધી ઝેર ઓકતો રહ્યો હતો. ઝવાહિરીએ 2011માં ભારત સામે જિહાદ છેડવાનું એલાન કરીને ભારતમાં આતંકવાદી હુમલાની ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો. જો કે, ઝવાહિરી કદી એવો હુમલો ભારતમાં કરાવી ના શક્યો. એ પછી 2011માં ઝવાહિરીએ એક વીડિયો જાહેર કરીને કાશ્મીરમાં સક્રિય આતંકીઓને હિંદુઓ પરના હુમલા વધારી દેવા કહ્યું હતું.

ગત મહિનાની શરૂઆત માં Google Chrome ઝીરો-ડે ખામી જોવા મળી હતી. જે ઈઝરાયેલની સ્પાયવેર કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું અને મધ્ય પૂર્વમાં પત્રકારોને નિશાન બનાવી એટેક કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Czech સાયબર સિક્યુરિટી ફર્મ દ્વારા કેન્ડીરુ સ્પાયવેરને સૈટો ટેક માલવેર સાથે સરખાવ્યું છે. જે વિન્ડોઝ મોલવેર ડબ ડેવિલ્સટોંગ, પેગાસસ જેવી ક્ષમતાઓ સાથેનું મોડ્યુલર ઈમ્પ્લાન્ટ જમાવવા માટે અગાઉની અજાણી ખામીઓનો લાભ લેવાનો ઈતિહાસ ધરાવે છે. કેન્ડીરુ સ્પાયવેરને NSO ગ્રુપ, કોમ્પ્યુટર સિક્યુરિટી ઈનિશિયેટિવ કન્સલ્ટન્સી પી.ટી.ઈ. લી. અને Positive Technologies એ નવેમ્બર 2021 માં યુ.એસ. કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મેલીસીયસ સાયબર પ્રવૃત્તિઓ માં સામેલ થવા બદલ એન્ટિટી લિસ્ટમાં ઉમેરવામાં આવી હતી.

ખાસ કરીને સૌથી વધુ એટેક્સ Lebanon (મધ્ય પૂર્વમાં Syria અને Israel ની નજીક આવેલો દેશ) માં હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા સંશોધક Jan Vojtesek જેમણે ખામીની શોધની જાણ કરી અને જણાવ્યું કે આ એટેકમાં પત્રકારને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ નબળાઈને CVE-2022-2294 તરીકે ઓળખવામાં આવે છે. Google Chrome બ્રાઉઝરના

Candiru સ્પાયવેર

WebRTC ઘટકમાં મેમરી કરપ્ટ કરીને શેલકોડ એક્ઝિક્યુશન તરફ દોરી શકે છે. 4 જુલાઈ, 2022 ના



રોજ Google દ્વારા આ વિષે સંબોધવામાં આવ્યું હતું. હમણાં Apple અને Microsoft દ્વારા Safari અને Edge બ્રાઉઝર્સમાં પેચ કરવામાં આવી છે.

માર્ચ 2022 માં આ સ્પાયવેરના ટૂલસેટ અપગ્રેડ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઝીરો-ડે ખામીનો ઉપયોગ કરીને વોટરિંગ હોલ એટેક દ્વારા લેબનોન, તુર્કી, યમન અને પેલેસ્ટાઈનમાં યુઝર્સને લક્ષ્ય બનાવ્યા હતા. Lebanon માં જોવા મળેલા એટેક્સમાં ડોમેનમાંથી

મેલીસીયસ JavaScript કોડ ઈન્જેક્ટ કરવા માટે ન્યૂઝ એજન્સીના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી

વેબસાઈટ સાથે બાઈન્ડ કરીને યુઝર્સને મેલીસીયસ સર્વર પર રીડાયરેક્ટ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વોટરિંગ હોલ ટેકનિક દ્વારા યુઝર્સના બ્રાઉઝરની પ્રોફાઈલ બનાવવામાં આવે છે. જેમાં લગભગ 50 ડેટા પોઈન્ટનો સમાવેશ થાય છે. જેમાં ભાષા, ટાઈમઝોન, સ્ક્રીનની માહિતી, ડીવાઈસનો પ્રકાર, બ્રાઉઝર પ્લગઈન્સ, રેફરર અને ડીવાઈસની મેમરી જેવી વિગતોનો સમાવેશ થાય છે. અવાસ્તે મૂલ્યાંકન કર્યું કે

શોષણ માત્ર ઈચ્છિત લક્ષ્યો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેની ખાતરી કરવા માટે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. હેકરો દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટાને મૂલ્યવાન ગણવામાં આવે તો શૂન્ય-દિવસના શોષણને પછી પીડિતના મશીનને એનક્રિપ્ટેડ ચેનલ પર પહોંચાડવામાં આવે છે. શોષણના બદલામાં શેલકોડ અમલીકરણ પ્રાપ્ત કરવા માટે WebRTC માં હીપ બફર ઓવરફ્લોનો દુરુપયોગ કરે છે. શૂન્ય-દિવસની ખામીને સેન્ડબોક્સ એસ્કેપ એક્સપ્લોઈટ સાથે સાંકળવામાં આવી હોવાનું કહેવાય છે, જેથી તેનો ઉપયોગ ડેવિલ્સટોંગ પેલોડને છોડવા માટે કરવામાં આવે.

આ સ્પાયવેર યુઝર્સના વેબકેમ અને માઈક્રોફોન, કી-લોગિંગ, એક્સફીલ્ટરિંગ મેસેજિસ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી, પાસવર્ડ્સ, લોકેશન્સ અને ઘણું બધું રેકોર્ડ કરવામાં સક્ષમ છે. ત્યારે તે સંવેદનશીલ સાઈન કરેલ કર્નલ ડ્રાઈવર ("HW.sys") માં પણ મેલીસીયસ કોડ ઈનપુટ કરે છે. આ જાન્યુઆરીની શરૂઆતમાં ESET એ સમજાવ્યું હતું કે કેવી રીતે સંવેદનશીલ સાઈન કરેલ કર્નલ ડ્રાઈવરો બ્રિંગ યોર ઓન વલ્નેરેબલ ડ્રાઈવર (Bring Your Own Vulnerable Driver - BYOVD) નામનો અભિગમ વિન્ડોઝ મશીનોમાં પ્રવેશ મેળવવા માટે મેલીસીયસ પ્રવૃત્તિ કરીને અસુરક્ષિત ગેટવે બનાવી શકે છે.

Proofpoint એ જાહેર કર્યું કે ચીન, ઈરાન, ઉત્તર કોરિયા અને તુર્કી સાથે જોડાયેલા હેકિંગ ગ્રુપ 2021ની શરૂઆતથી સ્પાયવેર અને માલવેર ફેલાવવા માટે પત્રકારોને નિશાન બનાવી રહ્યા છે.

beinghumanmj

શીર્ષક : બાળમજૂર, કવચિત્રી : હિના મોદી

જુઓ,
અમારા શહેરમાં
વર્લ્ડ રેકોર્ડબ્રીજીસ
ફક્ત -
ચારસો બાળમજૂરોની
કરામત છે આ!
નીકળી હતી -
હું, ઈશ્વર શોધવા
રસ્તે -

ટોળેબંધ
બાળમજૂરો મળી ગયા.
એક જાદુગર
કશુંક તો
આંખમાં આંજી ગયો,
એક બાળમજૂર
શહેરની વચ્ચોવચ્ચ
ઐતિહાસિક ધમારત
બાંધી ગયો.

રોગોથી બચાવતો દૂધીનો જ્યૂસ

ગરમીની સીઝનમાં દૂધીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. દૂધીમાં એવા તત્વો છે જે શરીરના રોગને દૂર કરે છે. તેમાં 12 ટકા પાણી હોય છે અને અન્ય ભાગમાં ફાઈબર હોય છે. ભારતમાં લાખો લોકો સ્વસ્થ રહેવા માટે દૂધીનો જ્યૂસ રોજ પીએ છે. તેમાં શરીરની ગરમીને શોષી લેવાનો ગુણ હોવાની સાથે પિત્તને દૂર કરે છે અને સ્થૂળતાને દૂર કરવામાં લાભદાયી રહે છે. જો તમે બીમાર થવા ઈચ્છતા નથી તો તમારે રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ આ જ્યૂસનું સેવન કરવું. તો જાણો કેવી રીતે બનાવશો દૂધીનો જ્યૂસ.

જ્યૂસ બનાવવાની સામગ્રી

- 300 ગ્રામ દૂધી
- 5-6 નંગ ફૂદીનાના પાન
- 1/2 ટી સ્પૂન જીરું
- થપટી કાળા મરીનો પાવડર
- મીઠું સ્વાદ અનુસાર

જાણો બનાવવાની રીત

સૌ પહેલા દૂધીને ધોવી લો અને પછી તેને નાના ટુકડામાં સુધારો. હવે બ્લેન્ડરમાં દૂધીના ટુકડા ઉમેરો અને તેમાં ફૂદીનાના પાન મિક્સ કરો. બધાને બ્લેન્ડ કરી લો. જ્યારે જ્યૂસ બને ત્યારે તેમાં મીઠું, મરી પાવડર અને બરફ મિક્સ કરીને સર્વ કરો.



જાણો શું મળશે ફાયદો

1 જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તેઓએ આ જ્યૂસનું સેવન કરવું. નિયમિત રીતે આ જ્યૂસ પીવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. વિટામિન, પોટેશિયમ, આયર્ન વધારે હોય છે. તમે તેને રોજ ખાલી પેટે પીશો તો વધારે ફાયદો થશે.

2 હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની છે. દૂધીના જ્યૂસમાં પોટેશિયમ વધારે મળે છે બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે આ જ્યુશ ખુબ જાણીતું છે.

3 દૂધીમાં ફાઈબર હોય છે જે તેમાં રહેલા પાણીની સાથે મળીને પાચનક્રિયાને સરળ બનાવે છે. તેના જ્યૂસને નિયમિત રીતે પીવાથી કબજિયાત સુધરે છે. આ સિવાય એસિડિટીમાં પણ આરામ મળે છે.

4 જે લોકો વધારે તળેલું ભોજન લે છે કે દારૂનું સેવન કરે છે તેમને લિવરમાં સોજાની સમસ્યા વધે છે. એવામાં તમે દૂધી અને આદુના રસનું સેવન કરી શકો છો. તેનાથી આરામ મળશે.

5 જો તમારી બોડીમાં ગરમીનું પ્રમાણ વધારે છે અને તમને માથામાં દર્દ રહે છે કે અપચાની સમસ્યા રહે છે તો તમારે આ જ્યૂસ પીવો જોઈએ. દૂધીના જ્યૂસમાં આદુ મિક્સ કરીને પીશો તો તમને વધારે ફાયદો થશે.

6 દૂધીનો જ્યૂસ નિયમિત રીતે પીવાથી બ્લડ પ્રેશર ડેગ્યુલેટ થાય છે અને તેનાથી હૃદયની સાથે જોડાયેલી સમસ્યાઓ સારી થાય છે.

કાળા, લાંબા અને સુંદર વાળ માટે અપનાવો ઘરેલું નુસખા



સુંદરતા અને સાથે જ વાળની સુંદરતા મહિલાઓ કે પુરુષો બંનેને પસંદ હોય છે. સ્કીન કેરની સાથે સાથે હેયર કેરમાં પણ યજ્ઞાનો લોટ મદદરૂપ બને છે. જ્યારે પણ બેસનનો લેપ કે પેક યૂઝ કરાય છે ત્યારે તેની ખાસ અસર જોવા મળે છે. તેનો ઉપયોગ કરવાની ખાસ રીત જાણી લેશો તો તમે પણ રોજ તેનો ઉપયોગ કરી શકાશે.

માસ્ક બનાવવા માટે

- ઈંડાનો સફેદ ભાગ - દહીં - બદામનું તેલ - વિટામિન ઈની કેપ્સૂલ આ તમામ ચીજને મિક્સ કરીને હેયર માસ્ક તૈયાર કરો. આ માસ્કને 30-35 મિનિટ માટે વાળ પર લગાવો. આ પછી તેને પાણીથી ધોઈને વાળ સાફ કરી લો. જો શેમ્પૂ કરો છો તો માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો.

ચણાના લોટના ફાયદા

■ બેસનમાં અનેક ખૂબી હોય છે જે સ્કીનને ડીપ કલીન કરે છે. માથામાં થયેલી ડર્ટ, ડેડ સેલ્સની

સફાઈમાં મદદ કરે છે. તેનાથી વાળની હેલ્થ પણ સારી બને છે.

- વાળની ચમક વધારવામાં પણ ચણાનો લોટ મદદ કરશે.
- ચણાને પીસીને બેસન બનાવવામાં આવે છે. તે પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમનો બેસ્ટ સોર્સ છે. તે પોષક તત્વો વાળ મજબૂત બનાવે છે.
- આયર્નના પોષણથી વાળનો ગ્રોથ વધારવામાં મદદ મળે છે.
- જો વાળમાં ઓઈલ આવવાની સમસ્યા રહે છે તો હેર માસ્કનો ઉપયોગ કરો. તેને અઠવાડિયામાં 2 વાર જરૂરથી ચૂંટ કરો.
- જો વાળ શુષ્ક છે તો તેના હેયર માસ્કનો ઉપયોગ કરીને વાળમાં ઓલિવ ઓઈલ, નારિયેળ તેલ અને સરસિયાનું તેલ ચૂંટ કરો.
- વાળના મૂળમાં તેલ લગાવ્યા બાદ 30-45 મિનિટમાં શેમ્પૂ કરી લો. આમ કરવાથી વાળ હેલ્થી રહેવાની સાથે તેનો ગ્રોથ પણ સારો રહે છે.

લઢાકાંડ મામલે હાઈકોર્ટની લાલ આંખ : સમીર પટેલ સહિત 4ના જામીન નામંજૂર

આરોપીઓની અરજી પર સાત દિવસમાં નિર્ણય લેવા નીચલી કોર્ટને નિર્દેશ

અમદાવાદ

રાજ્યમાં ખળભળાટ કેમીકલ લઢાકાંડમાં એમોસ કંપનીના આરોપી ડાયરેક્ટર સમીર નલીનભાઈ પટેલ સહિતના ચારેય ડાયરેક્ટરોને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે સાફ ઈન્કાર કરી દીધો હતો. આરોપી સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજીત ચોકસીની આગોતરા જામીન અરજી હાઈકોર્ટના જસ્ટિસ

નિખિલ એસ.કેરિયર્લે ફગાવી દેવાનું વલણ અપનાવતાં તમામ આરોપીઓને પોતાની આગોતરા જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. આરોપીઓ ધરપકડથી બચવા સીધા હાઈકોર્ટમાં આવ્યા હતા પરંતુ તેમની આ પ્રયુક્તિ સફળ રહી ન હતી. હાઈકોર્ટે આરોપીઓને સેશન્સ કોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી હતી અને સેશન્સ કોર્ટને આરોપીઓની આગોતરા

જામીન અરજી પર સાત દિવસમાં નિર્ણય આપવા તાકીદ કરી હતી. ચક્રચારભર્યા લઢાકાંડ કેસમાં ૫૦થી વધુ નિર્દોષ લોકોના મોતને લઈ ધંધુકા-બરવાળા પોલીસ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે અને આ પ્રકરણમાં એમોસ કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ સહિતના ચારેય ડાયરેક્ટરોને સમન્સ જારી કરવા છતાં તેઓ પોલીસ સમક્ષ હાજર થતા નથી.

બરવાળા લઢાકાંડના 14 આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા

મિથાઇલ આલ્કોહોલ લાવનાર અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની પુછપરછ થશે

અમદાવાદ

બરવાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પોલીસે કેમીકલ સપ્લાય કરનાર વ્યક્તિ અને બુટલેગરો સહિત કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવીને પુછપરછ કરી હતી. જે રિમાન્ડ સોમવારે પૂર્ણ થતા તમામને ભાવનગર ખાતે જેલ હવાલે કરાયા હતા. જ્યારે આ કેસમાં દિનેશ ઉર્ફે બન્દી નામના વ્યક્તિનું નામ ખુલ્યું

છે. જે હાલ ભાવનગરમાં સારવાર હેઠળ હોવાથી બાદમાં તેની પુછપરછ કરવામાં આવશે. આરોપીઓમાં રોજીદ ગામની મહિલા બુટલેગર ગજુબેન વડદરિયા, ચોકડી ગામે કેમીકલ યુક્ત દેશી દારૂ બનાવનાર પીન્ટુ દેવીપુજક, વિનોદ કુમારખાણીયા અને તેનો ભાઈ સંજય કુમારખાણીયા (રહે.નભોઈ, તા. બરવાળા), કેમીકલ સપ્લાય કરવામાં સંડોવણી ધરાવતા ધધુકાના હરેશ આંબલિયા, જટુભા લાલુભા, વિજય પઢિયાર, સત્રી, રાજુ, અજીત કુમારખાણીયા, ભવાન રામુ અને ચમન રસિકનો સમાવેશ થાય છે.

9 ઈજનેરી કોલેજમાં પ્રવેશ પ્રતિબંધ 38 કોલેજની 4775 બેઠક ઘટાડાઈ

અમદાવાદ

જીટીયુ દ્વારા કરાયેલા ઈન્સપેક્શનમાં રાજ્યની ૯ ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં સ્ટાફ અને સુવિધાઓ સહિતની ખામીઓ જણાતા આ વર્ષ માટે નો એડમિશન ઝોનમાં મુકાઈ છે. જ્યારે વિવિધ યુજી-પીજી અને ડિપ્લોમા કોર્સની ૩૮ કોલેજોની બેઠકો ઘટાડી દેવાઈ છે. જેના પગલે ૪૭૭૫ બેઠકો ઘટી છે. ઉપરાંત ૯ કોલેજો નો એડમિશન ઝોનમાં મુકાતા આ કોલેજોની વિવિધ બ્રાંચની મળીને ૨ હજારથી વધુ બેઠકો પણ ઘટશે.

આમ આ વર્ષે હાલના તબક્કે વિવિધ ટેકનિકલ કોર્સમાં ૬૭૦૦થી વધુ બેઠકો ઘટી છે. જીટીયુ દ્વારા દર વર્ષે સંલગ્ન કોલેજોમાં એકઝમિક ઓડિટ અંતર્ગ તમામ કોલેજોમાં પાસેથી સ્ટાફ-સુવિધાઓ બાબતનો સેલ્ફ ડિકલેરેશન રિપોર્ટ મંગાવવામા આવે છે. રિપોર્ટ બાદ જે કોલેજોમાં ખામીઓ હોય તેવી કોલેજોને નોટિસ મોકલવામા આવે છે અને પુર્તતા માટે આદેશ કરવામા આવે છે ત્યારબાદ જીટીયુ દ્વારા કમિટી મોકલી ઈન્સપેક્શન કરાવી સ્ટાફ-સુવિધાની ખરાઈ કરવામા આવે છે.

પડતર પ્રશ્નોનાં મૂદે રાજ્યના 8500 તલાટીની બેમુદતી હડતાળ રાજકોટ

ગુજરાતમાં 14250 ગ્રામ પંચાયતોમાં 8500 પંચાયત વિભાગનાં તલાટીઓ ફરજ બજાવે છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે અગાઉ તા. 7 સપ્ટેમ્બર 2021 મીએ રાજ્યવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું પરંતુ એ સમયે પંચાયત મંત્રી બ્રજેશ મેરજા અને મુખ્યમંત્રીએ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. જો કે તે બાદ પ્રશ્ન નહીં ઉકેલાતા ગત સોમવારથી તલાટીઓ હડતાળ પર ઉતરી ગયા છે.

યુવાનોને અગ્રેસર બનવા માટેની નવી શિક્ષણ નીતિ તક આપશે: પ્રકાશ જાવેડકર

રાજકોટ

નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિને અમલમાં લાવવા માટે ઘણા વર્ષોથી મહેનત કરવામાં આવી છે. આ રાષ્ટ્રિય શિક્ષણ નીતિને લીધે વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ થશે, તેમાં છુપાયેલા ગુણોને વિશિષ્ટ ઓળખ મળશે તેમ મંગળવારે અહીં કેન્દ્રના પૂર્વ માનવ સંશોધન મંત્રી પ્રકાશ જાવેડકરે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ભારતના યુવાનો નવી શિક્ષણ નીતિ ચકી, ઈનોવેશન, સ્ટાર્ટઅપ, રમતગમત સહિતનાં ક્ષેત્રોમાં અગ્રેસર બનશે. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણક્ષેત્રના તજજ્ઞોથી ઉપસ્થિત હોલમાં પ્રકાશ જાવેડકરે મોદી @20 પુસ્તક ઉપર આધારીત એક રસપ્રદ ઉદ્બોધનમાં નવી રાષ્ટ્રિય શિક્ષણની ઉપયોગીતા વિશે રસપ્રદ ઉદ્બોધન આપ્યું હતું.

હવે ગરબા રમવું મોંઘુ પડશે, સરકારે પાસ પર 18 ટકા જીએસટી લગાવ્યો

વડોદરા

2022 માં નવરાત્રિ તો ઉજવાશે, પરંતુ ગરબાના પાસ પર GST લાગુ કરાયો. જેથી હવે ગરબા કરવું મોંઘુ પડશે. રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખ્યો છે. જો ગરબાના ડેઈલી પાસ 499 રૂપિયાથી વધારાનો હશે તો GST લાગશે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મોટા મોટા પાર્ટી પ્લોટ પર ગરબાનું આયોજન કરાય છે. ત્યારે પાસના ભાવ વધવાથી આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. ટિકિટના ભાવ વધુ હશે તો ખેલેયાઓ પાસ ખરીદશે નહિ, જેથી તેમની આવક પર અસર પડશે. ત્યારે આયોજકો અને ખેલેયાઓએ ગરબાના પાસ પરથી GST હટાવવા માંગણી કરી છે.

સૌરાષ્ટ્રમાં લમ્પીને કારણે 1200થી વધુ પશુનાં મોત થયાં છતાં સહાય માટે સરકાર નિઃસહાય

રાજકોટ

સૌરાષ્ટ્રમાં લમ્પીનાં વાયરસથી પશુધન મોતનાં મુખમાં ધકેલાઈ રહ્યું છે મોટા ભાગનાં ગામોમાં વાયરસ ફેલાયો હોવા છતાં તંત્ર સબ સલામતનાં દાવા કરી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સતાવાર રીતે 1200 થી વધુ પશુઓનાં મોત લમ્પીથી થયા હોવા છતાં માલધારીઓને સહાયની બાબતમાં સરકારે જાણે હાથ ઉચા કરી દીધા હોય તેમ કોઈ ગાઈડ લાઈન જારી કરવામાં આવી નથી. મંત્રીઓ અને તંત્રને સતત

રજુઆતો કરાઈ રહી છે પરંતુ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. માલધારીઓને દુધાળા પશુઓનાં મોતથી આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય સરકાર તત્કાળ સહાય જાહેર કરે રોષભેર માગણી કરી રહ્યા છે. સૌરાષ્ટ્રનાં તમામ 11 જિલ્લામાં લમ્પી વાયરસ ફેલાઈ ગયો છે. પશુપાલન વિભાગનાં સતાવાર સુત્રોએ 1500 થી વધુ ગામોમાં 1200 થી વધુ પશુઓનાં મોત થયા હોવાનું સ્વીકાર્યું છે જો કે બીન સતાવાર મોત તો અઢી હજાર જેટલો

ઉચો હોવાની શક્યતા છે. છેલ્લા બે મહિનાથી લમ્પી વાયરસથી પશુઓમાં ફેલાઈ રહ્યો છે અને મોતનાં કિસ્સા સામે આવી રહ્યા હોવા છતાં જેમનાં પશુઓનાં મોત થયા છે તેમને એક રૂપિયાની પણ સહાય અત્યાર સુધીમાં ચૂકવાઈ નથી. સૌરાષ્ટ્રમાં પશુપાલન વ્યવસાય એ ગ્રામિણ અર્થતંત્રમાં મોટો હિસ્સો ધરાવે છે ત્યારે ખેડૂનો - માલધારીઓનાં દુધાળા પશુઓનાં મોતથી દૂધની આવક જે થતી હોય છે તેને મોટો ફટકો પડ્યો છે.

સંક્ષિપ્ત સમાચાર

ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે અવસાન

અમદાવાદ : ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે 100 વર્ષની વયે નિધન થયું છે. હજુ થોડા સમય પહેલા જ તેઓ શતાયુ થયા હતા. મેઘાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીના અંગે અંગમાં વહેતો હતો. પિતા મેઘાણીની સવા શતાબ્દી અને પુત્ર મહેન્દ્ર મેઘાણીના આયુષ્યની શતાબ્દીનો અનોખો સંયોગ પણ સર્જાયો હતો. 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રે 8 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મહેન્દ્ર મેઘાણીના નિધનથી ગુજરાતના સાહિત્યજગતમાં દુઃખનું મોઝું ફરી વળ્યું છે. મહેન્દ્ર મેઘાણીના સંતાનો દ્વારા સોશિયલ મીડિયામાં તેઓના નિધનની જાણકારી આપવામાં આવી હતી. મહેન્દ્ર મેઘાણીનો વર્ષ 1923ની 20મી જૂને તેમનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે આ તેમનું શતાબ્દી વર્ષ હતું. ભાવનગર અને અમદાવાદમાં અભ્યાસ કર્યા પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો.



મન્ડીપોક્સ: એરપોર્ટમાં વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ

અમદાવાદ: મન્ડીપોક્સના કેસમાં ચિંતાજનક વધારો થવા લાગ્યો છે અને અત્યારસુધી સમગ્ર દેશમાંથી ૭ કેસ નોંધાયા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ ઉપરાંત દિલ્લી, મુંબઈ, બેંગલુરુ એરપોર્ટમાં વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે પણ મુસાફરના તાવ, પીઠ તેમજ સ્નાયુમાં દુઃખાવાના લક્ષણ જોવા મળે તેમને સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં છેલ્લા એક મહિનાથી વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટમાં વિદેશથી આવતા જે પણ મુસાફરમાં મન્ડીપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તેને અસારવા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે.

તિસ્તા શેતલવાડની જામીન અરજીમાં સીટને નોટિસ : જવાબ રજૂ કરવા નિર્દેશ

અમદાવાદ: ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રના ચક્રચારભર્યા કેસમાં સેશન્સ કોર્ટે સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઈપીએસ આર.બી.શ્રીકુમારની રેગ્યુલર જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દેતાં હવે તિસ્તા શેતલવાડ ગુજરાત હાઈકોર્ટના શરણે આવી છે. તિસ્તાએ કેરલી જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે તપાસનીશ એવન્સી સીટ અને સરકારપક્ષને નોટિસ જારી કરી હતી. હાઈકોર્ટે સરકારપક્ષને જવાબ રજૂ કરવા પણ નિર્દેશ કર્યો હતો અને તિસ્તાની જામીન અરજીની વધુ સુનાવણી તા.૧૯મી સપ્ટેમ્બર પર રાખી હતી. તિસ્તા દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીમાં તેણીએ નીચલી કોર્ટના હુકમને પડકાર્યો છે તિસ્તાએ એવો પણ બચાવ રજૂ કર્યો હતો કે, ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા કોમી તોફાનોમાં તેણી રમખાણચરતો માટે સરકાર સામે લડી તેથી કિન્નાપોરી રાખી તેણીને ભોગ બનાવાઈ રહી છે.

ચિરિપાલ ગ્રુપ પરના દરોડામાં રૂ. ૧૦૦૦ કરોડના બિનહિસાબી વહેવારો પકડાયા

24 કરોડની રોકડ અને 20 કરોડના દાગીના, સોનું પકડાયું: લૉકર ઓપરેટ હજીય બાકી

અમદાવાદ
ગુજરાત સ્થિત ટેક્સટાઈલ અને ટેક્સટાઈલ પ્રોસેસિંગ તથા કેમિકલ સેક્ટરમાં સક્રિય ચિરિપાલ ગ્રુપ પર આવકવેરા કચેરીએ પાડેલા દરોડામાં રૂ. ૧૦૦૦ કરોડના બિનહિસાબી વહેવારો પકડી પાડવામાં સફળતા મળી છે. તદ્દુપરાંત રૂ. ૨૪ કરોડની બિનહિસાબી રોકડ અને રૂ. ૨૦ કરોડના બિનહિસાબી દાગીનાઓ પણ પકડી પાડવામાં સફળતા મળી છે, એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ

ટેક્સિસની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વીસમી જુલાઈએ ચિરિપાલ ગ્રુપની અમદાવાદ, સુરત, આણંદ, ખેડા, મુંબઈ, હેદરાબાદ અને કોલકાતા ખાતેની કચેરી અને અમદાવાદના ઈસરો વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન જામ કરવામાં આવેલા દસ્તાવેજ પુરાવાઓ પરથી મળતા નિર્દેશો મુજબ ચિરિપાલ ગ્રુપે મોટે પાયે કરવેરાની ચોરી કરી રહ્યું છે. તેઓ રોકડથી મોટો વેપાર કરતાં

હોવાનું પણ બહાર આવ્યું છે. રોકડથી કરેલા વેપાર ચોપડામાં બતાવતા જ નહોતા. આ જ રીતે બોગસ ખરીદી પણ બતાવતા હતા. રિયલ એસ્ટેટના સેક્ટરમાં કરવામાં આવેલા વહેવારોમાંથી રોકડની આવક થઈ હોવાનું પણ તેમણે દર્શાવ્યું છે. કોલકાતા સ્થિત માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી કંપનીઓના શેરના પ્રીમિયમ બતાવીને કેટલીક રોકડ છુપાવી હોવાનું પણ આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે.

વિરોધ વ્યક્ત કરવા વિદ્યાર્થીઓએ પોતાના રક્તથી CMને પત્ર લખ્યો

- આણંદ વેટરનરી કોલેજમાં ઈન્ટર્નશિપ ભથ્થાની માંગણી સાથે વિદ્યાર્થીઓની હડતાળ

આણંદ
કામધેનુ યુનિવર્સિટીના ૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ હડતાળના ત્રીજા દિવસે આણંદની વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રક્તથી ચિન્હિત પત્રો રાજ્યના મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓને લખી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વેટરનરી ઈન્ટર્ન તબીબોને સ્ટાઈપન્ડ બાબતે અન્ય રાજ્યોની સરખામણીમાં અન્યાય થઈ રહ્યો

હોવાને લઈ વેટરનરીના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગત ૧લી ઓગસ્ટથી વિદ્યાર્થીઓ અનિશ્ચિતકાલીન હડતાળ પર ગયા છે. આજે હડતાળના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ઠેરઠેર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આણંદની વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રક્તથી સંકેતિક પત્રો લખવામાં આવ્યા હતા. જેમાં તેમની માંગ તથા પીડા રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી આ પત્રો રાજ્યના મુખ્યમંત્રી, નાણામંત્રી તથા પશુપાલન મંત્રીને મોકલી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જામનગરમાં બોગસ બિલીંગ કૌભાડ: રૂ. 32 કરોડની કરચોરી, બે વેપારીની ધરપકડ

રાજકોટ

દસેક દિવસ પહેલા જામનગરની આઠ સહિત રાજ્યની ૧૩ પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. અન્વેષણ વીંગે હાથ ધરેલી તપાસમાં જામનગરની ચાર પેઢીઓએ આંતર રાજ્ય ખરીદીમાં રૂ. ૧૮૧ કરોડનાં બોગસ વ્યવહારો ઝડપાયા હતા આ બોગસ બિલીંગ કૌભાડમાં ૩૨ કરોડની ખોટી વેરા શાખ લેવાઈ હોવાનું બહાર આવતા બે વેપારીની ધરપકડ કરવામાં આવી છે. જામનગરની જે ચાર પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં મે. શાંતિ મેટલ રિસાયકલીંગ પ્રા. લી, મે. શાંતિ મેટલ ઈન્ડસ્ટ્રીઝ, મે.ડી.આર. ટ્રેડિંગ કંપની, મે.એક્ટીવ મેટલ ઈન્ડ. નો સમાવેશ થાય છે.

સાળંગપુર ખાતે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે બનશે ૧૦૦૦ રૂમવાળું યાંત્રિક ભવન

બોટાદ

જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા હરિ ભક્તો દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે. હાલની રહેવા તેમજ ભોજનાલયને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ૪૦ કરોડના ખર્ચે આધુનિક એકી સાથે ૫૦૦૦ લોકો ભોજન લઈ શકે તેવું રાજમહેલ જેવું ભોજનાલયનું હાલ નિર્માણ થઈ રહ્યું છે. કોઈ ભક્તોને તકલીફ ન પડે તેના માટે યાંત્રિક ભવનનું

ગુરૂવારે ખાતમુહૂર્ત કરાયું હતું. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સદગુરુ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી યાંત્રિક ભવન ખાતમુહૂર્ત આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજીના હસ્તે કરવામાં આવ્યું. ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક હાઈટેક યાંત્રિક ભવનમાં વી.વી. આઈ.પી, વી.આઈ.પી. સહિતના રૂમ તેમજ હોલ બનાવવામાં આવશે. કુલ ૪ વિંગમાં એક હજાર રૂમનું નિર્માણ કરાશે યાંત્રિક ભવનમાં ૧૦૦૦ જેટલા રૂમોનું નિર્માણ થશે.

ગુજરાતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયો

જામનગર

ગુજરાતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગરમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. મંકીપોક્સના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર્દી દાખલ કરવામાં આવ્યો છે. હાલ દર્દીના નમૂના ગાંધીનગરના લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યારે આઈસોલેશન વોર્ડમાં દર્દી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરની યૂ હોસ્પિટલમાં મંકી પોક્સના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી દાખલ કરવામાં આવ્યો છે. નાગનાથ ગેટ વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષીય પુરુષને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાટણ વેરાઈમાં મામાએ દીકરાઓ સાથે મળી ભાણેજનું ઢીમ ઢાળી દીધું

પાટણ

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં એક જ પરિવારમાં ચાલી રહેલ પારિવારિક ઝઘડાનો અંત છેવટે હત્યા સુધી પહોંચવા પામ્યો છે અને મામા અને તેમના ત્રણ દીકરાઓએ મળી સગા ભાણાનું તીક્ષ્ણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું હતું. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં પ્રકાશ પટ્ટણી તેમની રીક્ષા લઈ ઉભા હોઈ તે દરમિયાન તેના મામા રમેશ ભાઈ અને તેમના ત્રણ દીકરા વિશાલ પટ્ટણી, રોહિત પટ્ટણી,

રાજેશ પટ્ટણીએ અગાઉની જૂની અદાવત રાખી છરી અને ધારિયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ભરબજારમાં ખૂની ખેલ ખેલાતા લોકોના ટોળે ટોળાં વળી જવા પામ્યા હતા. પોલીસે હત્યા અંગેની તમામ વિગતો પ્રાપ્ત કરી મૃતકની લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. મૃતકની માતા સવિતા બેનની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદમાં અમેરિકાના વિઝાને નામે એજન્ટે યુવકને ૫૫ લાખમાં નવડાવ્યો

અમદાવાદ

ચાંદખેડામાં રહેતા ૩૨ વર્ષીય યુવકને વિઝા આપવાનું વચન આપીને વડનગરના ટ્રાવેલ એજન્ટ અને નવરંગપુરામાં આવેલી આંગડિયા પેઢીના ચાર કર્મચારીઓએ ૫૫ લાખનો ચૂનો ચોપડયો હતો. ચાંદખેડાના પદ્મપ્રભુનગરમાં રહેતા હરેશ પટેલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને એવા આક્ષેપ કર્યા છે કે, તે ન્યૂ ચાંદખેડામાં પીવીસી ફર્નિચરનો વ્યવસાય કરે છે. જૂન ૨૦૨૧માં તેનો સંપર્ક વડનગરના મનોજ ચૌધરી નામના ટ્રાવેલ એજન્ટ સાથે થયો હતો. નક્કી થયા મુજબ, હરેશ પટેલને એમ.પટેલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાં રુપિયા જમા કરવવા માટેનું કહેવામાં આવ્યું હતું. ૨૬ ઓક્ટોબરના રોજ હરેશ અને તેનો મિત્ર એમ. પટેલ એન્ડ

કંપનીમાં ગયા હતા અને કંપનીના વિનુ પટેલ તથા ભરત ભરવાડ નામના કર્મચારીઓ પાસે રુપિયા ૩૦ લાખ જમા કરાવ્યા હતા. આ સિવાય બાકીના ૨૫ લાખ રુપિયા પણ એ જ દિવસે બીજા કર્મચારી સુનિલ પટેલને ચૂકવ્યા હતા. હરેશ પટેલને વિનુ પટેલ પાસેથી એવું જાણવા મળ્યું કે, આ આંગડિયા પેઢી મહેસાણાના મહેશ પટેલ નામનો વ્યક્તિ ચલાવે છે. એ જ દિવસે મનોજ ચૌધરીએ હરેશ પટેલને દિલ્હીની ફ્લાઈટની ટિકિટ મોકલી હતી. હરેશ પટેલે કહ્યું કે, ન્યૂ દિલ્હી પહોંચ્યા બાદ તે એક હોટલમાં રોકાયો હતો. જ્યાં મનોજ ચૌધરી આવ્યો હતો અને તેણે બે દિવસમાં યુએસની ટિકિટ અને વિઝા આપવાનું વચન આપ્યું હતું. એ પછી ૧૧ દિવસ સુધી હરેશ પટેલ હોટલમાં રોકાયા બાદ અમદાવાદ પરત ફર્યો હતો.

Sri Radha Krishna Temple

1960 Ellesmere Road Unit 9 Scarborough ON M1H 2V9
srkt2000@gmail.com 416-431-3311 www.sriradhakrishnatemple.ca

Saturday Aug 13, 2022

Sunderkand Paath

5:45pm-7:30pm
Aarti followed by Prasad

For Sponsorship please contact 416-431-3311

Sunday Aug 14, 2022

Amritvani Paath

5:45pm-6:15pm
Srimad Bhagvad Gita Pravachan

6:15pm-7:00pm
Aarti followed by Prasad

For Sponsorship please contact 416-431-3311

Monday Aug 15, 2022

Shiv Aradhana

6:15pm-7:00pm
Mahamrityunjaya Havan

7:00pm-7:30pm
Aarti followed by Prasad

For Sponsorship please contact 416-431-3311



મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચારી ક્લાર્ક : ઘરમાંથી મળ્યા રૂ. 85 લાખ રોકડા, દસ્તાવેજો જપ્ત

EOWની ટીમ તપાસ કરતાં ત્રણ માળની આલીશાન ઈમારત આલીશાન ઈન્ટરિયર મળ્યા નવી દિલ્હી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં EOW (ઈકોનોમિક ઓફેન્સ સેલ)ના દરોડામાં પર્દાફાશ થયેલા મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્ક હીરો કેસવાનીના કેસમાં નવી માહિતી સામે આવી રહી છે. EOW સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હીરો કેસવાની પર છેલ્લા કેટલાક સમયથી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે, હીરો કેસવાની બૈરાગઢ સ્થિત ઘરેથી પોતાની ટુ-વ્હીલરમાં મંત્રાલયની ઓફિસમાં આવતો હતો. જેથી તેની ભવ્યતા પર કોઈને શંકા ન રહે. પ્રથમ વખત હીરો કેસવાની શંકાના દાયરામાં આવ્યો જ્યારે તેણે જીવ સેવા સંસ્થાની અમૂલ્ય જમીન ખરીદી હતી. EOWને અત્યાર સુધીમાં હીરો કેસવાનીના ઘરની તપાસ દરમિયાન મોટી



સંખ્યામાં રોકડ, જ્વેલરી રસીદો, જમીનના કાગળો સહિત મોટી સંખ્યામાં વસ્તુઓ મળી આવી છે. હીરો કેસવાનીના ઘરેથી લગભગ 85 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સિવાય કરોડો રૂપિયાની જમીન અને મકાનના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

કેરળના પલક્કડમાં બિનવારસી 40 બોક્સમાં 8000 જિલેટીન સ્ટિક મળી

તિરુવનંતપુરમ

કેરળના પલક્કડ જિલ્લાના શોરનૂરમાં એક ખાણ નજીકથી બિનવારસી હાલતમાં 40 બોક્સમાં લગભગ 8000 જિલેટીન સ્ટિક મળી છે. હાલ જિલ્લાની પોલીસ કેસની તપાસ કરી રહી છે. શોરનૂર પોલીસે આ સામગ્રી જપ્ત કરી કેસની તપાસ શરૂ કરી દીધી છે. આ સામગ્રી એક ખાણ નજીક મળી હોવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે ખાણના કાર્યોના ઉપયોગ માટે રાખવામાં આવી હોય. બપોરે પલક્કડ જિલ્લાના શોરનૂરમાં લોકોને બિનવારસી હાલતમાં 40 બોક્સમાં જિલેટીનની સ્ટિક જોવા મળી હતી. પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી. સાથે



જ શોરનૂર અને પટ્ટાંબી જિલ્લા અને રેવન્યુ વિભાગના અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચીને વિસ્ફોટકોની તપાસ કરી. આટલા મોટા પ્રમાણમાં જિલેટીનની સ્ટિક મળ્યા બાદ સ્થાનિક લોકોએ અધિકારીઓ પાસે તપાસની માગ કરતા બિનવારસી પરિસ્થિતિમાં વિસ્ફોટક છોડનારા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

યૂથ લલિત બની શકે છે ભારતના નવવા મુખ્ય ન્યાયાધીશ: CJI રમણા ન્યાયાધીશ એન. વી. રમણા 26 ઓગસ્ટના રોજ નિવૃત્ત થશે

નવી દિલ્હી

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાએ આગામી CJI માટે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી છે. CJI રમણાએ કાયદા અને ન્યાયમંત્રીને ભલામણ પત્ર સોંપી દીધો છે. જો જસ્ટિસ યૂથ લલિતના નામની ભલામણ સ્વીકારી લેવામાં આવશે તો તેઓ દેશના 49માં CJI બનશે. તેઓ અમિત શાહના તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ, સલમાન ખાનના કાળિયાર કેસના વકીલ અને દેશના ખૂબ જ ચર્ચિત 2G સ્પેક્ટ્રમ કેસમાં CBIના

પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ એન. વી. રમણા 26 ઓગસ્ટના રોજ નિવૃત્ત થશે. તમને જણાવી દઈએ કે, કાયદા મંત્રી કિરેન રિજિજૂએ CJI એન વી રમણાને પત્ર લખીને તેમને પોતાના અનુગામીના નામની ભલામણ કરવાની વિનંતી કરી હતી. રિજિજૂનો 3 ઓગસ્ટના રોજ લખાયેલો પત્ર મોડી સાંજે ચીફ જસ્ટિસ કાર્યાલયને મળ્યો હતો. સૌથી વરિષ્ઠ ન્યાયાધીશનું નામ એટલે કે વરિષ્ઠતાના ક્રમમાં બીજા નંબરનું નામ જ કવરમાં હોય છે.

છેલ્લા 5 વર્ષોમાં બેકોએ રૂ. 90 લાખ કરોડની લોન માંડી વાળી : સરકાર

2021-22માં 2700 સહિત છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં વિલકૂલ ડિફોલ્ટરોની કુલ સંખ્યા 10306

નવી દિલ્હી

5 નાણાકીય વર્ષમાં 90 લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22માં 1,49,066 કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી છે. જે નાણાકીય વર્ષ 2020-21ની રકમ કરતા ઓછી છે. નાણાકીય વર્ષ 2020-21માં 2,02,971 કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2019-20માં 2,38,190

કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી હતી. 2018-19માં આ રકમ 2,36,245 કરોડ રૂપિયા હતી. 2017-18માં માંડી વાળવામાં આવેલ લોનની રકમ 1,61,327 કરોડ રૂપિયા હતી. 2016-17 થી 2014-15 દરમિયાન બેંકો દ્વારા કુલ ૮,૮૧,૬૪૦ કરોડ રૂપિયાની લોન માંડી વાળવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષોમાં વિલકૂલ ડિફોલ્ટરો(ઈરાદપૂર્વક નાદાર જાહેર

થયેલા)ની સંખ્યા 10,306 છે. નાણાકીય વર્ષ 2020-21માં સૌથી વધુ 2780 વિલકૂલ ડિફોલ્ટર હતાં. જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં વિલકૂલ ડિફોલ્ટરોની સંખ્યા 2700 હતી. 2018-19માં આ સંખ્યા 2209 જ્યારે 2017-18માં 2466 હતી. ટોચના પાંચ વિલકૂલ ડિફોલ્ટરોમાં ગિતાંજલિ જેમ્સ, એરા ઈન્ફા એન્જિનિયરિંગ, કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર, આરઈઆઈ એગ્રો લિમિટેડ અને એબીજી શિપયાર્ડનો સમાવેશ થાય છે.

જબલપુરની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગતાં 10નાં મોત, અનેક ઘાયલ

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 5 લાખ, ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી

જબલપુર

મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી 10 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. અહીંના શિવનગર સ્થિત ન્યૂ લાઈફ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલથી નીચે કુદવું પડ્યું હતું જેમાં પણ ઘણા લોકો ઘવાયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી



હતી. જો લોકોના પણ મોત નિપજ્યા છે તેમાંથી મોટા ભાગના હોસ્પિટલ સ્ટાફનો સમાવેશ થાય છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પણ આ ઘટના સમયે હોસ્પિટલમાં અફરા તફરી ફેલાઈ ગઈ હતી. ગ્રાઉડ ફ્લોરમાં સૌથી પહેલા શોર્ટસર્કિટ થયું હતું જેને પગલે પહેલા માળ બાદ ત્રીજા માળ સુધી આ આગ ફેલાઈ ગઈ હતી. અંતે વિજળી કાપીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

ઈડીએ ચેન્નાઈના સુરાના ગ્રુપની 67 પવનચક્કીઓ ટાંચમાં લીધી

નવી દિલ્હી

ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સુરાના ગ્રુપની વિરુદ્ધ મની લોન્ડરિંગના કેસની તપાસની સંદર્ભમાં 67 કરોડ રૂપિયાથી વધુના 67 વિંડમિલ (પવન ચક્કી) ટાંચમાં લઈ લીધા છે. કંપની પર ૩૮૮૬ કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડીનો આરોપ છે. એજન્સીએ વિંડમિલને ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક પ્રોવિઝનલ આદેશ જારી કર્યો છે. બેંકો દ્વારા તેમની બાકી રકમ વસૂલ કરવા માટે સુરાના ગ્રુપની 67 પવનચક્કીની હરાજની જાહેરાત

કરવામાં આવી ત્યારે એક બેનામી કંપની દ્વારા તેમને ફરીથી ખરીદવામાં આવી હતી. જો કે આ પવનચક્કી ક્યાં સ્થળે છે તે જાહેર કરવામાં આવ્યું નથી. આ જ આદેશ હેઠળ રામલાલ જૈનની ૬૧.૬૩ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. આ આદેશ હેઠળ કુલ ૧૧૩.૩૨ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. બીજી તરફ બેંગાલુરુના આઝાદ નગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર જી સી ગોવરામ્માની મની લોન્ડરિંગ કેસમાં ૩.૩૫ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

ઉદય સામંતની કાર પર હુમલા મુદ્દે ઉદ્ધવ જૂથના સંજય મોરેની ધરપકડ

મુંબઈ

પૂણે પોલીસે ઉદ્ધવ જૂથના જિલ્લા પ્રમુખ સંજય મોરેની ઉદય સામંતની કાર પર થયેલા હુમલા મામલે ધરપકડ કરવામાં આવી છે. ગત મંગળવારની સાંજે ઉદય સામંતની કાર પર ઉદ્ધવ જૂથના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો જેમાં તેમની કારના કાચ તૂટી ગયા હતા. ધરપકડ પહેલા જિલ્લા પ્રમુખ સંજય મોરેને ટિવટ કર્યું હતું કે, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પૂણેમાં જબરદસ્ત મીટિંગ કરી હતી. તેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. આ કારણે સરકારે IPC 307 હેઠળ કેસ નોંધીને શિવસેનાના કાર્યકરોની ધરપકડ કરી છે. પૂર્વ મંત્રી ઉદય સામંતે દાવો કર્યો છે કે, ગત મંગળવારની સાંજે અજ્ઞાત લોકોએ તેની કાર પર હુમલો કર્યો હતો.

કેન્દ્રીય કેમિનેટની બેઠકમાં લેવાયેલો નિર્ણય આંધ્રની કંપનીમાં ગેસ ગળતર થતાં 50થી વધુ મહિલા હોસ્પિટલ દાખલ

અમરાવતી

આંધ્રપ્રદેશના અયુતાપુરમ ખાતે એક કંપનીમાં શંકાસ્પદ ગેસ લીક થયાની જાણ થઈ હતી. આ ઘટના દરમિયાન કેટલીક મહિલાઓ બીમાર પડતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી છે. પોલીસ APPCBના અધિકારીઓ આવીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તેની રાહ જોવામાં આવી રહી છે. ગેસ લીક કથિત રીતે બ્રાન્ડિંગના પરિસરમાં થયો હતો. સાથે જ 50 મહિલાઓને

હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પરિસર ખાલી કરવાનું કામ ચાલી રહ્યું છે. ઘટના અંગે લાગી રહ્યું છે કે, આ વિસ્તારમાં પોરસ લેબોરેટરીઝ યુનિટમાંથી એમોનિયા ગેસ લીક થયો છે. હૈદરાબાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીના નિષ્ણાતોની ટીમે લેબોરેટરીની મુલાકાત લીધી હતી અને લીક થવાનું કારણ શોધવા માટે પરીક્ષણો કરવામાં આવ્યા હતા જ્યારે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રયોગશાળાને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

દેશમાં 2024 સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યા અડધી થઈ જશે : નિતિન ગડકરી

નવી દિલ્હી

દેશમાં વર્ષે માર્ગ અકસ્માતમાં દોઢ લાખ લોકો જીવ ગુમાવે છે. હવે માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સરકારે કમર કસી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દાવો કર્યો છે કે, વર્ષ 2024ના અંત સુધીમાં દેશમાં માર્ગ અકસ્માતની સંખ્યા અડધી કરવાનો લક્ષ્ય સરકારે રાખ્યો છે. સરકાર નેશનલ હાઈ-વે પરથી બ્લેક સ્પોર્ટ્સ ખતમ કરવા માટે અત્યાર સુધીમાં 25 હજાર કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે. ઈંદોરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા નિતિન ગડકરીએ કહ્યું કે, દર વર્ષે લગભગ 5 લાખ માર્ગ અકસ્માતમાં 1.5 લાખ લોકોના મૃત્યુ, 3 લાખ ગંભીર રીતે ઘાયલ થાય છે.

ઈડીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરતા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા

કેન્દ્રને એજન્સીના દુરુપયોગની છુટ મળી, સુપ્રીમ ફરી વિચારણા કરે : 17 વિપક્ષોની માગ

નવી દિલ્હી

કેન્દ્ર સરકાર હેઠળ આવતી એજન્સી ઈડીએ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતા અખબાર નેશનલ હેરાલ્ડના કાર્યાલય સહિત ૧૨ જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેના બીજા જ દિવસે ઈડીએ દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડના કાર્યાલયને સીલ કરી દીધું છે. ઈડીની આ કાર્યવાહી બાદ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે અને દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની બહાર મોટા પ્રમાણમાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ મામલો આગામી દિવસોમાં ઉગ્ર બની શકે છે. ઈડી મની લોન્ડરિંગ કાયદા હેઠળ નેશનલ હેરાલ્ડ અખબારની ગેરરીતીના આરોપોની તપાસ કરી રહી છે. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અનેકની પૂછપરછ થઈ ચુકી છે. જ્યારે મંગળવારે જ ઈડીએ નેશનલ



હેરાલ્ડના કાર્યાલય સહિત ૧૨ સ્થળે પુરાવા એકઠા કરવા દરોડા પાડ્યા હતા. બાદમાં આ અખબારનું કાર્યાલય સીલ કરી દેવાયું છે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા હતા. કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપરાંત ગાંધી પરિવારની સુરક્ષા પણ વધારવામાં આવી છે.

જમ્મુના રામબન જિલ્લામાં પોલીસ પોસ્ટ નજીક બ્લાસ્ટ, એલર્ટ જાહેર

રામબન

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પોલીસ પોસ્ટ પાસે વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ બાદ પોલીસે એલર્ટ જાહેર કરી દીધું છે. હાઈવેને અડીને આવેલી તમામ ચોકીઓના જવાનોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ગ્રેનેડ બ્લાસ્ટ છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહના જણાવ્યા પ્રમાણે તેમને એક પત્ર મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ બ્લાસ્ટ જમ્મુ કાશ્મીર ગઝનવી ફોર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક આતંકવાદી સંગઠન છે. હાલ એસઓજી અને આર્મીની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બાબા અમરનાથની યાત્રા રામબનમાંથી પસાર



થાય છે અને આ વિસ્ફોટ રામબન જિલ્લાના ગૂલ વિસ્તારમાં થાય છે. અહીં પોલીસ ચોકીની બહારની દિવાલ છે. વિસ્ફોટને કારણે થયેલા નુકસાનની રકમ હાલમાં આપવામાં આવી નથી. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે, આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર જતાં શ્રદ્ધાળુઓને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈ શકે છે.

બિલ્ડર ભોંસલે અને છાબરિયાની રૂપિયા 415 કરોડની સંપત્તિ ટાંચમાં

નવી દિલ્હી

ઈડીએ યસ બેંક -દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ કૌભાંડથી સંબંધિત બેંક લોન છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય એજન્સીએ મહારાષ્ટ્રના બિલ્ડર અવિનાશ ભોંસલે અને સંજય છાબરિયાની ૪૧૫ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઉલ્લેખનીય છે કે ઈડીએ કેસની તપાસના સંબંધમાં આ બંને બિલ્ડર્સની જૂન મહિનામાં ધરપકડ કરી હતી. હાલ આ બંને બિલ્ડર્સ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ભોંસલેની રૂ. ૧૬૪ કરોડ રૂપિયા અને છાબરિયાની રૂ. ૨૫૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવા માટે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છાબરિયાની ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં મુંબઈના સાંતાક્રુઝમાં આવેલી ૧૧૬.૫ કરોડ રૂપિયાની જમીન, છાબરિયાની કંપનીમાં ૨૫ ટકા શેર, બેંગાલુરુમાં ૧૧૫ કરોડ રૂપિયાની જમીન, સાંતાક્રુઝમાં ત્રણ કરોડ રૂપિયાનો ફ્લેટ તથા દિલ્હી એરપોર્ટ પાસે આવેલી હોટેલમાં થયેલ ૧૩.૬૭ કરોડ રૂપિયાનો નફો અને ૩.૧૦ કરોડ રૂપિયા ની ત્રણ કારોનો સમાવેશ થાય છે.

દેશના ૧૩ શહેરોને વર્ષના અંત સુધીમાં 5G નેટવર્કની સુવિધા મળવાની શક્યતા

13 શહેરોમાં ગુજરાત ૩ શહેર અમદાવાદ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ

નવી દિલ્હી

દેશના ૧૩ શહેરોને આ વર્ષના અંત સુધીમાં 5G નેટવર્કની સુવિધા મળી જાય એવી શક્યતા છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ગુરૂગ્રામ, ચંદિગઢ, બેંગલુરુ, હૈદરાબાદ, પૂણે, લખનઉ જેવા શહેરોમાં પછની સવસ શરૂ કરવાનો સંકેત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આપ્યો હતો. આ ૧૩ શહેરોમાં ટ્રાયલ શરૂ

કર્યા પછી તેના ફિડબેકના આધારે પછનો વિસ્તાર કરાશે. ટેલિકોમ મંત્રી અશ્વિન વૈષ્ણવે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે 5G નેટવર્કનો વ્યાપ ભારતના ૨૦-૨૫ શહેરો સુધી પહોંચે એ માટેના પ્રયાસો હાથ ધરાશે. શરૂઆતમાં ૧૩ શહેરોમાં ટ્રાયલ થાય એવી શક્યતા છે અને તેના થોડા મહિનાઓમાં જ બીજા દસેક શહેરોને 5G નેટવર્ક હેઠળ આવરી લેવાશે. પછના મન્યલી પ્લાન અંગે અત્યારે સરકારે સ્પષ્ટતા કરી

નથી. પરંતુ અત્યારના ઝજના પ્લાનના આધારે નિષ્ણાતોએ ધારણાં બાંધી હતી કે સરેરાશ પછ યુઝર્સ મહિને ૧૦૦૦ રૂપિયા આપવા પડશે. ડ્રલ એરિયાના ગ્રાહકો આટલો ઊંચો ભાવ આપવા તૈયાર થશે કે નહીં એ જુદો મુદ્દો બનશે. અત્યારે મોટાભાગની કંપનીઓનો ઝજનો ૮૪ દિવસનો પ્લાન ૫૦૦થી ૬૦૦ રૂપિયા આસપાસ છે. મહિને લગભગ ૨૦૦ રૂપિયા જેટલો ખર્ચ ઝજ સવસ પાછળ થાય છે.

SP નેતાની કન્સ્ટ્રક્શન કંપની સહિત અનેક સ્થળે IT દરોડા

લખનો

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ પર તપાસ એજન્સીઓ દ્વારા શકંજો કસવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશની મોટી કન્સ્ટ્રક્શન કંપની ઘનારામ કન્સ્ટ્રક્શનના સ્થળો પર બુધવારે સવારે ઈન્કમ ટેક્સ દરોડા પાડ્યા છે. ઝાંસી, લખનો સહિત અનેક સ્થળો પર ઈન્કમ ટેક્સની ટીમ પહોંચી છે અને દસ્તાવેજ શોધી રહી છે. ઘનારામ કન્સ્ટ્રક્શન સમાજવાદી પાર્ટીના નેતા શ્યામ સુંદર યાદવ અને તેમના ભાઈ બિસન સિંહની છે. ઝાંસીમાં ઘનારામ કન્સ્ટ્રક્શનની

કોર્પોરેટ ઓફિસ છે. ઝાંસીની સિવિલ લાઈન સ્થિત ઓફિસ અને આવાસ પર ઈન્કમ ટેક્સની રેડ ચાલું છે. આ અગાઉ સપાના પૂર્વ ધારાસભ્ય દીપ નારાયણ યાદવ વિજિલન્સની તપાસ બાદ હવે શ્યામ સુંદર પર શકંજો કસવામાં આવ્યો છે. આ ઉપરાંત IT ટીમની લખનો, કાનપુર અને ઝાંસીમાં પણ દરોડાની કાર્યવાહી ચાલું છે. રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિજય સરોગીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. હાલમાં કાનપુરમાં રાજેશ યાદવના ઘરની અંદર છાપેમારી ચાલું છે અને ITની ટીમ ઘરની અંદર દસ્તાવેજ શોધી રહી છે.

દિલ્હીમાં ચોથા કેસની પુષ્ટિ સાથે દેશમાં મંકીપોક્સના 9 દર્દી

નવી દિલ્હી

ભારતમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં ૩૧ વર્ષની એક મહિલાને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. તે જ સમયે, હવે દેશમાં મંકીપોક્સના દર્દીઓની સંખ્યા વધીને નવ થઈ ગઈ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના ચાર કેસ નોંધાયા છે. લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં બે દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશમાં પ્રથમ વખત કોઈ મહિલાને મંકીપોક્સ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. મહિલા નાઈજીરિયાની છે.

રાંચીના એરપોર્ટને 4 દિવસમાં ત્રીજુવાર ઉડાવાની ધમકી મળી

રાંચી

ઝારખંડ રાંચી સ્થિત બિરસા મુંડા એરપોર્ટને સોમવારે ત્રીજી વખત બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી હતી. આ વખતે પણ એરપોર્ટના એક અધિકારીના નંબર પર ટેક્સ્ટ મેસેજથી ધમકી આપવામાં આવી હતી. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, જો 20 લાખ રૂપિયા ન આપવામાં આવ્યા તો તે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેશે. એરપોર્ટ પ્રબંધને તેની સૂચના પોલીસને આપી દીધી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ અગાઉ 28 અને 29 જુલાઈના રોજ

પણ આ જ નંબરથી ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનારને હજુ સુધી પોલીસ નથી પકડી શકી. બિરસા મુંડા એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, ફરી એક વખત રાંચી એરપોર્ટને ઉડાવાની ધમકી મળી છે. એવું બની શકે કે, કોઈ તમને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય. જોકે એરપોર્ટ મેનેજમેન્ટ એરપોર્ટ અને અહીં આવતા લોકોની સુરક્ષાને લઈને સતર્ક છે. આ સિવાય ધમકીના કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસને લઈને પણ એરપોર્ટ હાઈ એલર્ટ પર છે.

કોંગ્રેસી નેતા કુલદીપ બિશ્નોઈએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું

હરિયાણા

હરિયાણા કોંગ્રેસના બળવાખોર નેતા કુલદીપ બિશ્નોઈએ બુધવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે 4 ઓગષ્ટના રોજ ભાજપમાં જોડાશે. તેમણે વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુમાને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય રેણુકા બિશ્નોઈ, ડેપ્યુટી સ્પીકર રણબીર ગંગવા, ભાજપા ધારાસભ્ય દૂડારામ અને લક્ષ્મણ નાપા હાજર રહ્યા હતા. કુલદીપ બિશ્નોઈએ કહ્યું કે, કોંગ્રેસ હવે પોતાની વાહવાહી કરનારાઓની જ પાર્ટી રહી ગઈ છે. કોંગ્રેસના બધા નિર્ણયો ખોટા પડી રહ્યા છે. કુલદીપે હુડાના જવાબ પર કટાક્ષ કરતા કહ્યું કે, જે શરીરમાં આત્મા હોય તેનો જ વિરોધ થાય છે મૃતદેહનો વિરોધ કોણ કરશે.

અલ્હાબાદ હાઈકોર્ટનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય UP સરકારે 850 જેટલા સરકારી વકીલને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા

પ્રયાગરાજ

ઉત્તર પ્રદેશ સરકારે લગભગ 850 રાજ્યના કાયદા અધિકારીઓ એટલે કે સરકારી વકીલોને હટાવ્યા છે. યુપી સરકારે આદેશ જાહેર કરીને કહ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટમાં નિયુક્ત 841 સરકારી વકીલોની સેવાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રયાગરાજમાં જ્યાં અલ્હાબાદ હાઈકોર્ટની મુખ્ય બેંચમાંથી 505 રાજ્ય કાયદા અધિકારીઓને દૂર કરવામાં આવ્યા હતા અને સાથે જ

હાઈકોર્ટની મુખ્ય બેંચમાંથી 336 સરકારી વકીલોને છૂટા કરવામાં આવ્યા છે. રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના વિશેષ સચિવ નિકુંજ મિત્તલ તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર, અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ વિનોદ કાંતને પણ હટાવવામાં આવ્યા છે. આ સાથે પ્રયાગરાજની પ્રિન્સિપલ બેંચમાં 26 એડિશનલ ચીફ પરમેનન્ટ એડવોકેટ્સને હટાવવામાં આવ્યા છે.

જે કરવું હોય તે કરી લેજો, હું પ્રધાનમંત્રીથી ડરતો નથી : રાહુલ ગાંધી

નવી દિલ્હી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી અંગે આજે ભડાશ કાઢી. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીથી ડરતા નથી અને તેમને ધમકાવીને ચૂપ કરી શકાશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશ અને લોકતંત્રની રક્ષા તથા સદભાવ કાયમ રાખવા માટે કામ કરતા રહ્યા છે અને આગળ પણ કરશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે 'સત્યને બેરિકેડ કરી શકાશે નહીં. જે કરવું હોય તે કરી લો, હું પ્રધાનમંત્રીથી ડરતો નથી, હું હંમેશા દેશહિતમાં કામ કરતો રહીશ. સાંભળી લો અને સમજી લો.' આ અગાઉ તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે આ ધમકાવવાનો પ્રયત્ન છે.



આનલની આંખો વિક્રમને ઢૂંઢતી હતી, પણ વિક્રમ દેખાયો નહીં

ગતાંકથી શરૂ...
આનલે પત્ર લખ્યો. એરમેઈલ બીડીને ટપાલ પેટીમાં જાતે જ નાંખી આવી.

આનલને હતું કે છેવટે મારા પત્રનો જવાબ જરૂર આવશે. પણ એના પત્રનો પણ જવાબ આવ્યો નહીં.

આનલ તો ઠીક પણ એના પરિવારના સભ્યો પણ વિચારમાં પડી ગયાં. આમ કેમ? એમણે અમેરિકામાં વસતા અન્ય પરિચિતો મારફતે પણ વિક્રમની ભાળ કાઢવા કોશિશ કરી પણ વિક્રમના કોઈ જ ખબર નહોતા.

વિક્રમ શિકાગોમાં ક્યાંક રહેતો. પણ પરણીને તે ગયો તે ગયો. આનલ અત્યંત ખાનદાન પરિવારની પુત્રી હતી. તેમણે વધુ ને વધુ રાહ જોવાનું મુનાસિબ માન્યું.

વિક્રમને ગયે એક વર્ષ થયું. બે થયાં, ત્રણ, ચાર, પાંચ છ અને છેવટે સાત વર્ષ થયાં. પણ તે ગયો તે ગયો, ના એનો કાગળ, ના એનો તાર, ના એનો ફોન.

દરમિયાન આનલ ઘણી કઠોર થઈ ચૂકી હતી. એની લાગણીઓનાં વહેણ સુકાઈ ચૂક્યાં હતાં. હવે શું કરવું? એક ભવમાં બે ભવ કરવા તે તૈયાર નહોતી. એણે મનોમન નિર્ણય કર્યો કે, હવે હું જ મારા પતિની ખોજ કરીશ. ઘરના સૌ

સભ્યો આનલના નિર્ણય સાથે સંમત થયાં. આનલને એકલીને અમેરિકા મોકલવા નિર્ણય લેવાયો.

આનલ અમેરિકામાં પહોંચે તે અગાઉ વિક્રમના જૂના શિકાગોના સરનામે પત્ર લખવામાં આવ્યો. 'વિક્રમ ! હું એકલી અમેરિકા આવું છું. અમેરિકા જોયું નથી. શિકાગોના એરપોર્ટ પર મને લેવા આવજે. જોજે હોં ભૂલ ના કરતો. હું એકલી ને અજાણ છું. ક્યાંક અટવાઈ ના જાઉં. તારા ખબર નથી. તું કદાચ મને નહીં ઓળખે પણ હું તો તને ઓળખી જ કાઢીશ. મેં તો રોજ તારી તસવીર નિહાળ્યા કરી છે. બસ. હું ચોક્કસ તારી પાસે જ આવું છું. મેં તો કોઈ ભૂલ કરી નથી અને જાણેઅજાણે પણ થઈ ગઈ હોય તો તારા ચરણોમાં બેસીને માફી માગીશ. પરંતુ તું એરપોર્ટ પર આવવાનું ચૂકીશ નહીં... તારી આનલ.'

અને આનલ મુંબઈ જઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પકડી શિકાગો જતા પ્લેનમાં બેઠી, પ્લેન ઊપડ્યું ત્યારે એને કેટકેટલોયે ફફડાટ હતો, એ એરપોર્ટ પર આવશે કે નહીં? ના, ના, આવશે જ. એમને મારા માટે જરા યે દયા નહીં હોય? આખરે તો એ મારા પતિ છે ને ! તેઓ આવશે જ... પણ કદાચ ના આવે તો?'

પ્લેન આકાશનાં વાદળોમાં લુપ્ત થઈ રહ્યું હતું. આનલ હજી યે એના વિચારોમાં ગરકાવ હતી. મનોમન એ ફફડી રહી હતી. આનલનું પ્લેન થોડોક સમય

શિકાગોના એરપોર્ટ ઉપર ઊતર્યું.

એક નવી દુનિયા. નવી ચમક. નવી હવા. બધું જ નવું. આંખોને આંજી નાંખે

અને સ્વજનોને લેવા આવ્યા હતા. આનલની આંખો વિક્રમને ઢૂંઢતી હતી.

પણ વિક્રમ ક્યાંય દેખાયો નહીં.

એ બહાવરી બની ગઈ. કેટલીયે વાર સુધી આમતેમ ફાંફાં મારતી રહી પણ વિક્રમ ક્યાંય દેખાયો નહીં. પ્લેનમાંથી ઊતરેલા તમામ ઉતારુઓ તેમનો સામાન લઈ ચાલ્યા ગયા. લોન્જ ખાલી થઈ ગઈ.

સાડી પહેરેલી એક માત્ર હિજરાયેલી જણાતી ગુજરાતી યુવતી લોન્જમાં હજીયે ઊભી હતી. એને હતું કે, 'વિક્રમ આવવામાં મોડો પડ્યો હશે. મારી સાથે છેક આવું તો ના જ કરે. આ પરદેશની દુનિયામાં શું એને મારી પર થોડીકે ય દયા નહીં હોય?'

પણ વિક્રમ ના આવ્યો તે ના જ આવ્યો.

આનલ ભાંગી પડી. સામાન એનાથી ઊંચકાતો નહોતો. મનનો બોજ એનાથી સહન થતો નહોતો. હૃદય પણ એને હવે ભારેખમ લાગતું હતું. કલાકો સુધી એ એકલી અટૂલી એના સામાન પર જ બેસી રહી. પણ હવે એણે આશા છોડી દીધી.

શિકાગોના મહાકાય ને અટપટા એરપોર્ટથી સાવ અજાણ એવી આનલે અગાઉની યોજના પ્રમાણે ન્યૂયોર્ક જવા

વિચાર્યું. ન્યૂયોર્કમાં એની નાની બહેન રેખા રહેતી હતી. વિક્રમ શિકાગોના એરપોર્ટ પર લેવા ના આવે તો આનલે ન્યૂયોર્ક જતા રહેવું એવું નીકળતા પહેલાં જ નક્કી થયું હતું.

ભારે મનોમંથનને બાદ એણે ન્યૂયોર્ક જતા પ્લેનની ટિકિટ કઢાવી. જતાં પહેલાં શિકાગોના એરપોર્ટ પરથી રેખાને ફોન કર્યો, 'બહેન ! આખા દિવસથી રાહ જોઉં છું પણ એ નથી આવ્યા. હું ન્યૂયોર્ક આવું છું. મને લેવા એરપોર્ટ પર આવજે.'

આનલ શિકાગોથી ઊપડી ન્યૂયોર્ક પહોંચી. પણ હવે તે હિંમત હારી ચૂકી હતી. એના પગ જ ઊપડતા નહોતા. ન્યૂયોર્કના એરપોર્ટ પર એને લેવા રેખા આવી હતી. બંને બહેનો એકબીજાનેબાઝી પડી. ખૂબ રોઈ. અન્ય ઉતારુઓ પણ આ બંને બહેનોના લાગણીના ઝંઝાવાતને જોઈ વિચારમાં પડી ગયા. રેખા અને આનલ એમના ઘરે પહોંચ્યાં. કેટલીયે વાર સુધી આનલે રડ્યા જ કર્યું. એને હવે ભારે મોટો આઘાત લાગ્યો હતો. એને થયું કે વિક્રમને મારા માટે લગીરે દયા ના આવી?'

(કમશ આવતાં અંકે)

દેવેન્દ્ર પટેલ

સંપર્ક

+919879207102



લંડન રોકાયા બાદ શિકાગો તેવું ઘણું બધું. ઠંડી પણ હતી. જવા ઊપડ્યું. આકાશમાં પણ આનલને એ કશુંયે જોવું નહોતું. એને તો એના પતિનો રૂના ઢગલા જેવાં વાદળોની ચહેરા જોવો હતો. ઈમિગ્રેશન અમેરિકા ભણી ઊડી રહ્યું હતું. અને કસ્ટમ કાઉન્ટર્સ વટાવી આનલનું હેયું પણ જોશજોશથી એ રિસિવિંગ લોન્જમાં આવી. ધડકી રહ્યું હતું. પ્લેન આખરે સેંકડો લોકો તેમનાં પ્રિય પાત્રો

॥ સ્વામી શ્રીજી ॥

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

મદદની ભાવના જગાડી માનવજીવન સાર્થક કરો

એક જગ્યાએ હજારો માણસોનો મેળો ભરાયો હતો. લોકો આનંદથી મેળાના આકર્ષણોને નિહાળી રહ્યા હતા. પરંતુ, એ આનંદ વચ્ચે એક અંધ વ્યક્તિ હાથમાં દિલરુબા લઈને નિરાશ વદને બેઠો હતો. તેની આગળથી ઘણા લોકો પસાર થતા હતા. પરંતુ, કોઈ પણ વ્યક્તિને તેની મુશ્કેલી જાણવામાં રસ નહોતો. અચાનક એક માણસ તેની પાસે આવ્યો. તેણે ઉદાસીનતાનું કારણ પૂછ્યું. ત્યારે તે અંધે કહ્યું, 'હું દિલરુબા વગાડી બે-પાંચ પૈસા ભેગા કરીને પેટ ભરું છું. પણ ગિરદીમાં મારી હથેળી ચગદાઈ ગઈ. એટલે હું દિલરુબા વગાડી શકું તેમ નથી. માટે આજે શું ખાઈશ? તેની ચિંતાથી નિરાશ છું.' પેલા માણસે કહ્યું 'હું વગાડું?' તેણે કહ્યું, 'તમને આવડે છે?' 'થોડું-ઘણું આવડે છે.' એમ કહી તેણે સંગીત વગાડવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે ભીડ જામવા લાગી અને પૈસાનો વરસાદ થયો. છેલ્લે બધા પૈસા ભેગા કરી તે માણસે પેલા અંધને આપ્યા અને પોતાની ઓળખ આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. એ માણસ હતા મહાન સંગીતજ્ઞ ઓમકારનાથ.


સામાન્ય માણસો અને મહાન પુરુષોમાં આ જ તફાવત હોય છે. લોકો પોતાના આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે, બીજાનો ઉદાસ ચહેરો જોવા છતાં તેને મદદ તો નથી કરતા, પણ ન દેખ્યા જેવું વર્તન કરીને ત્યાંથી નીકળી જાય છે.

હું શું કામ મદદ કરું ? તે ક્યાં મારો સગો થાય છે ? હું તેને નથી ઓળખતો ! મને શું ફાયદો ? વગેરે વિચારોની બેડી માણસને એવી જકડી રાખે છે. તે બેડી તોડી બીજાનો વિચાર કરવો જોઈએ તેવો વિચાર માનવીને ક્યારેય નથી આવતો.

હિતોપદેશમાં કહ્યું છે, 'જેના જીવવાથી બધા જીવે છે તેમનું જીવન સાર્થક છે. કારણ કે, માત્ર પોતાને માટે તો કોણ નથી જીવતું?' માટે જો આવી બેડી તોડીને જીવન સાર્થક કરવું હોય, તો એક જ ઉપાય છે, 'જરૂરિયાતમંદ માણસની પરિસ્થિતિ સમજી, હૃદયમાં તેને મદદ કરવાની ભાવના જગાડવી.'

એકવાર એક મોટા પ્રોજેક્ટ ઉપર 70 વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા હતા. એક દિવસ એક વૈજ્ઞાનિકે પ્રોજેક્ટના હેડ અબ્દુલ

કલામ પાસે જઈને કહ્યું, 'મેં મારા બાળકોને આપણા શહેરમાં આવેલું પ્રદર્શન દેખાડવાનું વચન આપ્યું છે. માટે હું સાડા પાંચ વાગે જઈ શકું?' કલામ સાહેબે હા પાડી. વૈજ્ઞાનિક પાછા કામે લાગ્યા, પણ કામ એટલું જટિલ હતું કે સમય ક્યાં વીતી ગયો તેની તેમને જાણ ના રહી. જ્યારે તેમને બાળકો યાદ આવ્યા ત્યારે ૮:૩૦ વાગી ગયા હતા. આથી તેઓ ઉતાવળે ઘરે પહોંચ્યા અને પત્નીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે, 'બાળકો ક્યાં છે?' ત્યારે પત્નીએ કહ્યું, 'કલામ સાહેબ તેમને ૫:૩૦ વાગ્યાથી પ્રદર્શન જોવા લઈ ગયા છે.'



ખરેખર, મદદ કરવાની ભાવના તેને જ જાગે જે બીજાની પરિસ્થિતિ સમજી શકે. મહાન પુરુષો દરેક વ્યક્તિની પરિસ્થિતિ સમજી શકે છે. એટલા માટે જ તેમની પાસે મદદ માગવી નથી પડતી, તેઓ સામેથી જ મદદ કરવા પહોંચી જાય છે. ૧૯૬૨માં અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા-મહોત્સવ હતો. ઉત્સવના સમાપનની રાત્રિએ રસોડા વિભાગમાં સ્વચ્છતાની સેવા બજાવી રહેલો એક યુવાન, એંઠવાડથી ભરેલી લારીને ઢાળ ચઢાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ભાર ખૂબ જ હતો અને ઢાળ પણ ઊંચો, એટલે તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા હતા. એટલામાં તેણે પ્રમુખસ્વામી મહારાજને થોડે

દૂરથી પસાર થતા જોયા. પણ તેઓને કાંઈ એંઠવાડની લારી ખેંચવા બોલાવાતા હશે ? સંસ્થાના પ્રમુખ, મહોત્સવના મોવડી અને લાખો લોકોના આદરણીય એવા પ્રમુખસ્વામી મહારાજ પાસે કાંઈ આવું કામ કરાવાતું હશે? યુવાન આ વિચારોની ગડમથલમાં હતો. એવામાં પ્રમુખસ્વામી મહારાજની નજર આ યુવાન પર પડી અને તેને જોતાં વેંત તેની બધી જ પરિસ્થિતિ પામી ગયા. એ યુવાન હજી કંઈ સમજે વિચારે એ પહેલાં તો પ્રમુખસ્વામી મહારાજ તેની મદદે પહોંચી ગયા અને એંઠવાડની લારીને ધક્કો મારવા લાગ્યા.

થોડીવારમાં લારી ઢાળ તો ચઢી ગઈ, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ ત્યાંથી અટક્યા નહીં. એ લારીને જ્યાં ખાલી કરવાની હતી ત્યાં સુધી લારીને ખેંચી જવામાં પણ તેઓએ યુવાનની સાથે રહ્યા. અરે ! લારીને ખાલી કરાવવામાં પણ સાથે રહ્યા.

જરૂરિયાતમંદને કેવળ મદદ કરવી એટલું જ નહીં, પણ પૂરેપૂરી મદદ કરવી એવો એમનો સિદ્ધાંત હતો. પર-સેવા માટે પરસેવો પાડનારા આ મહાપુરુષે ૪૫ જેટલી પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં રાહતકાર્ય, ૨ લાખથી વધુ પીડિતોની સહાય, ૨૫ જેટલાં આખાં ગામ દત્તક લઈને પુનઃનિર્માણ, ૨૧ હજાર જેટલાં દુષ્કાળપીડિત પશુઓની માવજત અને ૨૯ લાખ પછાત વિસ્તારના દર્દીઓની વિનામૂલ્ય સારવાર કરીને સમાજસેવાનો અમિટ અધ્યાય લખ્યો છે.

એટલે જ ભારતીય દલિત સમાજના ધાર્મિક વડા પૂ. શંભુ મહારાજ એક પ્રસંગે બોલી ઉઠ્યા, 'પ્રમુખસ્વામી મહારાજની કરુણાગંગા સમાજના છેવટના માનવી સુધી પહોંચી છે.'

આપણે કદાચ આવા મહાપુરુષોની જેમ સૂર્ય બની સમગ્ર સમાજને પ્રકાશ ન આપી શકીએ, પણ તેઓમાંથી પ્રેરણા લઈને દિપક બની આપણી આસપાસના વ્યક્તિઓને જરૂર પ્રકાશ આપી શકીએ. સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણને એવી કેટલીય વ્યક્તિઓનો ભેટો થતો હશે, જેને કંઈક મદદની જરૂર હોય. તો આવો, તેમના મદદગાર થઈએ અને યાદગાર બનીએ.

- સાધુ કૌશલમૂર્તિદાસ

અલ્બર્ટામાં કરા પડ્યા, અનેક વાહનો વચ્ચે ટક્કર

અલ્બર્ટા

ગુરુવારે કેનેડાના પશ્ચિમી પ્રાંત અલ્બર્ટામાં તોફાન સાથે અડધો કલાક સુધી આકાશમાં કરા પડતાં અસંખ્ય વાહનોના કાચ તૂટી ગયા હતા. ત્રણથી ચાર ઈંચના કરાના મારો થતાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. અચાનક કરા પડવાનું શરૂ થતાં વાહનચાલકોને પરેશાની થઈ ગઈ હતી. એ કારણે ઘણા વાહનો વચ્ચે ટક્કર પણ થઈ હતી. કેનેડામાં ત્રણથી ચાર ઈંચના કરા પડ્યા હતા. પશ્ચિમી પ્રાંત અલ્બર્ટામાં તોફાન સાથે અડધો કલાક સુધી આકાશમાંથી બરફના ત્રણથી ચાર ઈંચના ટૂકડા વરસ્યા હતા. અચાનક આ સ્થિતિ સર્જાઈ જતાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. જે વાહનચાલકો રસ્તામાં હતા તેમને અચાનક રસ્તા પર કશું જ દેખાતું બંધ થઈ ગયું હતું, તેના કારણે ઘણા વાહનો વચ્ચે સાધારણ ટક્કરના બનાવો પણ બન્યા હતા. ઘણા વાહનોના કાચ

તૂટી ગયા હતા. રોયલ કેનેડિયન માઉન્ટેઇન પોલીસ ફોર્સના કહેવા પ્રમાણે લગભગ અડધો કલાક સુધી કરા વરસ્યા હતા. તેની સાઈઝ ઘણી મોટી નોંધાઈ હતી. લગભગ ૧૦ સેન્ટિમીટર સુધીના કરા વરસ્યા હતા. એટલે કે ત્રણથી ચાર ઈંચના બરફના ટૂકડા વરસતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે ૩૪ વાહનોના માલિકોએ નુકસાનીનો ક્લેઈમ કર્યો હતો. કરા પડવાના બનાવો અસંખ્ય સ્થળોએ બનતા હોય છે. ભારત સહિત દુનિયાભરમાં એવા બનાવો વર્ષ દરમિયાન નોંધાય છે, પરંતુ કરાની સાઈઝ બહુ મોટી હોતી નથી. તેમ છતાં જો કરા સીધા લોકો પર પડે તેનાથી ઈજા થઈ શકે છે. આકાશમાંથી સીધા ટ્રાટકતા કરા ચામડી પર ઘાવ બેસાડી દે છે અને માથામાં ઈજા પહોંચાડી શકે છે. કરાનો વરસાદ થતો હોય ત્યારે બહાર નીકળવું સલાહભર્યું નથી હોતું.

અડધો કલાક સુધી આકાશમાંથી બરફના મોટા કરા પડ્યા, રસ્તા પર પાણી જ પાણી



પાકિસ્તાનમાં 10 વિદ્યાર્થીઓ પર રેપ બદલ મદરેસાના શિક્ષકની ધરપકડ

ઈસ્લામાબાદ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બુધવારે ઓછામાં ઓછા 10 સગીર વિદ્યાર્થીઓ પર બળાત્કાર કરવા બદલ મદરેસાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. લાહોરના પોલીસ અધિકારી અખ્તર ફારુકે બુધવારે જણાવ્યું કે આરોપી કારી બશીરે શહેરથી લગભગ 500 કિલોમીટર દૂર સાદીકાબાદ રહીમ ચાર ખાનના 'ભુટ્ટા વહાં' વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં છોકરાઓની છોડતી કર્યાની કબૂલાત કરી હતી. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. હવે

તેને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. મદરેસાના વિદ્યાર્થીઓના માતા-પિતાએ એફઆઈઆર નોંધાવ્યા બાદ પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી. એફઆઈઆરમાં આરોપ છે કે બશીર તેમના બાળકોને બળજબરીથી મદરેસામાં પોતાના રૂમમાં લઈ ગયો અને તેમની છોડતી કરી. પોલીસે ચારેય પીડિતોને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. ફારુકે કહ્યું કે અમે અન્ય વિદ્યાર્થીઓને વિનંતી કરી છે કે જો તેમનું પણ ચૌન શોષણ થયું હોય તો તેમણે પોલીસને જાણ કરવી જોઈએ.

આતંકી જૂથના મુખ્યા જવાહિરીના મોત બાદ અમેરિકા સહિત દુનિયા પર તોળાતું જોખમ

ડ્રોન હુમલામાં અલ-જવાહિરી માર્યો ગયો : US સ્ટેટ ડિપાર્ટમેન્ટે તમામ દેશને કર્યા સતર્ક

વોશિંગ્ટન

અલકાયદાના વડા અયમાન અલ-જવાહિરીના મોત બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિશ્વભરમાં એલર્ટ જાહેર કર્યું છે. તમામ દેશોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વધુમાં જણાવ્યું હતું કે, અલ-કાયદાના વડા અલ-જવાહિરીના મૃત્યુ પછી, અલ-કાયદા સમર્થકો અથવા તેની સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનો વિશ્વભરમાં રહેતા યુએસ કર્મચારીઓ અથવા નાગરિકો પર



હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. આ તંકવાદી હુમલાઓ વારંવાર ચેતવણી વિના થતા હોવાથી, યુ.એસ. ના નાગરિકોએ હંમેશા સાવચેત રહેવાની જરૂર છે. વિદેશ પ્રવાસ દરમિયાન પોતાનું ધ્યાન રાખો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, આતંકવાદીઓ અમેરિકાના મિત્ર દેશોને પણ નિશાન બનાવી શકે છે, તેથી સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પણ દેખરેખ રાખવી જોઈએ. પાકિસ્તાનના એબોટાબાદમાં અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનની હત્યા બાદ તેની વિરાસતને આગળ ધપાવી રહેલા આતંકવાદી નેતા અયમાન અલ-જવાહિરીને તાલિબાન દ્વારા આપવામાં આવેલી કડક સુરક્ષા વચ્ચે અફઘાનિસ્તાનમાં માર્યો ગયો હતો. કાબુલમાં અમેરિકી CIA એજન્સીની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં તેનું મોત થયું હતું.

ફરો આઈલેન્ડમાં 100થી વધુ ડોલ્ફીનનો શિકાર, દરિયાનું પાણી લાલ થઈ ગયું

લંડન

ફરો આઈલેન્ડ્સમાં 100 ડોલ્ફીનનો નિર્દયતાથી શિકાર કરવામાં આવ્યો છે. 120 વર્ષમાં બોટલનોઝ ડોલ્ફીનનો સૌથી મોટો સામૂહિક શિકાર હોવાનું માનવામાં આવે છે. ફેરો ટાપુમાં 98 પુખ્ત વયની ડોલ્ફીન અને એક બાળક જે હજુ પોતાના માતાના ગર્ભાશયમાં હતો અને એક નાના બાળકનો શિકાર કરવામાં આવ્યો છે. આ નિર્દયતાની તસવીરો દુનિયા સામે આવી છે. જે જોવાની પણ હિંમત નથી થતી. ત્યાં મોટા પ્રમાણમાં ડોલ્ફીનનો શિકાર કરવામાં આવી રહ્યો છે. આ ફોટો ડરાવના છે, નિષ્ણાતો માને છે કે, ડોલ્ફીનને પહેલા કિનારે લઈ જવામાં આવી હતી અને પછી છરી, ભાલા અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે તેમની હત્યા કરવામાં



આવી હતી. આટલા મોટા પાયે ડોલ્ફીનને માર્યા બાદ કિનારા પરનું પાણી લાલ થઈ ગયું હતું. વન્યજીવ સંસ્થાઓ દ્વારા તેની વ્યાપક નિંદા કરવામાં આવી છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના બીજા સરવેમાં લિઝ ટ્રસ રિશિ સુનક કરતા આગળ

ટ્રસને 58 ટકા જ્યારે સુનકને 26 ટકા સભ્યોનું સમર્થન

લંડન

કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના નવા સર્વેમાં ટ્રસને 58 ટકા સભ્યોનું સમર્થન આપ્યું હતું. ૧૨ ટકા લોકો એવા છે કે જે હજુ સુધી અનિર્ણિત છે. રિશિ સુનક નવો આંચકો એ સમયે લાગ્યો જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા સાજીદ જાવીદે ટ્રસને સમર્થન જાહેર કર્યું હતું. પાકિસ્તાન મૂળના પૂર્વ આરોગ્ય પ્રધાન સાજીદ જાવીદે સુનકની ટેક્સ નીતિની ટીકા કરી હતી. એક અંદાજ મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીના ૧,૮૦,૦૦૦ સભ્યોને ચાલુ સપ્તાહમાં બેલેટ મળવાનું શરૂ થઈ જશે.

ઈમરાન ખાનની પાર્ટીએ 34 વિદેશી રાષ્ટ્રો પાસેથી પ્રતિબંધિત ફંડિંગ મેળવી

લાહોર

34 વિદેશી રાષ્ટ્રો પાસેથી પ્રતિબંધિત ફંડિંગ મેળવવા બદલ ઈમરાન ખાનની તહેરીક એ ઈન્સાફ પાર્ટીને દેશના ચૂંટણી પંચ તરફથી કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચના ત્રણ સભ્યોની કમિટિએ આ નિર્ણય લીધો હતો. આ ત્રણ સભ્યોની બંચમાં પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી અધિકારી - સિકંદર સુલતાન રાજા પણ સામેલ હતા. પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું કે તહેરીક એ ઈન્સાફ પાર્ટીએ 34 વિદેશી રાષ્ટ્રો પાસેથી અને બિઝનેસમેન આરીફ નકવી પાસેથી ફંડ મેળવ્યું હતું. પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું પાર્ટીના 13 સિકેટ અકાઉન્ટ હતા, જે પાકિસ્તાની બંધારણ પ્રમણે ગેરકાયદેસર છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોનો દાવો ગ્લોબલ વોર્મિંગ 2070 સુધીમાં અણુ યુદ્ધ કે આર્થિક કટોકટી સર્જી શકે

લંડન

તાપમાન વધી રહ્યું છે ત્યાં નવા અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચરમસીમાઓ તરફ આગળ વધી રહ્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે વર્ષ 2070 સુધીમાં ગ્લોબલ વોર્મિંગ તેની ચરમસીમાએ પહોંચી જતાં પરમાણુ યુદ્ધ, આર્થિક કટોકટી કે જીવોનો નાશ થાય તે પ્રકારની મહામારી સર્જાઈ શકે છે. સંશોધન અભ્યાસના લેખક ડો.

લ્યુક કેમ્પના જણાવ્યા મુજબ જળવાયુ પરિવર્તન વિનાશ વેરશે તેવું માનવાને ઘણા કારણ છે. સંશોધક ટીમે પૃથ્વીનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધે તો શું પરિણામ આવે તે પ્રશ્નને મોડેલ તૈયાર કરીને અભ્યાસ કર્યો હતો. તેમના અંદાજ મુજબ વર્ષ 2070 સુધીમાં પૃથ્વી પર વસી રહેલા 2 અબજ લોકો વાર્ષિક સરેરાશ 29 ડિગ્રી સેલ્સિયસ જેવી ગરમીનો સામનો કરતા થઈ જશે. આવી સંભાવના ધરાવતા વિસ્તારો ગીચ વસતી ધરાવતા ક્ષેત્રો છે.

એમેઝોનના જંગલમાં ફરી આગ : કેલિફોર્નિયા, ફાન્સ, પોર્ટુગલમાં અસર દેખાઈ

રિયો ડી જાનેરો

બ્રાઝિલના એમેઝોનના જંગલમાં આગ સતત વધી રહી છે. જુલાઈ 2021ની સરખામણીમાં આ વખતે આગ વધુ વિસ્તારોમાં ફેલાઈ છે. અધિકારીઓએ આ અંગે ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, પૃથ્વી પરના સૌથી મોટા રેઈન ફોરેસ્ટમાં આગનો સતત વધારો સમગ્ર વિશ્વ માટે એક મોટો સંકેત છે. આ ભવિષ્યમાં માનવ જીવન માટે મોટો ખતરો બની શકે છે. એમેઝોનના કેટલાય કિલોમીટરમાં ફેલાયેલું જંગલ પૃથ્વી પર સૌથી વધુ ઓક્સિજન પ્રદાન કરે છે. ઘણી વખત વૈજ્ઞાનિકોએ પણ તેમાં લાગેલી આગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ આગ ગત વર્ષે જુલાઈમાં 4,977ની સરખામણીએ આ વખતે 5,373 સુધી ફેલાઈ ગઈ છે.

કોમનવેલ્થ સંક્ષિપ્ત

42 ગોલ્ડ સાથે ઓસ્ટ્રેલિયાના 100 મેડલ્સ પૂરા, પ્રથમ ટીમ



કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જારી રહ્યો છે અને બર્મિંગહામ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયન ટીમ સતત શાનદાર પ્રદર્શન કરીને ટોચના ક્રમે જળવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ વર્તમાન ગેમ્સમાં બુધવારે ઓવરઓલ હાઈએસ્ટ ૧૦૬ મેડલ્સ હાંસલ કર્યા હતા અને ૧૦૦ અથવા તેથી વધુ મેડલ્સ જીતનાર તે એકમાત્ર દેશ બની ગયો છે.

» કોમનવેલ્થ ગેમ્સની મેન્સ વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં મેન્સ ૮૬ કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં વિકાસ ઠાકુરે કુલ ૩૪૦ કિલોગ્રામ વેઈટ ઉચકીને સિલ્વર મેડલ જીત્યો હતો.

» કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ની વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં મહિલા વેઈટલિફ્ટર હરજિન્દર કૌરના બ્રોન્ઝના સ્વરૂપે ભારતે સાતમો મેડલ હાંસલ કર્યો હતો.



» કોમનવેલ્થ ગેમ્સની બેડમિન્ટન ઈવેન્ટમાં પીવી સિંધુએ કોઈ પણ મુશ્કેલી વિના માલદીવની ફાતિમાથ નાબાહાને ૨૧-૪, ૨૧-૧૧ના સ્કોરથી હરાવીને વિમેન્સ સિંગલ્સના રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશ કરી લીધો હતો.

» ટ્રેક એન્ડ ફિલ્ડ એથલેટિક્સમાં ભારતની સ્પ્રિન્ટર હિમા દાસે ધીમી શરૂઆત કર્યા બાદ વિમેન્સ ૨૦૦ મીટર હિટ-૨માં ૨૩.૪૨ સેકન્ડના સમય સાથે સેમિફાઇનલમાં પહોંચી ગઈ હતી.

» ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સની વિમેન્સ ટી૨૦ ક્રિકેટની મહત્ત્વપૂર્ણ મેચમાં શાનદાર દેખાવ કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતે બાબાડોસને ૧૦૦ રનના જંગી માર્જિનથી પરાજય આપ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022

5 ગોલ્ડ, 6 સિલ્વર, 8 બ્રોન્ઝ સાથે ભારત 7 ક્રમે

કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે શરૂઆતના તબક્કે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે. ગુરુવાર સુધીમાં આ એથલેટ્સે 19 મેડલ મેળવી લીધા હતા. વિવિધ રમતોમાં ખેલાડીઓના અદભૂત ઉત્સાહને કારણે આ વર્ષે મેડલ મળવાની સંખ્યા વધુ રહેશે. તેવી આશા બંધાઈ છે.

ટેબલટેનિસમાં હરમીત દેસાઈ, સાથિયાન અને શરયની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો


ભારતની મેન્સ ટેબલટેનિસ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. મેન્સ ટીમે ફાઇનલમાં સિંગાપોરને રસાકસી બાદ ૩-૧ના સ્કોરથી હરાવીને ભારતને ઓવરઓલ ૧૧મો મેડલ અપાવ્યો હતો. સાથિયાન, હરમીત દેસાઈ તથા શરય કમલની ટીમે હરીફ ટીમનો જોરદાર મુકાબલો કર્યો હતો. ટીમ ઈવેન્ટના પ્રથમ ડબલ્સ મુકાબલામાં સાથિયાન અને હરમીતની જોડીએ સિંગાપોરના યાંગ યેક અને યૂ પેંગની જોડીને હરાવી હતી.

લોન બોલ્સમાં ભારતનો ઐતિહાસિક વિજય


ભારતની વિમેન્સ ફોર્સ ટીમે (લવલી ચોબે, પિંકી, રુપા રાની અને નયનમોની સૈકિયા) કોમનવેલ્થ ગેમ્સની લોન બોલ્સ ઈવેન્ટમાં દેશને પ્રથમ ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારતીય ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાના રસાકસી બાદ ૧૭-૧૦ના સ્કોરથી પરાજય આપ્યો હતો. લોન બોલ્સમાં ભારતનો આ પ્રથમ કોમનવેલ્થ મેડલ છે. ભારતીય ટીમે ફાઇનલમાં એક સમયે ૮-૨ની એકતરફી લીડ મેળવી હતી.

મીરાબાઈ યાનૂ, સંકેત-ગુરુરાજા ભારતના 'બાહુબલી' બન્યા: ત્રણ મેડલ અપાવ્યા


કોમનવેલ્થ ગેમ્સની વેઈટલિફ્ટિંગમાં ભારતે ત્રણ મેડલ્સ મેળવ્યા હતા. મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ યાનૂએ ૪૯ કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં ઓલટાઈમ રેકોર્ડ નોંધાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સંકેત સરગરે કોણીમાં ઈજા થઈ હોવા છતાં મેન્સ ૫૫ કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ અને ગુરુરાજા પૂજારીએ ૬૧ કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.

વેઈટલિફ્ટિંગમાં ભારતનો દબદબો, હાઈએસ્ટ 10 મેડલ્સ જીત્યા

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ધીમી શરૂઆત કરી હતી. ગેમ્સ તેના લગભગ તેના અંત ભાગમાં આવી ગઈ છે અને ભારતીય એથલેટ્સ વિવિધ ઇવેન્ટમાં મેડલ જીતી રહ્યા છે. ભારતે વેઈટલિફ્ટિંગમાં પ્રથમ દિવસથી જ ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને ત્રણ મેડલ્સ જીત્યા હતા. આ ઇવેન્ટ પૂરી થઈ ત્યારે

ભારત વેઈટલિફ્ટિંગમાં સર્વાધિક ગોલ્ડ મેડલ સાથે હાઈએસ્ટ મેડલ્સ જીતનાર દેશ બની ગયો છે. ભારતે વેઈટલિફ્ટિંગમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતે સંકેત સરગરથી શરૂઆત કરી હતી અને ગુરુદીપસિંહના મેડલ સાથે આ ઇવેન્ટનું સમાપન કર્યું હતું.

ભારત ૭૮ દેશની આ ઇવેન્ટમાં નંબર-૧ રહ્યું છે અને અન્ય કોઈ દેશ આટલા મેડલ્સ જીતી શક્યું નથી. ભારતે ૨૦૧૮ની ગેમ્સમાં પાંચ ગોલ્ડ સાથે નવ મેડલ્સ જીત્યા હતા પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું છે. બોક્સે ભારતે બે ગોલ્ડ મેડલ પણ ગુમાવ્યા છે.

જૂડોમાં સુશીલાદેવીને સિલ્વર, વિજયકુમારને બ્રોન્ઝ

વેઈટલિફ્ટિંગ બાદ ભારતને જૂડોની ઇવેન્ટમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જૂડો સુશીલાદેવીએ ૪૮ કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ મળ્યો હતો. બીજા તરફ મેન્સ જૂડોમાં વિજયકુમારે ૬૦ કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં સ્કોટલેન્ડના ડિનલાન મુનરોને રેપચેન્જ દ્વારા હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

બિંદિયારાનીએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારતની બિંદિયારાની દેવીએ વેઈટલિફ્ટિંગમાં ૫૫ કિલોગ્રામ કેટેગરીમાં રેકોર્ડ બનાવતા સિલ્વર મેડલ જીતી લીધો હતો. બિંદિયારાનીએ કુલ ૨૦૨ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું, જેમાં ૮૬ કિલો તેમણે સ્નેચ ઇવેન્ટમાં અને ૧૧૬ કિલોગ્રામ કલીન એન્ડ જર્કમાં ઉઠાવ્યું હતું.

શિઉલી અચિંતાએ રેકોર્ડ સર્જીને વેઈટ લિફ્ટિંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યો

ભારતના યુવા વેઈટલિફ્ટર અચિંતા શિઉલીએ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ની વેઈટલિફ્ટિંગ સ્પર્ધાના ૭૩ કિલોગ્રામ વજન ગ્રૂપમાં નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. અચિંતાએ કુલ ૩૧૩ કિલોગ્રામ વજન ઉચકીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ સાથે ભારતે વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અચિંતાએ સ્નેચમાં ૧૪૩ અને કલીન એન્ડ જર્કમાં ૧૭૦ કિલોગ્રામ વેઈટ ઉચક્યું હતું.


હાઈ જમ્પમાં તેજસ્વિની શંકરને બ્રોન્ઝ મળ્યો ભારતે ટ્રેક એન્ડ ફિલ્ડનો પ્રથમ મેડલ જીત્યો

હાઈ જમ્પર તેજસ્વિની શંકરે (બ્રોન્ઝ મેડલ) ૨.૨૨ મીટરના જમ્પ સાથે હાઈ જમ્પ ઇવેન્ટમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સની ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારતનો આ પ્રથમ મેડલ છે. આ ઉપરાંત હાઈ જમ્પમાં પણ ભારતે કોમનવેલ્થના ઇતિહાસમાં ઐતિહાસિક મેડલ મેળવ્યો છે. તેજસ્વિનીને ગેમ્સ પહેલાં ભારતીય એથલેટિક ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો પરંતુ દિલ્હી હાઈકોર્ટના આદેશના કારણે છેલ્લી ઘડીએ તેને જવાની તક મળી હતી.

ઈજાગ્રસ્ત હોવા છતાં જેરેમીએ વેઈટલિફ્ટિંગમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો

ભારતને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગમાં જેરેમી લાલરિનુંગાએ ૬૭ કિલોગ્રામ વર્ગમાં ઇતિહાસ રચી દીધો છે. જેરેમીએ ૩૦૦ કિગ્રા વજન ઉઠાવીને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મિઝોરામના રહેવાસી ૧૯ વર્ષીય જેરેમીએ સ્નેચ રાઉન્ડમાં ૧૪૦ કિલો અને કલીન એન્ડ જર્કમાં ૧૬૦ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. તે આ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે.

ભારતીય ટીમને આખરે USના વિઝા મળ્યા, છેલ્લી બંને ટી૨૦ ફ્લોરિડામાં

પોર્ટ ઓફ સ્પેન

છેલ્લા કેટલાક દિવસની અનિવૃત્તિ બાદ આખરે ભારતીય ક્રિકેટ ટીમને અમેરિકાના વિઝા મળ્યા છે અને ફ્લોરિડા ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી છેલ્લી બંને ટી૨૦ મેચો રમાશે. ભારતના કેટલાક ખેલાડીઓને યુએસએના વિઝા મળ્યા નહોતા જેના કારણે છેલ્લી બે મેચો ઉપર પ્રસ્નાર્થ થયો હતો. હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને સત્તાવાર રીતે અમેરિકાનો પ્રવાસ ખેડવાની મંજૂરી મળી ગઈ છે. બંને ટીમો વચ્ચે સમાહના અંતે છટ્ટી અને સાતમી ઓગસ્ટે બે ટી૨૦ મેચો રમાશે. ગુયાના સરકારના

હસ્તક્ષેપ બાદ કેટલાક ખેલાડીઓ તથા બંને ટીમના સહાયક સ્ટાફના વિઝા સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓને ઉકેલ આવી ગયો હતો. ત્રીજી ટી૨૦ પૂરી થયા બાદ તમામ ખેલાડીઓ ગુયાનાના જ્યોર્જ ટાઉનમાં આવી ગયા હતા અને ખેલાડીઓનો અમેરિકન દૂતાવાસમાં ઈન્ટરવ્યૂ થયો હતો જેમાં સુકાની રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ સામેલ હતા. ભારતીય ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા, અશ્વિન, દિનેશ કાર્તિક, રવિ બિશ્નોઈ, સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ પહેલાંથી માયામી પહોંચી ચૂક્યા છે અને તેમની પાસે વિઝા હતા.

ઓસી.-સાઉથ આફ્રિકા સામેની ભારતીય હોમ સિરીઝનો કાર્યક્રમ જાહેર નવી દિલ્હી

BCCIએ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઘરઆંગણે રમાનારી શ્રેણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે મોહાલી ખાતે ૨૦મી સપ્ટેમ્બર, નાગપુર (૨૩મી) અને હૈદરાબાદ (૨૫મી) ખાતે ત્રણ ટી૨૦ મેચની શ્રેણી રમશે. ત્યારબાદ સાઉથ આફ્રિકા સામે ત્રિવેન્દ્રમ ખાતે પ્રથમ ટી૨૦ (૨૮મી સપ્ટેમ્બર) રમશે. ગુવાહાટી ખાતે બીજી ઓક્ટોબરે તથા ઈન્દોર ખાતે ત્રીજી ઓક્ટોબરે બીજી અને ત્રીજી ટી૨૦ મેચ રમાશે.

એશિયા કપમાં ૨૮મી ઓગસ્ટે ભારત-પાક. વચ્ચે મુકાબલો થશે

નવી દિલ્હી

એશિયા કપ ટી૨૦ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે અને પરંપરાગત હરીફ ભારત તથા પાકિસ્તાન વચ્ચે ૨૮મી ઓગસ્ટે મુકાબલો રમાશે. ભારત અને પાકિસ્તાન બંને એક જ ગ્રૂપમાં છે. ગ્રૂપ-એમાં કુલ ત્રણ ટીમો છે જેમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ક્વોલિફાઈંગ રાઉન્ડ જીતનાર ટીમને આ ગ્રૂપમાં સ્થાન મળશે. શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ગ્રૂપ-બીમાં રાખવામાં આવ્યા છે. યુએઈ ખાતે આ ટૂર્નામેન્ટ ૨૭મી ઓગસ્ટથી ૧૧મી સપ્ટેમ્બર રમાશે અને કુલ ૧૩ મેચો રમાશે. એશિયા કપની યજમાની પહેલાં શ્રીલંકાને મળી હતી

પરંતુ ત્યાંની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ટૂર્નામેન્ટને યુએઈ ખાતે શિફ્ટ કરવામાં આવી છે. ૧૯૮૪થી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ ૨૦૧૪ સુધી ૫૦ ઓવરની ફોર્મેટમાં રમાતી હતી. ૨૦૧૬માં ટી૨૦ વર્લ્ડ કપના કારણે તેને પણ સૌથી નાની ફોર્મેટમાં બદલી નાખવામાં આવી છે. ૨૦૧૮માં ફરીથી વન-ડે ફોર્મેટમાં રમાઈ હતી અને રોહિત શર્માના નેતૃત્વમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. ભારત ૩૧મી ઓગસ્ટ ક્વોલિફાયર ટીમ સામે રમશે. ગ્રૂપ તબક્કા બાદ સુપર-૪ રાઉન્ડ રમાશે અને બે સર્વશ્રેષ્ઠ ટીમ ફાઇનલમાં પહોંચશે. ભારતીય સમયાનુસાર તમામ મુકાબલા સાંજે ૭:૩૦ કલાકથી શરૂ થશે.

પવિત્ર શ્રાવણ માસમા કરો રાશિ અનુસાર શિવ પૂજન

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે રાજ્યમાં શિવ મંદિરો-શિવાલયો હર..હર..મહાદેવ, ઐ નમઃ શિવાય, મહામૃત્યુંજયના જાપથી ગુંજી ઊઠ્યા છે. શિવભક્તો માટે બિલિપત્ર ચઢાવી ભોળાનાથને પ્રસન્ન કરવાનો મહામૂલો અવસર છે. દેવાધિદેવ મહાદેવને રીજવવા પૂજન-અર્ચન માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્કંદ-પુરાણોમાં શ્રાવણ માસ અને તેમાંય સોમવારે ભોળાનાથની પૂજાનું વિશેષ માહાત્મ્ય વર્ણવાયું છે.

શ્રાવણમાં શિવ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. શિવપૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ જશે. એટલું જ નહિ જો કુંડળીમાં આ ગ્રહ દોષ હોય અને કાર્યોમાં વિઘ્ન આવતું હોય તો રાશિ અનુસાર મહાદેવની કરો પૂજા અર્ચના.

■ **મેષ રાશિ** : શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવજીને આંકડાના ફૂલ ચડાવવા ખેઈએ. આ રાશિનો સ્વામી મંગળ છે એટલે શિવજીને લાલ ફૂલ અર્પણ કરવા ખેઈએ.

■ **કન્યા રાશિ** : સોમવારે શિવલિંગ પર બિલીપત્ર ચડાવો. દૂધ અને કેસરનો અભિષેક કરો. રૂદ્રાક્ષ ધારણ કરવાથી થશે ફાયદો

■ **વૃષભ રાશિ** : આ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રાચાર્યને અસુરોના ગુરૂ માનવામાં આવે છે. અંતિમ સોમવારે શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કરવો ખેઈએ.

■ **મિથુન રાશિ** : અંતિમ સોમવારે શિવલિંગ

પર 5 મિલવપત્ર ચડાવી દો. બુદ્ધને પ્રસન્ન કરવા ગાયને લીલું ઘાસ ખવડાવો.

■ **કર્ક રાશિ** : શ્રાવણના અંતિમ સોમવારે શિવજીને ચંદન અને અક્ષત ચડાવો.

■ **સિંહ રાશિ** : શિવલિંગને મધથી અભિષેક કરો. ગણેશજીને દૂર્વા ચડાવો.

■ **તુલા રાશિ** : શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવજીને માખણ અને મિસરીનો ભોગ લગાવો. આ રાશિનો સ્વામી શુક્ર છે.

■ **વૃશ્ચિક રાશિ** : અંતિમ સોમવારે શિવલિંગ પર કાચા દૂધને અર્પણ કરો. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે.

હનુમાનજી શિવજીના અંશાવતાર છે. આથી મસુરની દાળ ગરીબને દાનમાં આપવી.

■ **ધન રાશિ** : સોમવારે શિવલિંગ પર બિલીપત્ર ચડાવો. આ રાશિનો સ્વામી દેવતાઓનો ગુરૂ બ્રહ્મસ્પતિ છે. શિવલિંગ પર પીળા રંગની વસ્તુઓ પીળુ ફૂલ ચડાવો. પ્રસાદમાં લાડુ ધરાવો.

■ **મકર રાશિ** : શિવલિંગ પર ત્રાંબાના જળથી અભિષેક કરો. અડદનું દાન કરો.

■ **કુંભ રાશિ** : શ્રાવણના અંતિમ સોમવારે કેસર અને દૂધથી અભિષેક કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

■ **મીન રાશિ** : અંતિમ સોમવારે શિવજીને અક્ષત અને ચંદન લગાવો. બ્રહ્મસ્પતિ ગ્રહને પ્રસન્ન કરવા સોમવારે હળદર અને ચોખાનું દાન કરો. ભોલેનાથને ક્યારેય ભૂલથી પણ હળદર ન ચડાવો. શિવજીને બેસનના લાડુનો ભોગ ધરાવી પ્રસાદ અર્પણ કરો.



ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું પર્વ એટલે રક્ષાબંધન

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઊજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન તા. 11-08-2022ને ગુરુવારના રોજ આવે છે. ભગવાને માણસ જાતને અનેક સંબંધો જીવનમાં આપ્યા છે. પણ સૌથી સારો અને પવિત્ર સંબંધ ભાઈ બહેનનો હોય છે. કહેવાય છે કે ભાઈ-બહેનનો લોહીનો સંબંધ છે. જે બિલકુલ નષ્ટ જેવો છે જેને તમે ઈચ્છો તો પણ ચામડીથી અલગ નથી કરી શકતા. ઠીક એજ રીતે આ સંબંધનો પ્રેમ અને વિશ્વાસ હોય છે. ભાઈ-બહેનના આ જ પ્રેમ અને મહત્વને દર્શાવવા માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવામાં આવે છે.

આ દિવસ બહેનો માટે પોતાના અને માનેલા ભાઈને રાખડી બાંધવાનો દિવસ છે. બહેન અંતરના પ્રેમના ધાગાથી રાખડી બાંધીને પોતાના ભાઈના જીવનની રક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શ્રદ્ધા અને

લાગણીથી ગૌરવ પ્રદાન કરે છે.

આજે બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો દિવસ, બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપારધંધો કરનારા માટે સમુદ્રપૂજનનો દિવસ છે. આમ ત્રણ ઉત્સવોનો આજે સુભગ સમન્વય થાય છે.

પૌરાણિક કથા મુજબ વામનરૂપ ધારણ કરીને દાનવીર ગર્વિષ્ઠ બલિરાજા આદરેલા યજ્ઞમાં હાજર થયેલા ભગવાન વિષ્ણુએ દક્ષિણામાં ત્રણ ડગલાં પૃથ્વી માંગી. પ્રથમ પગલે સમગ્ર પૃથ્વી માંગી. દ્વિતીય પગલે સ્વર્ગ અને બાકીનું ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો. પ્રભુનાં આ કપટથી દુઃખી થયેલા લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય તે માટે તેમના હાથે રાખડી બાંધેલી. આ પ્રસંગને યાદમાં 'બળેવ'નો તહેવાર ઉજવાય છે. 'બલિ' પરથી 'બળેવ' શબ્દ પ્રચલિત બન્યો હતો.

જનોઈ બદલવાનો દિન

રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની પરંપરા છે. યજ્ઞોપવીત ધારણ કરવાના સંસ્કારને ઉપનયન સંસ્કાર કહેવાય છે. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું. અર્થાત્ જે સંસ્કારથી શિષ્યને ગુરુની પાસે લઈ જવામાં આવે તે સંસ્કારને ઉપનયન સંસ્કાર, યજ્ઞોપવીત સંસ્કાર કહેવાય છે. ઉપનયન એ દિવ્ય સંસ્કાર છે. તેના દ્વારા માનવનો નવો જન્મ થાય છે. ઉપનયન સંસ્કાર એટલે તેજસ્વી જીવનની દીક્ષા. જનોઈ વખતે બટુકને લંગોટી પહેરાવવામાં આવે છે.

પૂનમ અને સમુદ્રપૂજન

આ દિવસે વેપારીઓ-સાગરખેડુઓ સમુદ્રદેવને પૂજે છે. સમુદ્ર ઉપર સત્તા ચલાવનાર અદિષ્ઠાતા દેવ વરુણદેવનું પૂજન કરે છે. માલ વહાણોમાં આવતો હોય તે વહાણોને કુદરતી આફત ન આવે તે માટે ખાસ નાળિયેરી પૂર્ણિમાએ સમુદ્રનું પૂજન કરવામાં આવે છે. ફૂલ અને નાળિયેર અર્પણ કરે છે. રક્ષાબંધનથી સમાજનું ભાવજીવન પુષ્ટ કરતો તેમજ સાગરપૂજનથી વૈયક્તિક જીવનની મહાનતાનાં શિખરોનું દર્શન કરાવતો ત્રિવેણીસંગમ સમો આ ઉત્સવ આપણને સહુને પાવન કરશે.

ટોરન્ટો સ્વામિનારાયણ મંદિરનો 8મો પાટોત્સવ રંગેચંગે સંપન્ન

શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ (S S S S Mandal) કેનેડા દ્વારા સંચાલિત ટોરોન્ટો શ્રી સ્વામિનારાયણ મંદિરનો 8મો વાર્ષિક મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અત્યંત હર્ષોલ્લાસ સાથે યોજાયો

ટોરન્ટો

કિંગ્સ્ટન રોડ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરન્ટોનો 8મો વાર્ષિક પાટોત્સવ તારીખ 30 જુલાઈ શનિવારના રોજ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જીતેન્દ્રીપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમના સંત મંડળ સહિત પધાર્યા હતા. આ પ્રસંગે સર્વોપરીશ્રી સ્વામિનારાયણ ઘનશ્યામ મહાપ્રભુ, શ્રીજી સંકલ્પમૂર્તિ, શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા શ્રી સ્વામિનારાયણ મંદિરના આઘ આચાર્યશ્રી ગુરૂજીવી સ્વામીબાપા મહારાજનું ખોડશોપચાર સહિત અર્ચન-પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગૃહોના અધિત સત્સંગી યુવાનો તથા બાળકોના સાંસ્કૃતિક નૃત્ય, કિર્તન ભક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જીતેન્દ્રીપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળ સહિત પધારતા તેમનું અત્રેના યુવક મંડળ દ્વારા નિર્ઝન ડ્રમ બેન્ડ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટોરોન્ટોના M.P.P. તથા એમ.પી. તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. અને વિશાળ સંખ્યામાં ભાવિક હરિભક્તો હાજર રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આમ ખૂબ જ ભક્તિભાવપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો.



On this auspicious event we have a guests Sants from BAPS Sanstha and a guests from Yogi Divine Society.

વેદમૂર્તિ આચાર્ય પૂષ્પાતિતી પ્રિયદાસજીના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ

શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ (SSS કેનેડા) ટોરોન્ટો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમે વારસદાર (પ્રેમ-મૂર્તિ) વેદમૂર્તિ આચાર્ય શ્રી પુષ્પાતિમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ તા. 28 જુલાઈ 2022ને ગુરુવારના રોજ નાયગ્રા ટ્રાવેલ્સ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના વર્તમાન આચાર્યશ્રી જીતેન્દ્રીપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય સંતો તતા નોર્થ અમેરિકાના વિશાળ સંખ્યામાં સત્સંગી હરિભક્તો હાજર રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના વર્તમાન આચાર્ય જીતેન્દ્રીપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સૌ પ્રથમ પ્રેયમૂર્તિ સ્વામીજીબાવળા અસ્થિ સુમન કળશનું પૂજન આરતી કરી હતી. ત્યારબાદ પૂજનીય સંતો તથા તમામ હરિભક્તો ભાઈ-બહેનોએ પણ અસ્થિ સુમન કળશ પૂજન કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ વર્તમાન આચાર્યશ્રી જીતેન્દ્રીપ્રિયદાસજી મહારાજે અસ્થિ સુમનનું નાયગ્રા ફોલ્સના પાણીમાં વિસર્જન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હરિભક્તો હાથ જોડી શ્રી સ્વામિનારાયણ મહામંગલી ધૂન તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કિર્તન ભક્તિ કરી હતી. આમ સમગ્ર કાર્યક્રમ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.



HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.



CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- ☞ **Free Staging**
- ☞ **Free Professional Photography & virtual tour**
- ☞ **Free Marketing, Flyers, Newspapers, Media Advertising**
- ☞ **Free Comparative Market Analysis**
- ☞ **Team of Professional for same price as hiring a single realtor**
- ☞ **Over 15 years of combined experience**



3+1 Bedrooms, 4 bathrooms
Welcome To 23 Ventris Dr. Beautiful Home In A Desirable Central West Community. Freshly Painted, Newer Kitchen With Quartz Countertop, Island With Breakfast Bar. W/O To Fully Fenced-In Oasis Backyard With 2 Tiered Deck & Beautiful Garden, Perfect To Entertain Guests, Hardwood Flooring, Potlights (Inside And Outside Of The Home), New Kitchen In The Bsmt, Spacious Bedrooms. Sep. Ent To The Bsmt Thru The Garage To A 1 Bedroom In-Law Suite. Close To Hwy401, Plaza, Walking Distance To P.School.



Spacious 3 Bedrooms Condo With Unobstructed View Of Frenchman's Bay & Lake Ontario. Master W/Walk In Closet & 3Pc Ensuite. Great For First Time Home Buyers, new flooring in Living/Dining room. Amazing lake view. Steps To Pickering Go, Pickering Town Centre, Parks. Minutes To Hwy 401 And Many Amenities.



15 Yr Old Large 3+1 Bedroom 4 Washroom Semi-Detached Built By Monarch! Entertainment-Sized Great Room With Walk-Out To A Huge Backyard With Patio! Approx 2,000 Sq.Ft. Hardwood Floor On Main, 2nd Flr & Stairs. Stainless Steel Appliances. Finished Basement With 3 Pc Ensuite Bath. Ensuite Laundry, Direct Garage Entry! Near Warden Station, Close To Downtown, Shopping Malls, Worship Place.

- ◆ **No Pressure**
- ◆ **No Obligation**
- ◆ **Just Answers to Your Questions... Its that Simple!**



You have Nothing to Loose... Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team, Because... Teamwork Makes Your Dreams Work !

Shamim & Amin Kharodia

Broker of Record / Sales Representative
teamkharodia@gmail.com

300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941

F: (416) 298-8303 | P: (647) 666-8676



Grand Centurion Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.

PANCHVATI SUPERMARKET

www.panchvatisupermarket.ca

**OPENING SOON
OSHAWA**

1053 Simcoe Steet North
Oshawa L1G 4X1



રક્ષાબંધન નિમિત્તે રાખડી,
મીઠાઈઓ, ગીફ્ટ બોક્સ
તેમજ પૂજની સામગ્રી મળશે
તો આજે જ લાભ ઉઠાવો



સર્વે ભાઈ
અને બહેનોને
રક્ષાબંધનની
શુભકામના



MISSISSAUGA

169 Dundas St. E,
Unit# 1 to 4, Mississauga,
ON L5A 1W8
Call : 905-232-3955

BRAMPTON

8814 The Gore Road,
Unit 4-8, Brampton,
ON L6P 0B1
Call : 905-794-5372

SCARBOROUGH

2141 Ellesmere Road,
Behind Scotia Bank
Scarborough, ON M1G 3M6
Call : 416-439-9393

ETOBICOKE

3-45 Woodbine Downs Blvd,
Etobicoke,
ON M9W 6N5
Call : 416-213-9394

AJAX

18, Harwood Ave.
South, Ajax,
ON L1S 6N2
Call : 905 426 2499

SCARBOROUGH

1255 Markham Rd, Scarborough, ON M1H 2Z5 · Call : 416-289-6988